

વર્ષ : ૪૩ ♦ અંક : ૧૨  
ડિસેમ્બર - ૨૦૧૯

શાલ્લેય સંતશ્રી આત્માનંદજી પ્રેરિત

Retail Price Rs. 10/- Each

# દિવ્યધ્વનિ



શ્રીમદ્ રાજ્યાંકર આદ્યાત્મિક સાધના કેન્દ્ર

(ક્રી સત્યુત - સેવા - સાધના કેન્દ્ર સંચાલિત)

કોણા ઢેર ૦૦૭. (નિ. ગાંધીનગર, ગુજરાત)

ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૬, ૨૩૨૭૬૪૮૩-૮૪

E-mail : mail@shrimadkoba.org, Web.: www.shrimadkoba.org

**સંસ્થામાં યોજાયેલ ડિસેમ્બરની આધ્યાત્મિક શિબિર વેળાની તસવીરો**  
(તા. ૦૧-૧૨-૨૦૧૬ થી તા. ૦૩-૧૨-૨૦૧૬)



**-: પ્રેરક :-**

શ્રીદેયશ્રી આત્માનંદજી  
કેંદ્ર

**-: તંગી - સંપાદક :-**

શ્રી મિતેશ એ. શાહ  
ફોન : (૦૭૯) ૨૭૫૦૩૬૫૬

**-: સ્વત્પાધિકારી :-**

શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક  
સાધના કેન્દ્ર  
(શ્રી સત્શુત-સેવા-સાધના કેન્દ્ર  
સંચાલિત)  
કેંદ્ર

**-: મુદ્રક-પ્રકાશક :-**

ડૉ. શ્રી શર્મિષ્ઠાબેન એમ. સોનેજી  
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક  
સાધના કેન્દ્ર, કોબા  
કેંદ્ર

**-: પ્રકાશન સ્થળ :-**

શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક  
સાધના કેન્દ્ર  
કોબા - ૩૮૨ ૦૦૭  
ફોન : (૦૭૯) ૨૩૨૭૬૨૧૮  
૨૩૨૭૬૪૮૩/૮૪  
ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૧૪૨  
કેંદ્ર

**-: લવાજમ શ્રેણી :-**

ભારતમાં  
ત્રિવાર્ષિક રૂ. ૪૦૦  
આજીવન રૂ. ૨૦૦૦  
પરદેશમાં  
By Air Mail  
ત્રિ-વાર્ષિક : Rs. 4000  
\$-80, £-60  
આજીવન : Rs. 15000  
\$-300, £-220

# દિવ્યધ્વનિ

**અનુક્રમણિકા**

(૧)	શ્રી સદ્ગુરુપ્રસાદ .....	શ્રીમદ્ રાજચંદ્રજી .....	૫
(૨)	આત્મજ્ઞાન પ્રામિના મુખ્ય વિઘ્નો .....	..... પૂજયશ્રી આત્માનંદજી .....	૬
(૩)	અંતરાત્માની પાઈશાળા .....	..... ડૉ. કુમારપાળ દેસાઈ .....	૧૦
(૪)	શ્રી સમાધિતંત્ર અમૃતરસપાન .....	.....પ્રા. ચંદાભેન પંચાલી .....	૧૨
(૫)	શ્રી અમિતગતિ સામાયિક પાઠ ..	પૂજય બહેનશ્રી .....	૧૪
(૬)	શ્રી દેવચંદ્રજી ચોવીશી .....	શ્રી અશોકભાઈ શાહ .....	૧૭
(૭)	સમ્યક્ તપ .....	બા.બ્ર. શ્રી સુરેશજી .....	૨૦
(૮)	શ્રી કલ્યાશમંદિર સ્તોત્ર ..	શ્રી મહેન્દ્રભાઈ ખંધાર .....	૨૩
(૯)	જળ એ જ જીવન ..	શ્રી પારુલબેન ગાંધી .....	૨૭
(૧૦)	અમૃતમહોત્સવની અનોખી ઉજવણી .....	..... શ્રી મહેન્દ્રભાઈ ખંધાર ...	૨૮
(૧૧)	પુસ્તક સમાલોચના .....	શ્રી મિતેશભાઈ શાહ ...	૩૧
(૧૨)	બાળ વિભાગ .....	શ્રી મિતેશભાઈ શાહ ....	૩૨
(૧૩)	સમાજ-સંસ્થા દર્શન .....	..... ૩૪	

**વર્ષ : ૪૩ ડિસેમ્બર, ૨૦૧૬ અંક - ૧૨**



શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેંદ્ર  
(શ્રી સત્શુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત)  
કોબા - ૩૮૨ ૦૦૭ (જી. ગાંધીનગર, ગુજરાત)  
ફોન: (૦૭૯) ૨૩૨૭૬૨૧૮/૪૮૩/૮૪  
mail@shrimadkoba.org, www.shrimadkoba.org

**Bank Detail : Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra**  
**Name of Bank : Kotak Mahindra Bank**  
**Branch : Chandkheda, Ahmedabad - 382424.**  
**A/c. No. : 08390020000044 • IFS Code : KKBK0000839**

દિવ્યધ્વનિ ફોન : ૨૩૨૭૬૨૧૮/૪૮૩/૮૪ • ૦૭૯ ૨૩૨૭૬૨૧૮/૪૮૩/૮૪

3

## લેખકો / ગ્રાહકો / વાચકોને

- ⇒ ‘દિવ્યધનિ’ દર મહિને પ્રગટ થાય છે.
- ⇒ કોઈ પણ અંકથી ગ્રાહક થઈ શકાય છે.
- ⇒ ગણ વર્ષથી ઓછી મુદ્દતનું લવાજમ સ્વીકારવામાં આવતું નથી.
- ⇒ ચેક/ડ્રાઇટ/એમ.ઓ. ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા’ના નામનો મોકલવો.
- ⇒ સહુ સ્વજનો-મિત્રો વધુમાં વધુ ગ્રાહકો નોંધાવીને સહયોગી બને તેવી વિનમ્ર અપેક્ષા છે.
- ⇒ ગ્રાહકોએ પત્રવ્યવહારમાં પોતાનો ગ્રાહક નંબર અને પૂરું સરનામું અવશ્ય લખવું. ગ્રાહક નંબર સરનામાની ઉપર લખોલો હોય તે નોંધી રાખવા વિનંતી છે.
- ⇒ સરનામામાં ફેરફાર થાયાની જીણ તાત્કાલિક કરવા વિનંતી છે.
- ⇒ કોઈપણ લેખ સ્વીકારવો કે ન સ્વીકારવો કે કમશઃ લેવો તેનો સંપાદકશ્રીને સંપૂર્ણ અધિકાર રહેશે.
- ⇒ લેખકોનાં મંત્ર્યો સાથે સંપાદકશ્રીનું સહમત હોવું આવશ્યક નથી.



: મુદ્રણસ્થાન :

ભગવતી ઑફસેટ

૧૫/સી, બંસીધર અર્સ્ટેટ, બારડોલપુરા,  
અમદાવાદ - ૩૮૦ ૦૦૪  
ફોન : ૨૨૧૬ ૭૬૦૩



## પ્રાર્થના

નૂતન વર્ષની શુભકામના

એક મહાસતીજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે, “બારમાંથી ચાર જાય તો શું રહે?” આ પ્રશ્નનો જવાબ એમણે પોતે જ આઘ્યો છે કે, “બાર માંથી ચાર જાય તો શૂન્ય રહે.”

આ વાતને સમજાવતાં એમણે કહ્યું હતું કે - “વર્ષના બાર મહિનામાંથી જો ચોમાસાના ચાર મહિના બાદ કરીએ તો બાકી શું બચે ?” કંઈ જ નહીં ! ચોમાસામાં વરસાદ પડે છે તેનો સંગ્રહ કરવામાં આવે છે. તેનાથી પાક ઉગે છે, પાણી મળે છે અને જીવોનો વ્યવહાર સારી રીતે ચાલે છે. અનંતકાળના પરિભ્રમણ પદ્ધી આપણા જીવનમાં આવી વર્ષાત્મક આવી છે ! અનંતકાળના અંધકાર પદ્ધી આપણા જીવનમાં સોનાનો સૂરજ ઊંઘ્યો છે ! વીતરાગનો ધર્મ, પરમકૃપાળુદેવનું શરણ અને પ્રત્યક્ષ સદ્ગુરુદેવના ચરણ, સત્યદેવ, સદ્ગુરુ અને સત્યધર્મની પ્રાપ્તિ આપણને મહત્ત્વ મહત્ત્વ પુણ્યના ઉદ્યથી થઈ છે. વધારેમાં વધારે પંદર ભવનું પરિભ્રમણ બાકી રહે એવો સુયોગ આપણને સાંપડ્યો છે.

આ નૂતનવર્ષે આપણે આપણું જીવન સર્જણ કરી શકીએ એવી પરમકૃપાળુદેવ પાસે યાચના કરીએ, એવી ભાવના ભાવીએ અને પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે આશીર્વાદ માંગીએ એ જ અભ્યર્થના.

“સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો; સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.”

સત્પુરુષોનું યોગબળ જગતના

જીવોનું કલ્યાણ કરો.

॥ ઽં શાંતિઃ શાંતિઃ શાંતિ: ॥

# શ્રી સદગુરુપ્રસાદ

## શ્રીમદ્ રાજયંત્રજી

પત્રાંક-૭૮૩

શ્રી સોભાગની મુમુક્ષુ દર્શા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે.

સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે.


જન્મ, મરણ આદિ અનંત દુઃખનો આત્મંતિક (સર્વથા) કષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પત્તિ થયે જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.

તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રામ થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.

મનુષ્યપણું, જ્ઞાનીનાં વચ્ચનોનું શ્રવણ પ્રામ થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ગ્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે.

પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્ય પ્રયાસે અને અલ્ય કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે.

સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષ્મકાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે. તે



સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.

તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્તાખનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સત્તાખના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રામ કરી શકે છે.

આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ બેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્તાખનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષનાં વચ્ચનાં અથવા સત્તાખનું પરિણામ થવું કઠણ છે.

આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સત્તાખના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.

સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ઘણવું ઘટે છે.

**જે જીવને પ્રત્યક્ષ સત્તસમાગમનો વિશેષ લાભ પ્રામ થાય તે મહત્પુણ્યવાનપણું છે. સત્તસમાગમના વિયોગમાં સત્તાખનો સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા યોગ્ય છે.**

## આત્મજ્ઞાનપ્રાક્ષિના મુખ્ય વિધનો

**પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી**

જીવમાત્રને આનંદ જોઈએ છે અને તે આનંદ આત્મા સિવાય બીજે ક્યાંયથી મળતો નથી પરંતુ ભાંતિથી આ જીવને પર પદાર્થમાં જ મજા આવે છે. ‘મારી પાસે દીકરા-મોટર-હીરા-મોતી આદિ ઘણું છે, આખી હુનિયામાં મારી બોલબાલા છે માટે મારાથી વધારે સુખી આ જગતમાં બીજું કોણ છે ?’ એમ સામાન્ય સંસારી જીવ માને છે. તે જ પ્રમાણે કોઈ સાધકને એમ લાગે કે ‘મારે ઘણા શિષ્યો છે, મેં ઘણા શાસ્ત્રો લખ્યા છે, મેં ઘણા આશ્રમ તથા મંદિર બાંધ્યા છે, મેં ધર્મની ઘણી પ્રભાવના કરી છે - એવી જો તેને અંતરમાં ભોકૃતૃત્વપણા રૂપ શ્રદ્ધાન હોય તો તે જીવ પણ અજ્ઞાની છે. જ્ઞાની દ્વારા શાસ્ત્રની રચના થાય છે પરંતુ જ્ઞાની પોતાને શાસ્ત્રના નિશ્ચયથી કર્તા માનતા નથી. જો આપણે આત્મસિદ્ધિ કરવી હોય એટલે કે સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો ભગવાનની આજ્ઞાનું અનુસરણ કરવું. તેમ કરતાં સાચા આનંદની સાથે-સાથે સાંસારિક સુખરૂપ જૂઠા આનંદની પ્રાપ્ત પણ વિના પ્રયત્ને થઈ જશે. તમને કે મને કોઈપણ જીવને મોક્ષ મળે તે પહેલા સામાન્ય પુણ્ય તથા વિશિષ્ટ પુણ્ય, પુણ્યાનુભધી પુણ્ય પણ સાથે બંધાવું જોઈએ તો જ આપણે એવા નિર્ગંથ મહાજ્ઞાની ગુરુ, વજ્ઞવૃષભનારાચ સંહનન તથા ઉત્તમ પ્રકારના જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકે. આવા તકલાદી શરીરથી મોક્ષે ન જવાય પણ આવા શરીરમાં રહીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને કોઈ પૂર્વભવનો આરાધક જીવ હોય તો તે આ કાળે મુનિપણું પણ પ્રાપ્ત કરે છે. આપણે આત્માના સ્વરૂપને ચારે અનુયોગથી અને વ્યવહાર તથા નિશ્ચયથી સમજ તેને પ્રાપ્ત કરવાનો સાચી દિશામાં ઉધ્યમ કરી શકીએ



તે અર્થે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ સરળભાષામાં ગાગરમાં સાગરરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી. મુમુક્ષુ જીવને આત્મસિદ્ધિ કરવામાં મુખ્ય પાંચ મુદ્રા સહાયકારી છે, જેનું આત્મસિદ્ધિના આધારે આપણે અન્વેષણ કરીશું. આ પાંચ મુદ્રામાં આત્મસિદ્ધિ કરવામાં અંતરાયરૂપ

જીવમાં પહેલ પાંચ મહાદોષ અને આત્મસિદ્ધિ કરવા માટે અનિવાર્ય ગુણોની વિચારણા કરીશું :-

● **સદ્ગુરુ વિના જ્ઞાન થાય નહીં :-** જિજ્ઞાસુ, મુમુક્ષુ, આત્માર્થને પોતાની મેળે આત્મા સમજાય નહીં. આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી જ ગાથામાં શ્રીમદ્જીએ કહ્યું છે,

“જે સ્વરૂપ સમજાય વિના, પાભ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રીસદ્ગુરુ ભગવંત.”

જો કોઈ કહે કે કૃપાળુદેવે આમ કેમ લખ્યું? કારણ કે સદ્ગુરુ અને ભગવાન બતે તો જુદાં છે ! તો ભાઈ, નમસ્કાર મહામંત્રમાં નમો અરિહંતાણાં, નમો સિદ્ધાંશું પછી કાંઈ નીચે લાઈન નથી દોરી. પાંચેય પરમેષ્ઠા પૂજય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ઠા તે ઉત્તમ સદ્ગુરુના પદ છે. કોઈ એમ કહે કે હું તો મારી મેળે આત્મજ્ઞાન અને આત્મસમાપ્તિ પ્રાપ્ત કરી લઈશ તો તે જીવને સમજાવવા માટે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ વચ્ચનામૃત પત્રાંક-૨૦૦ વચ્ચનાવલીના ૧૧માં મુદ્રામાં કહ્યું છે,

“અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.”

આ જમાનાથી ૧૦૦% ઊંધી વાત આ મુદ્રામાં કપાળુદેવે કરી છે. આ જમાનામાં મોટાભાગના લોકોની વિચારસરણી એવી થઈ ગઈ છે કે મારે કોઈ જોઈતું નથી. વ્યવહારજીવનમાં મા-બાપ ન જોઈએ, દીકરા-દીકરી ન જોઈએ, મારા મનને ગમે તેવું જ હું કરીશ! પોતાના સ્વચ્છંદના પોષણ માટે કુતર્ક આપતા કહે કે ‘તત્ત્વાર્થસૂત્ર’માં શ્રી ઉમાસ્વામી મહારાજે કહ્યું છે કે,

### “તત્ત્વિસર્ગાદધિગમાદ્ ।”

માટે મારે કોઈ ગુરુની જરૂર નથી. હું મારી મેળે સાધના કરી આત્મકલ્યાણ કરીશ! પણ ભાઈ તે આ સૂત્રનો ઊંધો અર્થ કર્યો છે. નિસર્જ સમ્યકૃત્વનો અર્થ એવો નથી કે ગુરુની સાધકજીવનમાં કોઈ આવશ્યકતા જ નથી. જેને આ ભવમાં પ્રત્યક્ષ ગુરુ ન હોય તે પણ ગુરુનો મહિમા ગાય છે અને ગુરુઓને વંદન કરે છે. કોઈ ઉત્તમ સાધમાંઓનો આશ્રય, સહયોગ, સત્સંગ કરી અને આત્માને ઉધ્વિગામી બનાવે છે. તેને ભલે આ ભવમાં ગુરુનો સમાગમ ન થયો હોય પણ આગલા ભવોમાં તો જરૂર તેમના ચરણ-સેવન કર્યા હોય છે. છેલ્લા ૧૫-૨૦ વર્ષમાં આપણા ભારતીય જીવન-વ્યવહાર, જીવન અને ધર્મજીવન બનેમાં સ્વચ્છંદ પ્રવેશ કર્યો છે. જેને આત્મજ્ઞાન ગ્રામ કરવું હોય તેણે પ્રથમ શું કરવું જોઈએ તેના માટે પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિ-શાખની પૂર્વભૂમિકારૂપ ૪૨ ગાથાઓમાં બતાવ્યું છે કે સાધકે સર્વપ્રથમ મતાર્થી લક્ષણોનો ત્યાગ કરવો જોઈએ અને આત્માર્થી લક્ષણો પ્રગટ કરવાં જોઈએ.

#### ● ત્યાગ-વૈરાગ્ય વિના આત્મજ્ઞાન ન થાય :-

“ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.”

અત્યારે આપણી દશા એવી છે કે આપણી પાસે પાંચ લાખની પણ મૂડી નથી અને ૫૦ લાખનું કારખાનું ઊભું કરવાના આપણે સપના જોઈએ છીએ તો તે કેવી રીતે સંભવ બને? વ્યવહાર જીવનમાં તો કદાચ ભસ્તાચાર કરીને પણ આવડી મોટી મૂડી મેળવી

લઈએ તો બની શકે; પરંતુ પરમાર્થ જીવનમાં ભસ્તાચાર ચાલતો નથી. ભગવાનના માર્ગમાં કોઈની લાગવગ ચાલતી નથી કારણ કે “ધર્મ: વस્તુ સ્વભાવઃ” સ્વયં તીર્થકર ભગવાન પણ નવો મોક્ષમાર્ગ બનાવી શકતા નથી, આગળ થયેલા તીર્થકર સર્વજ્ઞ ભગવાનની આજાનું અનુસરણ કરવાથી જ તીર્થકરનો મોક્ષ થઈ શકે છે. જ્યારે તેઓ ગૃહસ્થ અવસ્થામાં રાજી, મહારાજા હોય છે ત્યારની આ વાત છે. શ્રી ઋષભદેવ કે મહાવીર ભગવાને ધર્મ બનાવ્યો નથી, તેમણે તો તે માર્ગનો પૂર્ણ અનુભવ કરી તે માર્ગ બતાવ્યો છે. પોતે પરમાત્મા બનીને પરમાત્મા બનવાની કળા અને વિજ્ઞાન બતાવ્યું છે. ધર્મ તે અંધશ્રદ્ધાર્થી નથી ચાલતો. ‘બાબાવચન પ્રમાણ’ આ માર્ગથી ભગવાનનો માર્ગ નથી ચાલતો પરંતુ આગમને સમ્મત કરવાં, સુયુક્તિને સમ્મત કરવી, ગુરુપરંપરાથી અલૌંડિક અદ્ભુત અનુગ્રહપૂર્વક ઉપદેશ આવ્યો છે તેને સમ્મત કરવો અને સ્વાનુભવ માટે ઉદ્યમી થવું. આ ચારેના સમન્વયથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે.

● સ્વચ્છંદરૂપ દુર્ગુણનો ત્યાગ કર્યા વિના આત્મજ્ઞાન ન થાય :- જીવન એટલે ‘ભાવ’. હું અને તમે ભાવરૂપ છીએ. આ શરીરરૂપી જે ભૂત આપણને વળગ્યું છે તે આપણી નિજ-સંપત્તિ નથી. અરે! આ જે શબ્દો ખરે છે તે પણ આત્માની સંપત્તિ નથી. સ્વચ્છંદ, મત, આગ્રહ તેને અંતરથી છોડ્યા વિના મધ્યસ્થતા આવી શકે નહીં. પારમાર્થિક સમતા તો છોડો, વ્યવહારિક સમતા પણ ન આવી શકે. મતાગ્રહ બન્યો રહે. તીવ્ર સાંપ્રદાયિકતા હોય તેના માટે મોક્ષમાર્ગ નથી કારણ કે આપણે બને પક્ષોનો સમન્વય કરી શકતા નથી. કંઈ તો એકલા અધ્યાત્મને માનીએ છીએ અને કંઈ તો એકલા સિદ્ધાંતને માનીએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. અધ્યાત્મ પોતાની જગ્યાએ બરાબર છે પરંતુ તે સિદ્ધાંતની અપેક્ષા રાખે છે અને સિદ્ધાંત પોતાની જગ્યાએ બરાબર છે પણ તે અધ્યાત્મની અપેક્ષા રાખે છે; નહીં તો નિર્વિકલ્પ સમાધિ અને આત્માનો

અનુભવ થઈ શકે નહીં. ભગવાનની વાણી, આચાર્યોની વાણી, મહાજ્ઞાનીઓની વાણી આપણને આગ્રહથી મુક્ત કરે છે, ભાવોની નિર્મળતા વધારે છે અને ભાવોની નિર્મળતા માટે જે કંઈપણ સાધન કરવા પડે તેને અપનાવવા જોઈએ. શરીરની કોઈ કિયાથી કે શરીરના કોઈ સંસ્કારથી નિશ્ચય મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. સર્વ દુર્ગુણોમાં સ્વચ્છંદ તે રાજ દુર્ગુણ છે. જેને મત, પંથ, સંપ્રદાયનો તીવ્ર આગ્રહ છે એને એટલા બધા કખાય થાય છે કે તેને સમતાની પ્રાપ્તિ થતી નથી. શ્રી સમયસાર પોતાની જાતે સમજાય નહીં, તેમ આત્મા પણ પોતાની જાતે સમજાય નહીં. અથાતું યોગીશ્વર શ્રી કુંદુંદાચાર્યે ‘શ્રીસમયસાર’ શાસ્ત્રમાં કડક ભાષામાં કહ્યું છે,

“મુનિ લિંગ વા ગૃહી લિંગ એ લિંગો ન મુક્તિમાર્ગ છે, ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે.”

- શ્રી સમયસાર - ૪૧૦

આ વાતને તેમણે અહીં આધ્યાત્મિક દસ્તિથી કહી છે, સિદ્ધાંત અપેક્ષાએ નહીં. ભધ્યસ્થતા, ગુણગ્રાહકતા (ગુણપ્રમોદ) અને અનાગ્રહીપણું ધારણ કરવું તથા શુદ્ધભાવને પ્રગટ કરવા માટે જે ઉપયોગી સાધન સત્ત્વદ્વારા-શાશ્વત-ગુરુ છે તેમનું સેવન કરવું તથા ઈન્દ્રિયોનો સંયમ કરવો પરંતુ આ બધા સાધનરૂપ છે એમ જાણવું. તે સાધ્ય નથી, તેનું પદ સાધ્ય છે. દેવ એટલે મોક્ષ તત્ત્વ, ગુરુ એટલે સંવર, નિર્જરા અને પુણ્યાનુંધી પુણ્ય અને ધર્મ એટલે ભગવાનનો બતાવેલો માર્ગ. કોઈપણ જીવને જો આનંદ કે શાંતિ પ્રાપ્ત કરવા હોય તો તેનો માર્ગ ધર્મ જ છે. સંતોષે પણ કહ્યું છે કે,

“ધર્મ કરત સંસારસુખ, ધર્મ કરત નિર્વાણ, ધર્મ પંથ સાધે બિના, નર તિર્યંગ સમાન.”

● વિનય ગુણની પ્રાપ્તિ વિના આત્મજ્ઞાન થાય નહીં:- જેમ દુર્ગુણોમાં રાજ સ્વચ્છંદ છે તેમ મુમુક્ષુ માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આવશ્યક રાજ ગુણ તે વિનય છે. ચાહે અજ્ઞાની હોય કે જ્ઞાની, મુનિ હોય કે આચાર્ય કે ગણધર હોય પરંતુ જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટ ન

થાય ત્યાં સુધી તે ગુણની ઉપાસના અતિ આવશ્યક છે. વિનય એટલે આજ્ઞાંકિતપણું કે હું કંઈ જ નથી. આમ કરવું ધણું અધરું છે. ભલભલા તેનો અંતરથી સ્વીકાર કરી શકે નહીં. હુનિયાના લોકો તો મોહમદિરામાં મસ્લ છે જ. તેઓ કહે છે કે ‘અમે કરોડો રૂપિયા કમાયા, આટલો મોટો અમારો વેપાર ધંધો છે, જુઓ અમારો કેટલો વટ પડે છે, ૮૫ વર્ષે પણ મારી તબિયત બહુ સારી છે, મારાથી આયુષ્ય ચાલે છે !’ આ જીવ અજ્ઞાની છે એટલે પર પદાર્થને પોતાના માને છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં જ આઠ પ્રકારનાં અભિમાનનો ત્યાગ થાય છે. માટે આઠ પ્રકારના અભિમાન ઓછા કરવાથી આત્મજ્ઞાનની ભૂમિકા બંધાય. જ્યાં સુધી પર વસ્તુનું માલિકીપણું છે, પર વસ્તુમાં અહં-મમત્વ છે ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકે નહીં. આપણી પાસે હવે વધારે સમય નથી માટે જલ્દીથી જાગી જવું. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજયંક્રજુએ ‘અમૂલ્ય તત્ત્વવિચાર’ માં કહ્યું છે કે,

“રે! આત્મ તારો! આત્મ તારો! શીંગ એને ઓળખો; સર્વાત્મમાં સમદાચિ ધો, આ વચનને હૃદયે લખો.”

માત્ર વાણીથી બોલવાથી કામ નહીં થાય કે ‘જીવ માત્ર મારા મિત્ર છે.’ જો જરાક બોલવાનું થાય કે ખાવાનું સારું ન મળે કે પોતાની ઈચ્છાની વિરુદ્ધ કંઈ કાર્ય થાય તો તરત જ અહંકાર જાગી જાય છે. માટે સંત કહે છે કે.,

“રાઈ બાટા બીસવા, ફિર બીસનકા બીસ;” ઐસા મનવા જો કરે, તાહી મિલે જગાદીશ.

રાઈના દાણાના ૪૦૦માં ભાગ જેટલું જે પોતાનું મન કરે, પોતાનું અસ્તિત્વ ભુંસાવી દઈ ભગવાન, ધર્મ અને સદ્ગુરુમાં સમાઈ જાય તો તેને દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, ઉપચાર વિનયની પ્રાપ્તિ થાય, પણ પ્રથમ અંતરથી ઉપર મુજબ કબૂલાત કરવી જોઈએ. આવા વિનયગુણનો જો કોઈ અયોગ્ય લાભ લે તો એવા કુગુરુ તે નરકાદિ ગતિમાં જાય છે. જેના અંતરમાં ‘આ મારો શિષ્ય છે’ એમ માન્યતા હોય તે સદ્ગુરુ તો હોય જ નહીં પણ જ્ઞાની કે ઉચ્ચ કક્ષાનો પ્રબુદ્ધ સરજન પણ તે નથી.

પરમતત્વજી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ ગાથા-  
૨૧ માં કહ્યું છે કે,

“અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ;  
મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી.”

દુનિયાના પ્રમાણપત્રથી મોક્ષમાર્ગ મળતો  
નથી પણ ભાવોની શુદ્ધિ, વૃદ્ધિ, સરળતા, વિનય  
અને પ્રબુદ્ધતા દ્વારા કેમે કરીને આત્મજ્ઞાનાદિ વૈભવ  
પ્રગટે છે. આવું જ્ઞાણીને આપણે સાચા સુખ અને  
આનંદની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ કરવો. સદ્ગુરુ વિના  
જ્ઞાન થાય નહીં, ત્યાગ-વૈરાગ્ય ન હોય તેને  
આત્મજ્ઞાન થાય નહીં. સ્વયંદરૂપી દુર્ગુણનો ત્યાગ  
કર્યા વિના, ભત-ભતાત્તર અને ભતાગ્રહનો ત્યાગ કર્યા  
વિના અને ગુણપ્રમોદની ભાવનાનો સ્વીકાર કર્યા  
વિના સમક્ષિ મળે નહીં. સાચું તે માચું, માચું તે જ  
સાચું એમ નહીં. જ્યાંથી સાચું મળે, સાચું મળે,  
સદ્ગુણો ગ્રહણ થાય, જ્યાંથી સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ  
થાય તેમ પ્રવર્તિં, જો કે આપણને સ્વર્ગ જોઈતું નથી  
પણ અત્યારે આ કાળમાં સ્વર્ગમાં જવું ફરજિયાત છે  
કારણ કે વર્તમાનમાં આ કાળે મોક્ષ થતો નથી. છેલ્લે  
સર્વ સદ્ગુણોનો રાજ એવો જે વિનય તેને પ્રાપ્ત કર્યા  
વિના કોઈને પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં.  
આવો દિવ્યબોધ માત્ર સમજાય તે પૂરતું નથી પણ  
તેને આપજા જીવનમાં ઉતારવો. હંદ્ય તેનાથી દ્રવિત  
થાય, જીવનમાં તે બોધ આવે તો કલ્યાણ થાય, નહીં  
તો અનંતકાળે પણ મોક્ષમાર્ગ નથી. આ પ્રમાણે  
આત્મસિદ્ધિ કરવી છે તેવું માત્ર બોલીએ અને  
દુનિયાના લોકોને પણ એવું મનાવડાવીએ કે અમે  
તો સાધક છીએ, અમારે આત્મજ્ઞાન જોઈએ છે પણ  
એમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં. અધ્યાત્મ  
યોગીશ્વર શ્રી આનંદધનજી મહારાજે કહ્યું છે કે,  
‘કપટ રહિત થઈ આત્મ અરપણા

આનંદધન પદ રે ઋષભજિનેશ્વર...’

આવું આપજા જીવનમાં થાય તો અનંત  
ભવના ફેરા એક ભવમાં મટે. આપણું જીવન આવા  
સદ્ગુણોથી સુવાસિત બને અને નરભવ સર્ફણ થાય  
એ જ શ્રી દેવ-શાસ્ત્ર-ગુરુને પ્રાર્થના...’

## દે દી હમેં મોક્ષમાર્ગ કી



- સુચિત અશ્વિનભાઈ દોશી, મુંબઈ

(રાગ : દે દી હમેં આજાદી બિના)

દે દી હમેં મોક્ષમાર્ગકી સહી સહી મિસાલ,  
વવાણિયા કે સંત તૂને કર દિયા કમાલ

સહજત્તમ સ્વરૂપ પરમગુરુ....

જાગૃતિમેં બિતાયા જીવનકા હર પ્રહર,  
બચપન ગૃહસ્થીમેં ભી વૈરાગ્ય થા પ્રખર,  
થી મોક્ષકી લગન સદા એકાંત હો યા ધર;  
ગ્રંથિભેદ કર અસંગ દશા કે સર કિયે શિખર,  
ભવોંકી હોડમેં તૂને જીત લિયા કાલ..

વવાણિયા કે સંત...

ગા રહે થે કર્મ સબ સંસાર કા ગાના,  
લગતા થા કી મુશકીલ હૈ મોક્ષમાર્ગ કો પાના,  
મુકાબલા થા જોર કા કર્મો કો હરાના;  
પર તૂ ભી થા કૃપાલુ બડા સંત નિરાલા,  
બના દી તૂને જ્ઞાન ઔર ધ્યાન કી યે ઢાલ...

વવાણિયા કે સંત...

તુજે સદ્ગુરુ પહેચાનકર જિજ્ઞાસુ ચલ પડે,  
મુમુક્ષુ ચલ પડે ઔર મહાત્મા ચલ પડે,  
સોભાગ, જૂઠાભાઈ, લધુરાજ ચલ પડે;  
ઉપદેશ તેરા પાકર ભાગ્યવાન ચલ પડે,  
ખંભાત સે નિશા મેં તેરી આયે અંબાલાલ...

વવાણિયા કે સંત...

અહોભાગ્ય હમારા બડા મિલા તું ગુરુજન,  
ભક્તિ સત્સંગ સે હુઆ જનમ યે પાવન,  
રાગ ઔર અજ્ઞાન રહિત હૈ સમ્યગ્રદર્શન;  
બતા દી સંક્ષેપ મેં હી બાત યહ ગહન,  
પરમકૃપા સે દિયા હમેં આત્મસિદ્ધિ કા દાન...

વવાણિયા કે સંત...

## અંતરાત્માની પાઠશાળા

**પદ્મશ્રી ડૉ. કુમારપાણ દેસાઈ**

ગુર્ધ્વ જીવનની અભિપ્રાય ધરાવનાર કે આધ્યાત્મિક માર્ગ પ્રયાણ કરવા ઈચ્છનાર વ્યક્તિ સામાન્ય રીતે જીવનજીગૃતિ પામવા કોઈ ગ્રંથ તરફ ઢોડી જાય છે. કોઈ સંત કે સદ્ગુરુ પાસે જઈને બોધ મેળવવાનો પ્રયત્ન કરે છે. કોઈ મરજીવાની માફક, ધર્મના ગહન રહસ્યોનાં સાગરમાં દૂબકી લગાવીને પ્રકાશનાં મોતી પામવાનો પ્રયાસ કરે છે, તો કોઈ વળી કોઈ ઉપદેશકનાં ચરણમાં બેસીને એના ઉપદેશને ગ્રહણ કરી સ્વ-જીવનને ધન્ય બનાવવાની કોશિશ કરે છે, પણ વ્યક્તિનો પહેલો ગુરુ એની પાસે બેઠો હોય છે, છતાં એ ગુરુ, ગ્રંથ કે સંતની શોધમાં ચોમેર નીકળી પડે છે.

કોઈ પણ સાધકનો સર્વપ્રથમ શિક્ષક કે ગુરુ કે એની આંગળી પકડીને પહેલાં થોડાં ઊ ભરાવનાર એ એનો અંતરાત્મા છે. ગંભીર રીતે સ્વજીવનને લક્ષ કરનારને ઘણો મોટો બોધ પોતાના જીવનની ઘટનાઓમાંથી મળી રહે છે, પણ મુશ્કેલી એ છે કે માનવી ભૂલો શોધવાનો પ્રારંભ સ્વજીવનમાંથી નહીં, બલ્કે અન્યના જીવનથી કરે છે. બોધ મેળવવા કે જીવનશિલ્પી ઘડવા માટે પોતાના ભીતરને ઓળખીને અને જીવનની ઘટનાઓના નીરક્ષીર તારવીને આગળ વધવાનો પ્રયાસ કરતો નથી.

ધારો કે તમને કોધ ચેડે છે અને વારંવાર કોધ જાગે છે, તો ભીતરમાં જઈને તપાસ કરશો કે આ કોધ ક્યા કારણે જન્મ્યો હતો ? કઈ ઘટનાને પરિણામે મારામાં સુખુમપણે રહેલી એ કોધની વૃત્તિને આગ ચંપાઈ હતી. આમ ગંભીરપણે વિચારશો, તો જ્યાલ આવશે કે તમારા મનમાં પત્તી કે નોકરના વર્તન માટે અમુક પ્રકારનો સતત અજ્ઞંપો હતો. એમાં પત્તીએ કશુંક બોલતાં કે નોકરે કશુંક કરતા એ અજ્ઞંપાએ તમારી કોધની વૃત્તિ જાગ્રત કરી. એ કોધની વૃત્તિને બહાર આવવા માટે યોગ્ય પરિબળો પણ હતાં, જેથી તમે ગુર્સે ભરાઈને પત્તીને અપશબ્દો કહ્યા અથવા તો નોકરને ધમકાવી કાઢ્યો. એવું પણ બુને કે ગુર્સે થઈને તમે તમારા હાથમાં રહેલી કોઈ ચીજવસ્તુનો એના તરફ ધા કર્યો હોય.

હવે તમે ભૂતકાળમાં પાછા જઈને એ ઘટનાનું વિશ્લેષણ કરશો, તો જ્યાલ આવશે કે કોધ જગવાનું કારણ અજ્ઞંપો હતો. એ કોધ પ્રગટ થવાની કોશિશ કરતો હતો અને એને પ્રગટ થવા માટેના સહાયક પરિબળો મળી રહ્યાં. પછી એ કોધની બેહોશીમાં તમે હાથમાં રહેલી ચીજવસ્તુનો જોરથી ધા કરી બેઠા.

આ સમયે તમારા મનની શાંતિ કે ચિત્તની સ્વસ્થતા કારગત નીવડ્યા નહીં. ભભૂકૃતા કોખની આગને ઢંડા પાડી નાખે એવી શાંતિની વર્ષા તમારા ચિત્ત પર થઈ નહીં. આમ, કોધને સહાયક પરિબળો વકરી ગયાં અને કોધને પ્રતિબંધક પરિબળો એ સમયે અળગા રહ્યા.

આવી જ રીતે ચિત્તમાં બહેકેલી કામવૃત્તિ હોય, તો એ કામવૃત્તિ એના સહાયક પરિબળોને શોધી કાઢે છે અને પછી એ પ્રગટ થતી હોય છે. આમ બની ગયેલી ઘટનાનું પાછા પગલે નિરીક્ષણ કરવું જોઈએ. વૃત્તિની સઘણી પ્રવૃત્તિઓ અંગે પશ્ચાદ્દર્શન થવું જોઈએ અને પછી એ વૃત્તિની પ્રવૃત્તિઓ જોયા બાદ એને વિશેની યથાર્થ સમજ કેળવવી જોઈએ.

જૈનદર્શનમાં આને માટે પ્રતિકમણાની વાત કરવામાં આવી છે. પ્રતિકમણ એટલે પાછા જવું. દિવસને અંતે વ્યક્તિ બનેલા બનાવોમાં પાછા જઈને પોતાના દોષોની ખોજ કરે છે અને એનું પ્રાયશ્વિત કરે છે. મહાન ચિંતક ફરિક નિત્યે કહ્યું છે, ‘અંતઃકરણનો ઊંશ મનુષ્યને દર્શન શીખવાડે છે.’ એનો અર્થ એ કે પોતાના દર્શયમાં જે ઊંખ રહેલો હોય, તેમાંથી વ્યક્તિ યોગ્ય બોધપાઠ લે તો દર્શનને પામી શકે છે.

જીવનમાં સૌથી મહત્ત્વની બાબત એ વૃત્તિની જાગૃતિની પ્રારંભિક પ્રક્રિયાને જોવાની છે. આપણે બહારના કોધને જોઈએ છીએ, મોહવશ થઈને કરેલા ફૂત્યને જોઈએ છીએ, લાલચને પરિણામે થયેલી સજાને જોઈએ છીએ, પરંતુ હકીકતમાં એ તો પરિણામ છે, ખરી નજર તો એ પ્રક્રિયાના પ્રારંભ પર કરવી જોઈએ. કઈ રીતે કોધ, કામ કે લાલચની વૃત્તિ જાગી. એના મૂળ સ્ત્રોતને જોવો જોઈએ. તમારામાં મોહ જાગ્યો એનો અર્થ તો એટલો જ કે તમે તમારા ભીતરમાં

રહેલી મોહની વૃત્તિ માટે માધ્યમ બની ગયા. મુખ્ય બાબત તો મૂળને પકડવાની છે, પ્રગટેલા વૃક્ષને નહીં, અને એ રીતે તમારે વૃત્તિના મૂળ સુધી પહોંચવાનું છે. કઈ રીતે એ વૃત્તિ જાગો? કઈ રીતે એ વૃત્તિ વધી અને કઈ રીતે એણે આવું વરવું સ્વરૂપ લીધું એ જોવાનું છે.

આથી મુખ્ય બાબત એ છે કે પત્ની કે નોકરની વર્તણૂક તમને કોષિત બનાવી ગયા, પણ કોષ તો તમારી અંદર જ હતો. જો અંદર કોષ ન હોત, તો એ કોઈ કાળે પ્રગટ થાત નહીં. આથી એ મૂળને જોવાથી સધળો ઘ્યાલ આવશે. એ મૂળને જોવા માટે તમારે એ ઘટનાના ઉદ્ઘગમસ્થાન સુધી પહોંચવું પડશે. એને સમજવા માટે તમારે તમારા ભીતરમાં છેક તળ સુધી જવું પડશે, કારણ એટલું જ કે તમે સામી વ્યક્તિ પર ચીજવસ્તુ ફેંકી અને કોષ પ્રગટ કર્યો, પરંતુ એ કોષ તો ક્યારનો ય પલાંડી જમાવીને બેઠો હતો. તે તમારા ચિત્તમાં વસેલો છે અને તમારા હદ્યમાં.

પણ તમે તમારા કોધનો બચાવ કરવા માટે એક એવું બહાનું શોધો છો કે મારી પત્ની કે આણઘડ નોકરે મને અતિ કોષિત કર્યો. એમના વર્તનને કારણે મારે અનિયતાએ કોષિત થવું પડ્યું. સ્વીની સુંદરતા જોઈને મને મોહ જાગ્યો અને એની સુંદરતાને કારણે હું મોહગ્રસ્ત થયો. હકીકતમાં તો એ મોહગ્રસ્તતાનું મૂળ વ્યક્તિના મનમાં રહેલું હોય છે. બીજી વ્યક્તિ તમને મોહ પમાડતી નથી, પરંતુ તમે પોતે મોહસકત છો. એનો સ્વોત સતત તમારી ભીતરમાં વહેતો જ હતો, પછી એનું પ્રગટીકરણ થયું અને એ માટે તમે કોઈ બીજાને શિરે દોષ નાખી દીધો. પોતાની નિર્બળતા બીજાને ઓઢાડી દીધી. આમ, વ્યક્તિનો પહેલો શિક્ષક એ સ્વયં છે. એ પોતાના ભીતરમાં પ્રવાસ કરીને પોતાના જીવનની ભૂતકાળની ઘટનાઓનું વિશ્લેષણ કરીને યોગ્ય બોધ, જાગૃતિ કે સત્તાનાતા પાચી શકે છે.

માનવીનો બીજો શિક્ષક પણ એની પાસે જ વસે છે અને એ છે એની ભૂલ. વ્યક્તિ એના જીવનમાં ડગલે ને પગલે ભૂલો કરતો હોય છે, પરંતુ એની પહેલી પ્રતિક્રિયા એવી હશે કે એ એની ભૂલનો બચાવ કરતી વખતે જાણો કોઈ ભૂલ કરી નથી, એવો જ દેખાવ કરશો! કેટલાક તો ભૂલ કરીને એવો સ્વાંગ રચે છે કે જાણો એમનાથી કદી ભૂલ થાય જ નહીં. જેમ દરેક ગુનેગાર પોતાની ભૂલ છાવરવા માટે પહેલા પ્રયાસ કરતો હોય છે. જો ભૂલ પકડાઈ જાય તો એ એનો બચાવ કરવા દોડી જશે અને એટલા જોરશોરથી પોતાની ભૂલનો બચાવ કરશે કે જાણો પોતાના અધિકાર માટે

જગ્યુભી રહ્યો ન હોય !

હકીકતમાં દરેક માનવી એક યા બીજા તબક્કે ભૂલ કરતો હોય છે, પરંતુ એની પાસે જેમ એની વૃત્તિનું વિશ્લેષણ કરવાની ક્ષમતા હોવી જોઈએ, એ જ રીતે પોતે કરેલી ભૂલનો સ્વીકાર અને પૃથક્કરણ કરવાની ક્ષમતા હોવી જોઈએ. માણસની ભૂલ એને ડગલેને પગલે માર્ગદર્શક બની શકે છે. જો એનાથી ભૂલ થઈ ગઈ હોય, એનો ઘ્યાલ પણ આવ્યો હોય અને છતાં એ એમાંથી બહાર નીકળીને સુધરવાની કોશિશ કરે નહીં, તો એ એની સૌથી મોટી ભૂલ બની રહે છે. કારણ કે દરેક વ્યક્તિ ભૂલ તો કરે છે, પરંતુ બીજી વાર એનું પુનરાવર્તન ન થાય એ બાબત એને માટે મહત્વની હોય છે. આથી જ ‘મિશ્ના મિ દુક્કડમુ’ નો અર્થ એ છે કે જે ભૂલ અને દોષ માટે પ્રાયશ્વિત કર્યું એ ભૂલ કે દોષ પુનઃ ન કરવાનો સંકલ્પ.

ભૂલ કરનારી વ્યક્તિ પહેલાં તો પોતાની ભૂલનો સ્વીકાર જ કરતી નથી. કેટલાકને થયેલી ભૂલમાં કોઈ ભૂલ હોય એમ લાગતું નથી. પરીક્ષામાં ચોરી કરવી ‘એ તો બધા કરતા હોય છે’ એમ કહીને એ પોતાની ભૂલને સામાન્ય ગણીને બાજુએ મૂકી દેતો હોય છે. કેટલાક એમ માને છે કે અમુક સંજોગોને કારણે ભૂલ થઈ ગઈ. બાકી પોતે કદી આવી ભૂલ કરે નહીં. આર્થિક મજબૂરીને કારણે ચોરી કરી, પરંતુ જો આર્થિક મજબૂરી ન હોત તો એણે ચોરી કરી ન હોત. આ રીતે એ પોતાની ભૂલને માટે કોઈ કારણ શોધી કાઢે છે અથવા તો બહાનું શોધી કાઢે છે અને પછી પોતે જ પોતાના દિલની અદાલતમાં એવો ચુકાદો આપે છે કે આનું થાય એ અત્યંત સાહજીક હોવાથી એને ભૂલ ગણી શકાય નહીં. પોતાની ભૂલથી ભાગનારી વ્યક્તિ કે પોતાની ભૂલને છાવરનારી વ્યક્તિ અંતે તો ભૂલોની પરંપરા સર્જે છે.

માણસને એની વૃત્તિ અને ભૂલો પરથી જેમ બોધ મળે છે, એ જ રીતે એને મૃત્યુ પરથી પણ બોધ મળી શકે છે. એની મૃત્યુ વિરોધી જાગૃતિ એના જીવનમાં જાગૃતિ લાવશે, સાર્થક જીવનનું મૂલ્ય સમજાશે અને પળે પળે પોતાની જાત વિશે એ જાગૃતિ કેળવશે. એને જીવનના પરમ અર્થની ખોજ કરવાની ભાવના જાગશે અને એ રીતે એ પોતાના જીવનના અર્થની શોધ કરશે. આ રીતે સાહજને એની વૃત્તિની માયાવી લીલામાંથી, એની ભૂતકાળની ભૂલોમાંથી અને મૃત્યુ વિરોધી સમજમાંથી અધ્યાત્મજીવનના આરંભનું પહેલું પગથિયું મળી રહે.

● ● ●

૧૧

## શ્રી પૂજ્યપાદ આચાર્ય વિરચિત

# સમાધિતંત્રનું અમૃતરસપાન (ક્રમાંક-૭૧)

**प्रा. ચંદાબહેન વી. પંચાલી (બોટાડ)**

અધ્યાત્મમાં ધીર, વૈરાગ્યમાં વીર અને આત્મશ્રેષ્ઠીમાં ગંભીર એવા પરમહૃપાળુટેવની સમ્યક્ સરસ્વતી પત્રાંક-૧૪ ઉમાં લખે છે, “નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો - (૧) ગમે તે પ્રકારે પણ ઉદ્ય આવેલા, અને ઉદ્ય આવવાના કષાયોને શમાવો. (૨) સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો. (૩) આટલા કણ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો. (૪) તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકૂળ કર્યા કરો. (૫) કોઈ એક સત્યાસ્રુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે. પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે. એમ અવશ્ય માનો. અધિક શું કહું? ગમે તે કણે પણ એ પાંચમું પ્રામ થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમા અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિવાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝું હશે-(સૂઝું છે).” આ સમ્યક્ સરસ્વતીમાં અંતરંગ પાત્રતા સાધકની કેવી હોવી જોઈએ તે દર્શાવી અયલ શ્રદ્ધામાં સ્થિર થઈ અધ્યાત્મવિકાસ સમજાવ્યો છે. સાધકોને આ માર્ગદર્શિકા રૂપ છે.

શ્રી પૂજ્યપાદ આચાર્ય ‘સમાધિતંત્ર’માં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ચૈતન્યધારાને આદેખે છે. આપણે શ્લોક ૪૧માં જોયું કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી શાંત થાય છે. તેમાં એટલે ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જે પ્રયત્ન કરતાં નથી તે ધોર તપ કરવા છતાં પણ નિવાણને પ્રામ કરતાં નથી. આત્માનો વિભ્રમ એટલે આત્મભાન્તિ એટલે શરીરાદિમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તે ભેદજ્ઞાનથી નાશ પામે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં નથી તે ધોર તપ કરવા છતાં પણ નિવાણની પ્રાપ્તિ કરી શકતા નથી.

થાય છે તે ભેદજ્ઞાનથી નાશ પામે છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જે ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં નથી તે ધોર તપ કરવા છતાં પણ નિવાણની પ્રાપ્તિ કરી શકતા નથી.

હવે શ્લોક - ૪૨ નો અભ્યાસ કરીએ. બહિરાત્મા અને અંતરાત્મા તપશર્યા કરે તેમાં અંતરવૃત્તિ શું હોય છે તે હવે સમજાવે છે :

**શુભં શરીરં દિવ્યાંશુ વિષયાનભિવાજ્ઞતિ ।**

**ઉત્પન્નાત્મમતિદેહે તત્ત્વજ્ઞાની તત્શ્ચ્યુતિમ् ॥ ૪૨ ॥**

**અન્વય :-** દેહે ઉત્પન્ન આત્મમતિઃ શુભં શરીરં દિવ્યાન् વિષયાન् ચ અભિવાજ્ઞતિ તત્ત્વજ્ઞાની તતઃ ચ્યુતિમ् ।

**શબ્દાર્થ :-** દેહે = દેહમાં, ઉત્પન્ન આત્મમતિઃ = (દેહમાં) જેની આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે એવો બહિરાત્મા શુભં શરીરં = સુંદર શરીર દિવ્યાન् વિષયાન્ ચ = અને સ્વર્ગના વિષયભોગોની અભિવાજ્ઞતિ = વાંધા કરે છે તત્ત્વજ્ઞાની = જ્ઞાની અંતરાત્મા તતઃ = તેનાથી (શરીરાદિ અને વિષયભોગોથી) ચ્યુતિમ् = છૂટવાની ભાવના કરે છે.

**ભાષાંતર :-** દેહમાં જેને આત્મબુદ્ધિ ઉત્પન્ન થઈ છે, એવો બહિરાત્મા તપ તપીને સુંદર શરીર અને સ્વર્ગના વિષય - ભોગોની વાંધા કરે છે અને જ્ઞાની અંતરાત્મા શરીરથી અને ભોગોથી છૂટવાની ભાવના કરે છે.

**ભાવાર્થ :-** શ્રી પૂજ્યપાદ આચાર્ય સમાધિતંત્ર ગ્રંથના ૧૦૫ શ્લોકમાં સમાધિમાર્ગને ગાગરમાં સાગર ભરી દીધો હોય તેટલી સૂક્ષ્મતા પ્રત્યેક શબ્દમાં ભરપૂર ભરી દીધી છે.

આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને ભૂલીને દેહાદિમાં આત્મબુદ્ધિ રૂપ જે વિભ્રમ છે તે જ દુઃખનું મૂળ છે. આ

હુઃખ આત્મજ્ઞાન વડે જ દૂર થાય છે. સમૂળ હુઃખ નાશ કરવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. નિર્વાણની પ્રાપ્તિ આત્મજ્ઞાનથી થાય છે. બહિરાત્મા અને અંતરાત્મા બનેની ભાવના અહીં વ્યક્ત થઈ છે. બહિરાત્મા એટલે દેહને જ સર્વસ્વ માને છે. અજ્ઞાની તપશ્ચર્યા કરે તેમાં પણ તેને વિષયભોગોની વાંધા હોય છે. સુંદર શરીર મળે માટે તપ્ય તપે છે. અથવા સ્વર્ગના સુખો ભોગવવા મળે માટે તપની પ્રધાનતામાં જીવે છે. અંતરમાં વિષયભોગોની ઈચ્છા હોય છે. જ્યારે જ્ઞાનીની જે કિયા થાય છે તેમાં શરીર અને વિષયભોગોથી ધૂટવાની ભાવના હોય છે. માટે તેઓ અંતરાત્મા છે. અંતરમાં આત્મા ધૂંટાતો હોય છે. અજ્ઞાનીના અંતરમાં બાધ્યભાવોની ઈચ્છા ધૂંટાતી હોય છે. અજ્ઞાનીને પુણ્ય અને પુણ્યના ફળમાં જડ પદાર્થોની પ્રાપ્તિ વર્તતી હોય છે. આત્મધર્મની રુચિ નથી. તેથી રુચિ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ થાય છે. જ્ઞાની તો રાગાદિની વૃત્તિથી પણ ધૂટવા માગે છે. પુણ્યના રાગાદ ભાવ પણ જ્ઞાનીને હુઃખદાયક લાગે છે.

અંતરના વેદન ઉપરથી જ્ઞાની-અજ્ઞાની ઓળખાય છે. જેણે અતીન્દ્રિય આત્માનું વેદન એકવાર પણ અનુભવ્યું છે તેને ઈન્દ્રિયના વિષયોની રુચિ ધૂટી જાય છે. કોઈપણ સાધકને એક બાજુ ઈન્દ્રિયોના વિષયમાં રુચિ હોય અને એક બાજુ આત્માના અતીન્દ્રિય જ્ઞાનના વિષયમાં રુચિ હોય એવું બનવું અસંભવ છે. એકની રુચિ અંતરમાં વેદાતી હોય તે બીજી રુચિમાં રહી શકે નહિ. આચાર્યદિવ સરળ ભાષામાં ગહનભાવને સમજીવી સાધકને અધ્યાત્મમાં જાગૃત કરે છે.

બહિરાત્મા વિષયોની વાંદ્ધા રાખે છે એ વાત સમજાય છે પણ અહીં આચાર્યદિવ કહે છે કે તપ તપીને શરીરના સુખને ઈચ્છે છે. સ્વર્ગાદિને ઈચ્છીને સ્વર્ગમાં વિષયભોગો ભોગવવાની ઈચ્છા રાખે છે ત્યારે આપણે આપણા અંતકરણને પ્રશ્ન કરવો રહ્યો કે તારી અંતરંગ રૂચિ કઈ છે? તે સત્ત્યાર્થ પ્રત્યુત્તરથી આપણે વિકાસ સાધી શકીએ. નિજતત્ત્વમાં શું ચાલી રહ્યું છે, તેનું આત્મનિરીક્ષણ જરૂરી છે.

**विशेषार्थ :-** प्रस्तुत श्लोकमां अति स्पष्टताथी

બહિરાત્મા અને અંતરાત્માને ભીતરી ઉપયોગને લક્ષ્યગત કરીને સમજાવ્યા છે. શ્વોક ૪૧માં અભ્યાસ કર્યો કે દુર્ધર તપ કરે છતાં આત્મજ્ઞાન પામી શકે નાહિ. કારણ શરીરાદિમાં આત્મબુદ્ધિ વર્તે છે. આત્મબાન્તિમાં વર્તે છે. પરમકૃપાળુદેવ ઉત્તમ રાહ ચીધે છે,

“આત્મભાન્તિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજ્ઞાણ;  
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔપધ વિચાર ધ્યાન.”

અધ્યાત્મના રહસ્યમાળને પરમકૃપાળુટેવે આ પંક્તિમાં પ્રગટ કર્યો છે.

(૧) દેહે ઉત્પન્નાત્મમતિઃ - જેને દેહમાં - શરીરમાં આત્મબુદ્ધિ ઉત્પન્ન કરી છે, દેહ તે જ હું હું, દેહનું મૃત્યુ થાય, દેહનો જન્મ થાય, દેહમાં હર્ષ શોકની ઘટના ઘટે, દેહને થયું તે મને થયું એમ માને. આ જીવોને બહિરાત્મા કહે છે.

(૨) શુભ શરીરં દિવ્યાન् વિષયાન् ચ - સુંદર શરીર  
અને સ્વર્ગના દિવ્ય લાગતાં સુખો - બહિરાત્માના  
અંતરમાં આ પદાર્થોની ઈચ્છા પડી છે.

(૩) અભિવાચ્છતિ - વાંદા રાખે છે. ઈચ્છા રાખે છે. બહિરાત્મા સંસારને જ ઈચ્છે છે. અજ્ઞાની જીવ રાગાદિ રહિત જ્ઞાનમાત્ર ચેતનને ઈચ્છતો નથી. શ્રદ્ધામાં સ્વીકારતો નથી, પણ ભોગના નિમિત્ત રૂપ શુભકર્માને તપ તપીને પણ સ્વગારિદિ સુખને ઈચ્છે છે. નિર્વાણના પરમ સુખને ઈચ્છતો નથી.

બહિરાત્માની લૌકિક દણિ હોવાથી લૌકિક સુખની કલ્પના છૂટતી નથી. મોકને અર્થે હું તપ કરું છું એવું કદાચ બોલે પણ ખરો છતાં હદ્યમાંથી વિષય-ભોગોની ઈચ્છા ઓછી થઈ નથી. અજ્ઞાની દાન આપે અને ધનનો પરિશ્રદ્ધ ઓછો કરે પણ અંતરમાં ‘દાન આપીએ તો આપણને વધુ સંપત્તિ મળશે’ એવી દુર્ગધ જતી નથી. આપણે તપ કરીએ તો તપના ફળમાં બાબુ બધા સુખ મળે એવી અંતરની દુર્વૃત્તિ ઘટતી નથી. ફળમાં ઈન્ડ્રિયવિષયોના સુખને ઈચ્છે છે.

‘યોગદાનિ સમુચ્ચય’ માં શ્રી યશોવિજયજી  
મહારાજની વિભૂષિત વાળી લખે છે,  
“શીતળ ચેદનથી પણ ઉપન્યો.

અગ્નિ દહે જેમ વનને રે,  
ધર્મ-જનિત પણ ભોગ ઈહાં તેમ,  
લાગે અનિષ્ટ તે મનને રે,  
એ ગુણ વીરતણો ન વિસારું,  
સંભારું દિનરાત રે...”

અંતરાત્માને બાધ્યભાવ અનિષ્ટ લાગે છે. બહિરાત્માને તે ઈષ્ટ લાગે છે. જૈન ધર્મ સૂક્ષ્મ ધર્મ છે. તેથી અંતરમાં જે ભાવ પડ્યા છે તેની વિચારણા વિશેષ છે. અહીં તો બહિરાત્મા તપ તપીને પણ ભોગને ઈચ્છે છે તે સૂક્ષ્મતા છે.

**દષ્ટાંત :-** એક સદ્ગુરુનો આશ્રમ હતો. અનેક શિષ્યો ધર્મની આરાધના કરતા હતા. સદ્ગુરુ અધ્યાત્મના જ્ઞાતા હતા. તેમાં એક વ્યક્તિ આવીને કહે છે કે મારે આપના આશ્રમમાં રહીને આપની સેવા કરવી છે. સદ્ગુરુ તેના અંતરને જાણી ગયા હતા. સદ્ગુરુએ અનુમતિ આપી. આવનાર વ્યક્તિ સદ્ગુરુની સેવામાં લીન છે. સદ્ગુરુનો પડ્યો બોલ ઝીલે. સદ્ગુરુની ‘હા’ માં ‘હા’ અને ‘ના’ માં ‘ના’ શરૂનો ભીતરી ભાવ પણ જાણી જાય. સદ્ગુરુ તેની સેવાથી રાજુ છે. થોડા સમય પછી સદ્ગુરુ કહે, “તારી સેવાથી હું પ્રસન્ન થયો છું. તારે જે માંગવું હોય તે માંગ.” તે વ્યક્તિઓ કહ્યું, “ગુરુદેવ ! હું આર્થિક રીતે નબળો પડી ગયો છું. સમાજમાં મારું કોઈ સ્થાન રહ્યું નથી તેથી મને એવો મંત્ર આપો કે જેથી હું સંપત્તિવાળો બનું.” સદ્ગુરુ તો જ્ઞાતા હતા તેથી કહે, “મેં તને સેવામાં લીધો અને તારી ઉત્તમ સેવાથી હું પ્રસન્ન પણ છું. તને સંપત્તિ મળશે પણ કાયમી દુઃખ નાશ નહિ પામે. કાયમી સંસારદુઃખ નાશ પામે તેવો માર્ગ અને તેવી ઈચ્છા તને સંપૂર્ણ દુઃખથી મુક્ત કરશે. તેથી તને એવો મંત્ર આપું છું કે સદા નિર્વાણના માર્ગે આગળ વધી સંસારપરિભ્રમણ મટી જાય.” પોતાની ભૂલ સમજાણી. તે વ્યક્તિ શિષ્યત્વ સ્વીકારી સદ્ગુરુના શરણમાં નભી પડ્યો.

(૨) તત્ત્વજ્ઞાની તત્ત્વ : જ્ઞાની અંતરાત્મા શરીરાદિ વિષયભોગોથી ધૂટવાની ભાવના કરે છે. અંતરાત્મા રાગમાં કે રાગના ફળરૂપ વિષયોમાં સ્વજ્ઞેય

સુખ માનતા નથી. રાગથી પાર એવા ચિદાનંદસ્વભાવને જ આરાધે છે. રાગરહિત થઈ જિનસ્વરૂપ બનવા ચાહે છે. ચૈતન્યના અતીન્દ્રિય આનંદ સિવાય જગતમાં તેને કાર્યપણ પ્રિય નથી. સ્વર્ગના વિષયભોગોને અંતરાત્મા પુદ્ગલની રચના સમજે છે. જ્ઞાની અંતર્મુખ ઉપયોગ સાથે ધ્યેયસિદ્ધિનો પુરુષાર્થ કરે છે. બેદજ્ઞાનના ગહન પુરુષાર્થથી ચૈતન્યરસમાં નિમગ્ન બને છે. અજ્ઞાની દેહમાં આત્મબુદ્ધિ કરી બાધ્ય ભાવોમાં રહે છે.

અંતરાત્મા ચૈતન્ય તત્ત્વની ભાવના ભાવે છે. જ્ઞાનીને શુભ-અશુભ હોય ભલે પણ તેની ભાવના નથી. સ્વ આત્મા જ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. શ્રી પદ્મમલધારીદેવ ‘નિયમસાર’ મહાગ્રંથની શલોક રઉપની ટીકામાં નોંધે છે કે “ઈન્દ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે, તત્ત્વપ્રાપ્તિ માટે જેણું ચિત્ત ઉત્સુક છે તેમને સુંદર આનંદ જરૂરું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે.”

**તત્ત્વ : ચ્યુતિમ્ :-** અંતરાત્મા સંસારના ફળને તજવા ઈચ્છે છે કારણ અંતરાત્મા અનુભવે છે કે યથાર્થ મોક્ષ તો આત્મશુદ્ધિ જ છે. અંતરાત્માને તપ ધર્મનું આરાધન નિર્જરાના લક્ષે થઈ જાય છે. ક્યાંય કર્તૃત્વભાવ વેદાતો નથી. અંતરાત્માને ઈચ્છાનો નિરોધ હોવાથી કર્મની નિર્જરા થાય તેવું સંવર સહિત તપ હોય છે. અરે ! બહિરાત્માનું તપ તો હસ્તિસ્નાનવત્તુ છે.

શ્રી શીતલપ્રસાદજી લખે છે કે અજ્ઞાની કી દૃષ્ટિ બિલકુલ પરકી તરફ ઝુકી હુર્ઝ હૈ ઇસકો આત્મસ્વરૂપ કા બિલકુલ ભી શ્રદ્ધાન નહીં હૈ । ઇસલિયે ઉસકો ઇષ્ટવિયોગ ઔર અનિષ્ટસંયોગ કા મહાન કષ્ટ હોતા હૈ । અન્તરાત્મા વહ પદાર્�ો કો નિશ્ચય દૃષ્ટિ સે દેખતા હૈ ।

શ્રીપુજ્યપાદ આચાર્ય વાસ્તવિકતા સમજાવે છે. અજ્ઞાની તપ તપીને પણ સ્વર્ગના સુખની વાંચા રાખે છે, જ્યારે અંતરાત્મા તેનાથી નિવૃત્ત થવા ઈચ્છે છે. પરભાવને છોડતા જાય છે.

અભિપ્રાયની બિશ્રતા માટે ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ નોંધે છે કે “જેમ કોઈને ઘણો દંડ થતો હતો તે હવે થોડો દંડ આપવાનો ઉપાય રાખે છે તથા થોડો (અનુસંધાન પાના નં. ૨૬ ૫૨)

પરમ પૂજ્ય શ્રી અમિતગતિ આચાર્ય વિરચિત

## શ્રી અમિતગતિ સામાયિક પાઠ

એક અનુયિતિન

પૂજ્ય બહેનશ્રી ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી

(શ્લોક - ૧૪)

નિષૂદતે યો ભવદુઃખજાલં,  
નિરીક્ષતે યો જગદ્ન્તરાલં ।  
યોડન્તર્ગતો યોગિનિરીક્ષણીયઃ,  
સ દેવદેવો હૃદયે મમાસ્તામ् ॥૪॥

**અન્વયાર્થ :** ભવદુઃખજાલં = સંસારના દુઃખ સમૂહને, યો = જે, નિષૂદતે = નાણ કરે છે, યઃ = જે, જગદ્ન્તરાલમ् = સંપૂર્ણ લોકલોકને, નિરીક્ષતે = નિષ્ઠાળે છે, યઃ અન્તર્ગતઃ = જે લોકમાં સ્થિત છે, યોગિ-નિરીક્ષણીય = યોગીજનો દ્વારા જાણાય છે, સ, દેવદેવો = તે દેવોના દેવ, મમ હૃદયમ् = મારા હૃદયમાં, આસ્તામ् = વિરાજમાન રહે.

### પદ્ધાનુવાદ :

જે કઠિન કષ્ટો કાપતાં, ક્ષણવારમાં સંસારનાં,  
નિષ્ઠાળતા જે સૂષ્ટિને જેમ, બોરને નિજ હસ્તમાં;  
યોગીજનોને ભાસતા, જે સમજતા સૌ વાતમાં,  
તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો હૃદયમાં.

### ગધાનુવાદ :

જેઓ આ સંસારની દુઃખરૂપી જીણે નાણ કરી નાખે છે, જે જગતના સમગ્ર લોકલોકને સહજપણે જાણે છે અને દેખે છે તથા મહાયોગીજનો દ્વારા જે ચિંતનમાં જાણવામાં આવી રહ્યા છે તે દેવાધિદેવ તમે મારા હૃદયમાં સદા વિરાજમાન રહે.

**વિશેખાર્થ :** અહીં સાધક મહાત્મા સામાયિક દરમ્યાન શુદ્ધભાવમાં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છે.

આત્માનો એટલો કે આપણો એવો સ્વભાવ છે કે જે વસ્તુનું તન્મયતાથી ચિંતન કરીએ તેવા ભાવરૂપે તે સમય માટે આપણે થઈ જઈએ છીએ. પરમકૃપાળુદેવ કહે છે,

“જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ (આત્માનો ઉપયોગ) તાદાત્યપણે પરિશિષ્ટે તો ટોપી આત્મા કહીએ.” સાધક મહાત્મા-પરમાત્મા કે સદગુરુનું ભાવપૂર્વક સ્મરણ કરે છે ત્યારે તે તેમના ગુણો ધારણ કરનાર બની જાય છે. આ સિદ્ધાંત અનુસાર સાધક ભગવાનને પોતાના હૃદયપંદિરમાં નિવાસ કરવા નાનું વિનંતી કરે છે.

જેના ચિત્તમાં સિદ્ધ પરમાત્માનો નિવાસ થાય તેને શું શું ફળ પ્રાપ્ત થાય છે ?

(૧) કઠિન કષ્ટો કપાય છે :- જે ભગવાનની સાચા ભાવથી ભક્તિ કરે છે કે જેને આપણે ‘પ્રશસ્ત રાગ’ કહીએ છીએ કે જે દ્વારા અશુભનો બંધ અટકી જાય છે અને વિશિષ્ટ પુણ્યનો આશ્રવ થાય છે, તે પુણ્યસંચયથી પાપકર્માનું પુણ્યમાં સંકમણ તથા પાપકર્માની સકામ નિર્જરા થવાથી તેના ફળરૂપ કષ્ટો અને દુઃખોનો સહજપણે નાશ થઈ જાય છે. આ કારણથી કહેવાય છે કે ભગવાન ભક્તની આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ - ત્રિવિધ તાપ (કષ્ટો) નો નાશ કરે છે. આ કાળમાં પુણ્યસંચયનું અને આત્મશુદ્ધિનું શ્રેષ્ઠ સાધન ભક્તિ છે.

● ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.

- શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક - ૨૦૧

● જિનવર ચરણકર્મણે નમે જે પરમભક્તિ રાગથી, તે જન્મવેલી મૂળ છેટ, ભાવ ઉત્તમ શક્તિથી,

- શ્રી ભાવપ્રાભૂત - ૧૫૭

● ઈણ વિધ પરખી મન વિસરામી

જિનવર ગુણ જે ગાવે,

દીનબંધુની મહેર નજરથી  
આનંદધન પદ પાવે ..... હો મલ્લિજિન.  
- શ્રીમદ્ આનંદધનજી મહારાજ

● જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય,  
ભક્તો કેરી પ્રભુગુણમહી ચિત્તવૃત્તિ ગુંથાય;  
વીટાયું જે તિમિર સઘણું રાત્રિએ વિશ્વમાંય,  
નાસે છે રે ! સૂરજ ઉગતાં સત્વરે તે સદાય.

- શ્રી ભક્તામર સ્તોત્ર

(૨) સૃષ્ટિને હસ્તમાં બોરની જેમ નિહાળે છે :- સિદ્ધ  
ભગવાનના દિવ્ય અને અલૌકિક કેવળજ્ઞાનનું અહીં  
વર્ણન છે. વીતરાગ દર્શનમાં દરેક મુદ્દાને પદ્ધતિસર  
અને વિજ્ઞાનની દાખિલી સમજાવવામાં આવે છે. દરેક  
જીવ શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છે. સાધક મહાત્મા  
સંસારી - અશુદ્ધ અવસ્થામાંથી ક્રમે ક્રમે આત્મશુદ્ધિને  
સાધી સિદ્ધ અવસ્થા પ્રગટાવે છે. પ્રથમ આત્માર્થિના  
ગુણ પ્રગટાવી પ્રત્યક્ષ સદ્ગુરુનો બોધ ગ્રહણ કરે છે.  
“કથાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;  
ભવે ખેદ, પ્રાણીદ્યા ત્યાં આત્માર્થ નિવાસ.”

- શ્રી આ. સિ. શાસ્ત્ર

સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરીને સાચું જ્ઞાન,  
સાચી શ્રદ્ધા અને સાચા આચરણની એકતારૂપ પુરુષાર્થ  
દ્વારા બારમા ગુણસ્થાનમાં પ્રથમ મોહનીયનો ક્ષય  
કરી, તત્પશ્ચાત્ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને  
અંતરાયનો નાશ કરી કેવળજ્ઞાન પ્રગટાવે છે. તેરમા  
ગુણસ્થાને અરિહંત - દેહ સહિત પરમાત્મા બની જાય  
છે. ત્યારપણી ચાર અધાતી કર્મોનો નાશ કરી અયોગી  
બની નિર્વિષને પ્રામ કરે છે - એટલે જન્મમરણથી  
છૂટી સિદ્ધલોકમાં બિરાજમાન થઈ જાય છે. આવા  
સિદ્ધ પરમાત્માને હવે જ્ઞાનને રોકનારું કોઈ કારણ  
રહ્યું નહીં તેથી તેમનું જ્ઞાન કોને ન જાણો ? એટલે કે  
તેમનું શુદ્ધ કેવળજ્ઞાન સમગ્ર લોકાલોકને સહજપણે  
જાણો છે - દેખે છે. તેમના શુદ્ધ દર્પણરૂપ કેવળજ્ઞાનમાં  
જગતના સર્વ કાળના સર્વ પદાર્�ો ગુણ પર્યાય સહિત  
સહજપણે એક સાથે પ્રતિબિંબિત થાય છે. આવું  
લૌકિક દિવ્ય કેવળજ્ઞાન તે વાણીનો વિષય નથી,  
માત્ર પરમાત્માના અનુભવનો વિષય છે.

“જે પદ શ્રી સર્વજ્ઞે દીહું જ્ઞાનમાં,  
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;

તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?  
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.”

- શ્રીમદ્ રાજચંદ્રજી ‘અપૂર્વ અવસર’  
(૩) યોગીજનોને ભાસતા જે સમજતાં સૌ  
વાતમાં- સાધક-ધર્મત્વા શ્લોકના ચોથા ચરણમાં સિદ્ધ  
પરમાત્માને હદ્યમાં વસવાનું કહે છે. તે નિશ્ચયથી  
જોઈએ તો શક્તિ અપેક્ષાએ પોતાના શુદ્ધ આત્માનું જ  
કથન છે.

મહા ભાગ્યવાન સાધક સંસારનું સ્વરૂપ જાણે  
છે. વિષયોનું સુખ તે માત્ર સુખાભાસ છે એવો તે  
અનુભવ કરીને સાચા સુખની શોધ કરવા સદ્ગુરુનો  
આશ્રય ગ્રહણ કરી, સાચું સુખ પોતાના આત્મામાં જ  
છે એવો નિર્ણય કરે છે. આવો સાધક તે મહાન યોગી  
કહેવાય છે. એવો યોગી પોતાની ચિત્તવૃત્તિને બાહ્ય  
પદાર્થો, શરીર, ઈન્દ્રિયો, સંકલ્પવિકલ્પરૂપ વિચારો  
અને શાસ્ત્રજ્ઞાનની વિકલ્પજાળને ભેટી પોતાના શુદ્ધ  
જ્ઞાયકભાવમાં લીન થતાં જ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપ  
અમૃતરસને પીએ છે.

આ જ આત્મદર્શન છે - પરમાત્મદર્શન છે  
- સમ્યગ્રદર્શન છે - આત્મજ્ઞાન છે - આત્માનુભવ  
છે - સ્વસંવેદન છે - આત્મસાક્ષાત્કાર છે -  
શુદ્ધાનુભૂતિ છે - સમાધિ છે. આ જ ઉત્તમ સાધકનું  
આ કાળનું લક્ષ છે.

આ પ્રમાણે આ શ્લોકનો પરમાર્થ છે - તે  
'સમાધિશતક'માં નીચે પ્રમાણે કહ્યો છે :-

“ઈન્દ્રિય સર્વ નિરોધીને, મન કરીને સ્થિરરૂપ;  
ક્ષાણભર જોતાં જે દીસે, તે પરમાત્મસ્વરૂપ”

- શ્રી સમાધિશતક - ૩૦

“જોઈ હદ્યનેત્ર વનક્ષેત્ર પધારો પ્રીતે રે,  
તારા રત્નગયની સાથ રહો રસ રીતે રે.”

- શ્રી રત્નરાજ મહારાજ

શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ

● ● ●

# શ્રી દેવયંત્રજી ચોવીશી

અશોકભાઈ પી. શાહ

સોળમા તીર્થકર

श्री शांतिनाथजिन स्तवन प्रारंभ

**ભૂમિકા :** વીતરાગ ભગવંતો જેવી પૂર્ણ  
 વીતરાગી, પરમ શાંત અધ્યાત્મદશા પામવાના કામી  
 એવા ગણિશ્રી દેવચંદ્રજ્ઞના હદ્યમાંથી એક પછી એક  
 તીર્થકર ભગવાનની અપૂર્વ સ્તવના નીકળતી જાય  
 છે. સ્તવનોની રચના વખતે તેમણે તો ભક્તિરસથી  
 છલોછલ હદ્યથી આ સ્તવનોનું પ્રભુ સમક્ષ બેસીને  
 ગાન પણ કર્યું હશે પરંતુ આપણે પણ એવી જ  
 ભક્તિનો લહાવો લઈ શકીએ એવી સ્તવન-સંપત્તિ  
 મૂકૃતા ગયા છે, તે માટે તેમને અનેકાનેક વંદન ઘટે  
 છે.

જગતદિવાકર જગત ફુપાનિધિ,  
વહાલા મારા સમવસરણમાં બેઠા રે;  
ચઉમુખ ચઉવિહ ધર્મ પ્રકાશો,  
તે મેં નયણો દીઠા રે,  
ભવિક જન હરખો રે,  
નીરખી શાંતિ જિણાંદ, ભવિક૦

ઉપશમ રસનો કંદ, નહી ઈણ સરિખો રે. ૧

**શબ્દાર્થ :-** જગતને સૂર્યની જેમ પ્રકાશિત કરનાર,  
 કૃપાના ભંડાર મારા વહાલા એવા શાંતિ જિણંદને  
 સમવસરણમાં બેઠેલા મેં આંખોથી જોયા છે. જેઓ  
 ચૌમુખી છે અને ચાર પ્રકારના ધર્મ પ્રકારો છે, જેઓ  
 ઉપશમ રસના કંદ છે, તેમના જેવો બીજો કોઈ નથી  
 એવા શાંતિ જિણંદને નીરખીને હે ભવ્ય જનો ! તમે  
 પણ હર્ષ પામો. (હિવાકર = સૂર્ય; કૃપાનિધિ = કૃપાના  
 ભંડાર; ચઉમુખ = ચાર મુખવાળા-એટલે કે એક મુખ અને  
 બીજા ગ્રણ દેવકૃત કુન્દિમ; ચઉવિહ = ચાર પ્રકારે)

વિશેષાર્� :- ગણિશ્રી દેવચંદ્રજી સ્તવનાની શરૂઆત  
શ્રી શાંતિનાથ ભગવાનના ગુણગાનથી કરે છે. સૌથી  
પહેલાં તો કહે છે કે શાંતિનાથ જિલ્હાંદ મારા વહાલા  
છે, મારા પ્રિયતમ છે કારણ કે તેઓ સંસારસાગરથી  
પાર પમાઉનાર મારું એકમાત્ર શરણ છે. મારા એ  
પ્રભુ 'જગત દિવાકર' છે અર્થાત્ સૂર્ય જેમ જગતના  
સર્વ જીવોને પ્રકાશિત કરે છે તેમ પ્રભુ જગતના  
જીવોને તત્વજ્ઞાનનો પ્રકાશ, મોક્ષમાર્ગનો પ્રકાશ  
આપનારા છે. વળી પ્રભુ 'જગત કૃપાનિધિ' છે  
અર્થાત્ જો તેમના ઉપદેશને જીવ અનુસરે તો તે સ્વયં  
ભગવાન બની જાય એવી કૃપાના કરનાર, કૃપાના  
ભંડાર છે.

ગણિશ્રી દેવચંદ્રજીને પ્રભુ પ્રત્યે એટલું  
વહાલપ વર્તે છે કે દુન્યવી પ્રત્યેથી બધો પ્રેમ હટાવી  
પોતાનો સમસ્ત પ્રેમ માત્ર પ્રભુ ઉપર હાલવી દીવો  
છે. તેથી જ્યારે પ્રભુના દર્શન કરે ત્યારે તેમને તો  
પ્રભુ સાક્ષાત્ સમવસરણમાં બેઠા હોય એવું જ  
ભાર્યમાન થાય છે અને પોતે તેમને પ્રત્યક્ષ નિહાળી  
ધન્યતા અનુભવી રહ્યાં છે એવો ભાવ લાવી શકે છે  
કારણ કે પોતાની પ્રેમભક્તિથી પ્રભુ સાથે તેમણે એવું  
જોડાશ. એવું connection સાથ્ય છે.

પોતાની ભાવદુષશાખામાં સભવસરાજી લાવીને

હવે પ્રભુનું વર્ણન કરતાં દેવચંદ્રજી કહે છે કે ચૌમુખી અને ચૌવિધ ધર્મ પ્રકાશનાર પ્રભુને “મેં નયાણે દીક્ષા”. પ્રભુને પ્રથમ તો મેં શાક-ચક્ષુથી જોયા, પછી ગુરુએ તેમનું સ્વરૂપ સમજાવ્યું અને હવે મેં તેમને મારા હદ્ય-નયાણથી, મારા અંતરચક્ષુથી જોયા. કેવા છે તે પ્રભુ ? ચૌમુખી : સમવસરણમાં પૂર્વ દિશામાં જેમનું મુખ છે તે સાક્ષાત્ પ્રભુ બિરાજમાન છે. બાકીની ત્રણ દિશામાં દેવોએ બનાવેલ કૃત્રિમ પણ આબેહૂબ બિંબ છે. પ્રભુ દિવ્યધ્વનિ દ્વારા ચૌવિધ - ચાર પ્રકારે ધર્મ પ્રકાશે છે - મહાપ્રતી મુનિઓ માટે સમ્યક્જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને ગૃહસ્થો માટે દાન-શીલ-તપ-ભાવ એમ અપેક્ષાએ લઈ શકાય. સર્વ કષાયો નાથ થયા હોવાથી અને અનંત ચતુષ્યથી પરમોત્કૃષ્ટ કૃત્યકૃત્યતા અનુભવતા હોવાથી શાંતિનાથ પ્રભુ એવા “ઉપશમ રસના કંદ” છે કે “નહીં ઈણ સરીખો” - તેમના સરખો પરમ શાંતિદાતાર બીજે કયાંય જોવા નહીં મળે. તેથી દેવચંદ્રજી સર્વ ભવ્ય જીવને આદ્ભુત કરતાં કહે છે કે તમે સૌ આવા શાંતિ જિંદાને હદ્ય તુમ થાય ત્યાં સુધી નીરખીને અત્યંત હર્ષ પામો. પ્રભુના દિવ્ય કાંતિમય સ્વરૂપને નીરખી મારા તો સાડા ત્રણ કરોડ રોમ ઉલ્લસે છે. તમે પણ પ્રભુને નીરખી એ રીતે ઉલ્લસિત થાઓ. પ્રભુદર્શનનો આવો લહાવો ફરીથી નાહિ મળે. પ્રભુના બાહ્યસ્વરૂપનું વર્ણન કરતાં હવે કહે છે :

**પ્રાતિહારજ અતિશય શોભા,**  
**વાહલા, તે તો કહિય ન જાવે રે;**  
**ધૂક બાલકથી રવિકરભરનું,**  
**વર્ણન કુણિ પરે થાવે રે. ભવિક૦ ૨**

**શબ્દાર્થ :** પ્રભુ પ્રાતિહાર્ય અને અતિશયોથી એવા શોભાયમાન છે કે જેનું વર્ણન વાણીથી કહી શકાય તેવું નથી - જેમ ધુવડના બચ્ચાથી સૂર્યના કિરણોના સમૂહનું વર્ણન કઈ રીતે થઈ શકે ? (પ્રાતિહારજ = પ્રાતિહાર્ય, તીર્થકર પ્રભુના અતિશયો; ધૂક = ધુવડ; રવિકરભર = સૂર્યના ભરપૂર કિરણો; કુણિ પરે = કઈ રીતે).

**વિશેષાર્થ :** જેમ ધુવડ સ્વયં દિવસમાં જોઈ શકતું નથી, તો તેનું બચ્ચું અત્યંત તેજસ્વી સૂર્યને જોઈને તેના કિરણોનું વર્ણન કઈ રીતે કરી શકે ? તદ્દન અશક્ય. તે જ રીતે દેવચંદ્રજી કહે છે કે પ્રભુના અછ પ્રાતિહાર્ય અને ઉઘ અતિશયોથી પ્રભુ એટલા ઉત્કૃષ્ટપણે શોભાયમાન થઈ રહ્યા છે કે જેનું વર્ણન કરવા હું અસમર્થ છું. ઇતાં ભક્તિવશ હું યથામતિ પ્રયત્ન કરું છું. પ્રભુ તો પૂર્ણ વીતરાગી છે, પણ તીર્થકર નામકર્મને લીધે સહજપણે તેઓ આ અતિશયોથી વિભૂષિત હોય છે. પ્રસંગાનુસાર તે અતિશયો ટૂંકમાં અહીં આપીએ છીએ. **પ્રાતિહાર્ય :** આઠ હોય છે, આ પ્રમાણે - અશોકવૃક્ષ, પુષ્પવૃદ્ધિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, દેવહુંદુભિ, ત્રણ ઇત્યાદ અને ભામંડલ. **ઉઘ અતિશય :** દેવલોકમાં ઘંટનાદ ઈત્યાદિ ૧૦ જન્મકૃત, અંતરિક્ષમાં વિહારાદિ ૧૦ કેવળજ્ઞાનકૃત અને દિવ્ય સુગંધિત પવન ઈત્યાદિ ૧૪ દેવકૃત. પ્રભુનો આવો અત્યંત આશ્ર્યકારી, અલૌકિક બાહ્ય વૈભવ તેમની અનંત ચતુષ્ય આદિ આંતરિક આત્મિક વૈભવનો ધોતાક છે. હવે પ્રભુની દિવ્યધ્વનિરૂપે વહેતી વાણી કેવી હિતકારક છે તે કહે છે :-

વાણી ગુણ પાંત્રીશ અનોપમા,

વાં અવિસંવાદ સારૂપે રે;

ભવદુઃખવારણ શિવસુખકારણ,

શુદ્ધો ધર્મ પ્રરૂપે રે, ભવિક૦ ઉ

**શબ્દાર્થ :** શાંતિનાથ ભગવાનની પાંત્રીશ ગુણોવાળી વાણી અનુપમ છે અને તેનું સ્વરૂપ પૂર્વપિર વિરોધરહિત છે. તે વાણી ભવના દુઃખોને નિવારનાર અને મોકસુખના કારણભૂત એવા શુદ્ધ ધર્મની પ્રરૂપણ કરે છે. (અવિસંવાદ = પૂર્વપિર વિરોધરહિત, પરસ્પર વિરોધરહિત)

**વિશેષાર્થ :** ભગવાનની વાણી જ અનેક અતિશયોવાળી છે. માલકોંસ રાગમાં ખરતી દિવ્યધ્વનિ પાંત્રીશ ગુણોવાળી અનુપમ છે. અહીં પાંત્રીશ ગુણો વિસ્તારથી નહીં આપીએ પરંતુ દેવચંદ્રજીએ આ ગાથામાં જ પાંચ ગુણો દર્શાવ્યા છે - અનુપમ, અવિસંવાદરૂપ,

ભવદુઃખવારણ, શિવસુખકારણ અને શુદ્ધ ધર્મ પ્રરૂપક. પરમકૃપાળુંદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ પાંત્રીશ ગુણોના સારરૂપ તેમની કાવ્યરચના ‘જિનેશ્વરની વાણી’ માં મંગલમથી પ્રભુવાણીનાં ગુણો બતાવતાં કહ્યું છે કે :

અનંત અનંત ભાવ બેદથી ભરેલી ભલી,  
અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે;  
સકલ જગત ઇતકારિણી હારિણી મોહ,  
તારિણી ભવાબ્ધી મોક્ષચારિણી પ્રમાણી છે.

આમાંથી ચોથા ચરણના ગુણોનું દેવયંદ્રજીની  
આ ગાથા સાથે કેટલું બધું સાખ્ય છે ! સર્વ જ્ઞાનીપુરુષોએ  
આ રીતે ભગવાનની વાણીનો મહિમા ગાયો છે અને  
આપણે જિનવાણીમાતા તરીકે જ્ઞાનપાંચમના દિવસે  
તેની પૂજા પણ કરીએ છીએ.

શ્રી દેવચંદ્રજીએ અહીં આ વીતરાગવાણીને  
“અવિસંવાદ સરૂપે” કહી. પ્રભુની વાણી  
અનેકાંતમય, સ્યાત્પદથી અંકિત હોવાથી અવિસંવાદ  
સ્વરૂપવાળી છે, અર્થાતું તે પૂર્વપર અવિરોધપણે  
વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રરૂપણ કરે છે. જેમ કે, આત્મા  
નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ પ્રરૂપણમાં  
કોઈ વિસંવાદ, વિરોધ નડતો નથી કારણ કે દ્રવ્યાર્થિક  
નયથી આત્મા નિત્ય છે અને પરયાર્થિક નયથી આત્મા  
અનિત્ય છે. આચાર્યપ્રવર અમૃતયંત્રાચાર્ય તો શ્રી  
સમયસાર કળશ-૪ માં ત્યાં સુધી કહ્યું કે જે ભવ્ય આ  
ઉભયનયના વિરોધને મટાડાનારી સ્યાત્પદથી અંકિત  
જિનવાણીમાં રમણતા કરે છે તેના મોહનો નાશ થઈ  
જાય છે - વળી “શુદ્ધો ધર્મ પ્રરૂપે” - આત્માની  
રાગ-દ્વેષ-અજ્ઞાન આદિ અશુદ્ધતા દૂર કરાવી  
શુદ્ધાત્માની પ્રાપ્તિનો માર્ગ બતાવતો શુદ્ધ ધર્મ પ્રરૂપે  
પ્રભુની વાણી છે. આત્માનો શુદ્ધ ધર્મ એવા  
સમ્યક્કદર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થતાં જીવના સંસાર-  
પરિભ્રમણરૂપ ભવોભવના દુઃખોનું નિવારણ થાય છે  
અને ભવ્યજીવોને મોક્ષસુખ પ્રાપ્ત કરાવે એવી  
સામર્થ્યવાન પ્રભુની દેશના છે. તેથી દેવચંદ્રજી અહીં  
તેને ‘ભવદ્બુદ્ધભવારણ’ અને ‘શિવસ્સુખકારણ’ કહીને

બિરદાવે છે.

હવે આગળ ‘સ્થાપના જિન’ પણ જીવોનું કલ્યાણ કરવામાં કેવું પ્રબળ નિમિત્ત છે તે દર્શાવે છે :

દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિ મુખ,  
વાં ઠવણા જિન ઉપગારી રે;  
તસુ આલંબન લહિય અનેક,  
તિહાં થયા સમકિતધારી રે. ભવિક૦ ૪

**શબ્દાર્થ:** દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં જેમનું મુખ છે તે સ્થાપના કરેલ (દેવકૃત) જીન પણ ઉપકારી છે કારણ કે તેનું આલંબન લઈને અનેક ભવ્ય જીવો ત્યાં સમકિતધારી થાય છે. (દિશા = દિશા, દવશા = સ્થાપના; તસુ = તેનું; લહિય = લઈને, તિહાં = ત્યાં)

**વિશેષાર્� :** પૂર્વમુખી જે સાક્ષાત્ ભગવાન બિરાજે છે તેમની સામેની પર્યાદામાં બેસવાનો અધિકાર માત્ર દેશપ્રતી શ્રાવક અને મહાપ્રતી મુનીશ્વરોને હોય છે, બાકીના સર્વ જીવો-મનુષ્ય, તિર્યંચ અને દેવો-બાકીની ગ્રાણ દિશા-પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાં દેવકૃત જિનબિંબો છે, જે ‘ધવણા જિન’ અર્થાત્ સ્થાપના નિક્ષેપથી ભગવાન છે તેમના દર્શન કરી સાક્ષાત્ ભગવાનને જ જોઈ રહ્યા છે એવો અનુભવ કરી ધન્યતા અનુભવે છે. આ સ્થાપના જિન પણ અત્યંત ઉપકારી છે કારણ કે તેના દર્શન કરીને અને મૂળ ભગવાનની દિવ્યધારણાને અનેક જીવો તે અવલંબન લઈ “તિહાં થયા સમકિતધારી” - સમ્યગ્દર્શન પામે છે. ખરેખર તો “જિન પડિમા જિન સારખી” - જિન પ્રતિમા પણ સાક્ષાત્ જિન જેવી જ ઉપકારી છે એમ દેવયંદ્રજી સિદ્ધ કરવા માગે છે. આપણો પણ અનુભવ છે કે જિનપ્રતિમાનું દર્શન-પૂજા કરતાં આપણા કણાયો ઉપશાંત થાય છે અને આપણે શાંતભાવમાં સરી પડીએ શીએ.

સાક્ષાત્ જિન અને સ્થાપના જિનનું  
ઉપકારીપણું તેમજ તે અવલંબનથી થતી સાધકના  
ભાવોની વિશુદ્ધિની વધુ સમજજા દેવચંદ્રજી નય-  
નિક્ષેપ દ્વારા આગળ ઉપર આપશે જે અવસરે  
વિચારીશાં.: (કુમશઃ)

## સમ્યક તપ (ક્રમાંક-૩)

**બા.ગ્ર. સુરેશજી**

### તપના પ્રકાર

સાધનની અપેક્ષાએ તપના બાર ભેદ શ્રી જિનેન્દ્રદેવ દ્વારા નિરૂપિત કરાયેલ છે :-

- (૧) અનશન (ઉપવાસ) (૨) અવમોદાર્થ (ગૃહોદરી) (૩) વૃત્તિ પરિસંખ્યાન (૪) રસપરિત્યાગ (૫) વિવિક્તશચ્ચાસન (૬) કાયકલેશ (૭) પ્રાયશ્ચિત્ત (૮) વિનય (૯) વૈયાવૃત્ય (૧૦) સ્વાધ્યાય (૧૧) વ્યુત્સર્ગ (૧૨) ધ્યાન

આમાંથી પ્રારંભનાં તપ ‘બાધ્ય તપ’ કહેવાય છે કારણ કે એક તો તે બહારમાં દેખાય છે અર્થાત્ બહારથી ભોજન, રસત્યાગ, આતપનયોગ આદિનો ત્યાગ અને અનુષ્ઠાન કરતી વ્યક્તિ દેખાય છે. બીજું, એ તપ બાધ્ય સામગ્રી જેમ કે શરીર, ભોજનાદિના આશ્રયથી કરવામાં આવે છે અને ગ્રીજું, આ તપ અંતરંગ તપમાં સહાયકારી થાય છે અર્થાત્ ખેતરની વાડની જેમ તેમની સુરક્ષા કરે છે. અંતરંગ તપને અંતરંગ એટલા માટે કહે છે કે એક તો તેનો આશ્રય અંતરંગ મન છે, બીજું તે કરતાં સમયે અન્ય કોઈ વ્યક્તિને એવું નથી લાગતું કે તે કોઈ તપસ્યા કરી રહ્યો છે અર્થાત્ બહારમાં તપ દેખાતું નથી, અને ગ્રીજું આ તપ અપેક્ષાકૃત આત્માભિમુખ થવામાં વધારે સહાયક છે. હવે, આપણે પ્રથમ બાધ્યતપનો વિચાર કરીશું.

### બાધ્ય તપ

#### ૧. અનશન (ઉપવાસ)

**સ્વરૂપ :-** ‘અશન’ નો અર્થ ભોજન થાય છે તથા અશન (ભોજન) ન કરવું અનશન કહેવાય છે. “ભોજનની ઈશ્વરા (વિકલ્પ) નો નિશ્ચિત કે અનિશ્ચિત સમયાવથી માટે સંકલ્પપૂર્વક ત્યાગ (નિરોધ) કરવો અનશન તપ કહેવાય છે.” આમાં ભોજન સંબંધી

વિકલ્પોનો નિરોધ થાય છે માટે તેને ‘તપ’ કહ્યું છે. આ તપનું વિશેષ પ્રયોજન અનાદિકાળીન આહારસંશાને શિથિલ કરીને તેના સંસ્કારોને સમૂળ નાચ કરવાનું છે. તેનું બીજું નામ ‘ઉપવાસ’ પણ છે. આમ તો બજે એકબીજાના પર્યાયપૂર્વે ઓળખાય છે તો પણ સૂક્ષ્મતાથી વિચાર કરતાં જ્ઞાય છે કે આ બજે મળીને પોતાનું પ્રયોજન સિદ્ધ કરવામાં સમર્થ છે. અનશન બાધ્ય સ્વરૂપ છે તથા ઉપવાસ તેનું અંતરંગ રૂપ છે; કારણ કે અનશનમાં ભોજનના ત્યાગની મુખ્યતા છે તથા ઉપવાસમાં આત્મસંમુખ થવાની મુખ્યતા છે. આત્માની સમીપ રહેવાને ઉપવાસ કહે છે. “આત્માની સમીપ રહેવાનો અલિપ્રાય એ છે કે આહાર, વિષય અને કખાયોનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં લાગવું.” આહારત્યાગ સુધીનું કાર્ય અનશન કિયાથી થાય છે તથા બાકીના વિષય-કખાયોનો ત્યાગ ઉપવાસ કિયા દ્વારા સંપત્ત થાય છે. ઉપવાસમાં આરંભનો ત્યાગ કરવામાં આવે છે, જેથી વિષયોનો સંપર્ક છૂટી જાય છે તથા ઉપવાસના દિવસે સ્વાધ્યાય, સામાચિક, ભક્તિ આદિનું વિધાન છે, માટે કખાયોનો ત્યાગ પણ સ્વતઃ થઈ જાય છે. આ રીતે અનશન નાસ્તિ પક્ષ છે તો ઉપવાસ અસ્તિ પક્ષ છે અને બજે મળીને તેને સંપૂર્ણતા પ્રદાન કરે છે. સંકેપમાં “સમસ્ત પ્રકારના આહાર, ઈન્જિય વિષય, આરંભ અને કખાયોનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં ચિત્ત લગાડવું તે ઉપવાસ કે અનશન તપ કહેવાય છે.”

#### ઉપવાસ તપના લાભ

(૧) કાર્તિક્યાનુપ્રેક્ષા ગ્રંથમાં બાલયતિ શ્રી કાર્તિક્ય સ્વામી ઉપવાસ તપનું માહાત્મ્ય બતાવતા લખે છે કે વિષય-કખાયોના સમ્યક ત્યાગપૂર્વક કોઈ જીવનમાં જો એક ઉપવાસ પણ કરે તો તે નિશ્ચયથી અસંખ્યાત કર્માની નિર્જરા કરતો સ્વર્ગની સંપદાનો અધિકારી થાય છે.

(૨) ઉપવાસ તપના સંબંધમાં આધુનિક કાળના

મહાતપસ્વી ચારિત્ર ચક્વર્તી આચાર્ય શ્રીશાંતિસાગરજી કહે છે કે સમ્ભ્રદ્વ વિવિધી એક ઉપવાસ કરવાથી અનેક જન્મોના સંચિત ગાઢ કર્મ પણ નિર્જરિત થઈ જાય છે.

(૩) પરમાર્થ ઉપવાસનો પરમ લાભ અતિશય કર્મોની નિર્જરા છે.

(૪) ઉપવાસ કરવાથી ઈન્દ્રિયોને પોષણ ન મળવાથી તેમની ઉન્મત્તતા શાંત થઈ જાય છે, જેથી કામાદિ વિકાર સહજ જ ઉપશમિત થઈ જાય છે.

(૫) ઉપવાસથી ધ્યાન અને આસન સિદ્ધિમાં ઘણી સહાયતા મળે છે.

(૬) ઉપવાસથી નિદ્રાજય પણ થાય છે.

(૭) નિયમિત ઉપવાસ કરવાથી અનાદિકાલીન નિવિડ (ગાઢ) આહારસંજ્ઞા શિથિલ થઈ જાય છે જેથી આપણો આણાહારક આત્મસ્વભાવ પ્રગટ થાય છે. આ ઉપવાસનું સર્વોત્તમ ફળ છે.

આ રીતે ઉપવાસના અનેકવિધ ફળ આગમમાં બતાવ્યા છે જે શ્રદ્ધા અને સ્વાનુભવથી સિદ્ધ છે, તેથી આપણે શક્તિતઃ અર્થાત્ શક્તિનું ગોપન કર્યા વિના આ મહાતપનું અનુષ્ઠાન કરવું જોઈએ.

**ઉપવાસની વિધિ :-** જે દિવસે ઉપવાસ કરવાનો હોય તેના આગળના દિવસે સુયસ્તની બે ઘડી પૂર્વ સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી પછીના દિવસના ઉપવાસનો સંકલ્પ ગ્રહણ કરવો જોઈએ. પછીને બને તો રાત્રે જ કોઈ મંદિર પાસેની ધર્મશાળામાં, સાધુ-સાધીઓના નિવાસ પર કે કોઈ આધ્યાત્મિક સાધના કેન્દ્ર (આશ્રમ) માં જવું, અથવા પોતાના ઘરમાં જ અન્યત્ર ગમનાગમનનો પરિત્યાગ કરી એકાંત કષ્ટમાં જ રહેવું. ભોજનના ત્યાગના પચ્ચાણની સાથે-સાથે બને ત્યાં સુધી ઉપવાસ પર્યાત્ત મૌનનો સંકલ્પ કરવો કારણ કે મૌનપૂર્વક ઉપવાસ કરવાથી ભાવોની વિશેષ વિશુદ્ધિ થાય છે. આખા દિવસમાં સ્વાધ્યાય, પૂજા, માળા આદિ શું-શું કરવું તેની સમયસારણી બનાવવી. આટલો સમય સ્વાધ્યાય, આટલો સમય ધ્યાન, આટલો સમય પૂજા, આટલા જાપ ઈત્યાદિ દિનચર્યા નિશ્ચિત કરવાથી આખો દિવસ સહજતાથી નીકળી જાય છે. ભૂખ્યા રહેવાથી જો અશક્તિનો અનુભવ થાય તો થોડી

વાર શવાસનમાં સૂઈને દેહથી બિન પોતાના જ્ઞાનસ્વરૂપનું ચિંતન કરવું. રાત્રે જ્યારે આળસ જેવું લાગે તારે ભારે ગ્રંથાદિ ન વાંચી પ્રથમાનુયોગનો કોઈ ગ્રંથ કે મંત્ર જાપ કરવો. ઉપવાસના બીજા દિવસે સવારે ઊરીને સર્વ પ્રથમ પ્રતિકમણ અને સામાયિક કરીને સ્નાનાદિથી પરવારી, શ્રી જિનેન્દ્રાદેવનો અભિષેક-પૂજન કરી, જો ગુરુનું સાન્નિધ્ય હોય તો તેમના દર્શન કરીને, પાત્રોને યથાસંભવ દાન કરી, શાંતભાવથી પારણું કરવું.

**ઉપવાસના દિવસે રાખવા યોગ્ય સાવધાનીઓ :-**

(૧) ઉપવાસના દિવસે કોઈ પણ પ્રકારનો લૌકિક વ્યવહાર કરવો નહીં.

(૨) ઉપવાસના દિવસે નિયમથી બ્રહ્મચર્યનું પાલન કરવું તથા તત્સંબંધી નિમિત્તોથી દૂર રહેવું.

(૩) સમય પસાર કરવા ઉપન્યાસ, ટેલિવિજનમાં ધારાવાહિક, ફિલ્મ આદિ પણ જોવાનું નહીં.

(૪) યથાસંભવ મૌન રાખવું.

(૫) દિવસમાં બને ત્યાં સુધી સૂવું નહીં.

આશય એ છે કે પૂર્વોક્ત પ્રકારે ઉપવાસ તપ કરીને આ મનુષ્યતનની સાર્થકતા સિદ્ધ કરવી.

## ૨. ઊણોદરી (અવમોદાય) તપ

**સ્વરૂપ :-** ઉનનો અર્થ થોડું ઓછું થાય છે, ઉદરનો અર્થ પેટ થાય છે. ત્રણ-ચતુર્થીશ પેટ ભરવું અને એક ચતુર્થીશ ખાલી રાખવું ઊણોદરી કહેવાય છે અથવા “પેટ ભરીને ખાવાની ઈચ્છાનો ત્યાગ કરવો ઊણોદરી તપ કહેવાય છે.” આમાં ભોજન તો કરવામાં આવે છે પરંતુ અનિયંત્રિત સ્વચ્છંદપૂર્વક ભોજન કરવાની ઈચ્છાનો નિરોધ કરવામાં આવે છે તેથી તેને તપ માણું છે. કોઈ અપેક્ષાએ આ તપ ઉપવાસથી પણ વધારે પ્રભાવી અને કઠિન મનાય છે. કારણ કે આમાં વધી ગયેલ ઈચ્છાને તુરત જ રોકવી પડે છે. ઉપવાસમાં તો આહાર ન કરવાનો સંકલ્પ કરીને વ્યક્તિ તત્સંબંધી નિમિત્તનો પણ ત્યાગ કરી દે છે પરંતુ ઊણોદરીમાં તેના સામે ભોજન હોય છે, ભૂખ પણ હોય છે અને ભોજન કરવાની પ્રબળ ઈચ્છા હોય છે આવા સમયે તેનો એકદમ

પરિત્યાગ કરી દેવો તે અપેક્ષાકૃત વધારે સંયમ શક્તિનો પરિચાયક છે. કોઈ કામ ધારાપ્રવાહથી ચાલતું હોય તેને અચાનક વચ્ચમાં જ રોકી દેવું તેમાં અસાધારણ મનોબળની આવશ્યકતા છે. જેમ કે કિકેટ મેચ ચાલી રહી હોય અને તે તેની પરાકાળાએ પહોંચી હોય ત્યારે તેને જોતાં - જોતાં છોડી દેવી તે દુષ્કર કાર્ય છે, અસાધારણ મનોજ્યનું પરિચાયક છે. ઉણોદરી તપથી આવી અસાધારણ મનોજ્યની વૃત્તિનો વિકાસ થાય છે. આ વૃત્તિનો પ્રયોગ આપણે અન્ય સ્થાનો પર પણ કરવો જોઈએ. જેમ કે આપણને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા થાય તો તેને થોડો જ ભોગવીને વચ્ચમાં જ તેનો ત્યાગ કરી દેવો જોઈએ, બહુ બોલવાની ઈચ્છા થાય ત્યારે થોડું બોલીને ચૂપ થઈ જવું, ઘણો કોથ આવે ત્યારે તુરત જ તેને ઉપશમિત કરી દેવો ઈત્યાદિ અનેક પ્રકારે આ વૃત્તિનો મનોજ્ય કરવામાં પ્રયોગ કરવા જોઈએ.

ઉપવાસ તપમાં વિકલ્પનો સંપૂર્ણ ત્યાગ કરવા પર જોર હોય છે, જ્યારે ઉણોદરી તપમાં જાગેવા અથવા વહેલા વિકલ્પનો જ્ય કરવા પર જોર આપવામાં આવે છે. બનેનું પોત-પોતાનું સ્વતંત્ર પ્રયોજન અને કાર્ય છે. પ્રથમ તો વિકલ્પના સંપૂર્ણ ત્યાગરૂપ ઉપવાસનો જ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે તે અપેક્ષાકૃત વધારે સુરક્ષિત છે. જો તે ન થઈ શકે તો વિકલ્પજ્યરૂપ ઉણોદરીનું અનુષ્ઠાન શ્રેયસ્કર છે. વર્તમાનકાળમાં હીન સંહનનશક્તિને લીધે અને હીન સંકલ્પબળને કારણે સામાન્યરીતે વ્યક્તિને ઉપવાસ કરવો કઠણ લાગે છે. એવા સમયે તેના શ્રેષ્ઠ વિકલ્પરૂપ ઉણોદરી તપ કરવું હિતકારી છે કારણ કે તેમાં પૂર્ણ રૂપથી ભૂખ્યા પણ નથી રહેવું પડતું અને મનોજ્યના સંસ્કાર પણ પડે છે. તેથી ઉત્સાહપૂર્વક ઉણોદરી તપ નિત્ય કરવું જોઈએ.

**ઉણોદરી તપની વિધિ :-** આદર્શ રૂપથી તો તેનું સ્વરૂપ એવું છે કે ભોજનમાં સામાન્યરૂપથી બત્તીસ ગ્રાસ લેવાનું વિધાન છે. તે ઊર કોળિયામાં રોજ એક-એક ઓછો કરતાં-કરતાં એક ગ્રાસ સુધી આવવું અને ફરી એક-એક ગ્રાસ વધારતાં - વધારતાં ઊર ગ્રાસ સુધી આવવું આ તેનું આદર્શરૂપ છે અને કયાંક તો ચોખાનો એક દાણો એક ગ્રાસમાં લઈ બાકીનાને છોડી દેવામાં

આવે છે. વાસ્તવમાં આ મનોજ્ય કરવાના જ વિવિધ ઉપાય છે. સામાન્યરૂપે આપણે ભૂખથી ઓછું ખાવું જોઈએ, પરંતુ બધાની ભોજન શક્તિ અલગ-અલગ હોય છે, તેથી દરેકે પોતાના ભોજનની માત્રા સ્વયં નિશ્ચિત કરવી જોઈએ. તેનું માપદંડ એ રાખવું કે જ્યારે એમ લાગે કે પેટ થોડું ખાલી છે, ખાવાની શક્તિ પણ છે અને ખાવાની ઈચ્છા પણ થાય છે, એવા સમયે ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ, ત્યારે જ ઉણોદરી નું ફળ મળે છે. ભોજન કરવાની ઈચ્છા પણ ન થતી હોય અને શક્તિ પણ ન હોય ત્યારે ઓછું જમવું ઉણોદરી નથી કારણ કે આમાં ઈચ્છા નિરોધરૂપ પ્રયોજનની સિદ્ધિ થતી નથી.

### ઉણોદરી તપના લાભ

(૧) વધેલ ઈચ્છાઓનો નિરોધ થાય છે, જે કર્મનિર્જરાનું કારણ છે. આ જ તેનું પરમ ફળ છે.

(૨) મનોજ્યની વૃત્તિનો વિકાસ થાય છે.

(૩) પેટ પર્યામ ખાલી રહેવાથી આળસ, નિદ્રા પર વિજય થાય છે.

(૪) સ્વાધ્યાય, ધ્યાનાદિ અંતરંગ તપમાં આ સવાધિક ઉપયોગી છે. કારણ કે કદાચ ઉપવાસથી દુર્બળતાને લીધે આળસ આદિ આવી શકે છે, જેથી સ્વાધ્યાય - ધ્યાનાદિમાં ચિત્ત ઉત્સાહપૂર્વક ન લાગે. આ દોષનું ઉણોદરી તપ નિરાકરણ કરી દે છે અર્થાત્ આનાથી શક્તિહીનતા નથી આવતી અને આળસ પણ આવતી નથી, તેથી આવશ્યક કરવામાં ઉત્સાહ જળવાઈ રહે છે.

(૫) ભોજન અલ્ય કરવાથી ઈન્દ્રિયોમાં ઉન્મત્તતા આવતી નથી, જેથી મન વિકારરહિત, પવિત્ર, હલકું અને પ્રફુલ્લિત રહે છે.

(૬) સ્વાસ્થ્ય સારું રહે છે.

આશય એ છે કે ઉણોદરી તપ અપેક્ષાકૃત વધારે સરળ અને સહેલું છે, આને કોઈ પણ સહેલાઈથી કરી શકે છે. સરળ અને સહેલું હીવાની સાથે-સાથે તેના લાભ પણ ઘણા છે એમ જાણીને નિત્ય આ અમૃતફળદાયી તપનું અનુષ્ઠાન (આચરણ) કરવું જોઈએ, એવી શ્રી સદ્ગુરુની શીખ છે. (કુમશઃ)

## શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર (ક્રમાંક-૬)

**મહેન્દ્રભાઈ કે. ખંડાર**

### આચાર્યશ્રીની લઘુતા-૪

#### ● મૂળ શ્લોક : (વસંતતિલક)

યે યોગિનામયિ ન યાન્તિ ગુણાસ્તવેશ,  
વક્તું કથં ભવતિ તેષુ મમાવકાશઃ ?  
જાતા તદેવમસમીક્ષિતકારિતેયં,  
જલ્પન્તિ વા નિજગિરા નનુ પક્ષિણોર્પિ ॥૬॥

#### ● અન્યવાર્થ :

(હે) ઈશ ! યે તવ ગુણાઃ યોગિનાં અપિ વક્તું  
ન યાન્તિ તેષુ (વક્તું) મમ અવકાશઃ કથં  
ભવતિ ? તદ્દ એવં ઇયં (મમ) અસમીક્ષિત  
કારિતા જાતા વા નનુ પક્ષિણઃ અપિ નિજગિરા  
જલ્પન્તિ ॥

● શાસ્ત્રવાર્થ : યે - જે, યોગિનામ् - યોગી પુરુષો,  
અપિ - પણ, ન - નથી, યાન્તિ - (કહી) શકતા,  
ગુણાઃ - ગુણો, તવ - આપના, ઈશ - (હે) પ્રભુ,  
વક્તું - કહેવાને, કથં - કેવી રીતે, ભવતિ - થાય,  
તેષુ - તે વિષયમાં, મમ - મારો, અવકાશઃ -  
અવકાશ, સામર્થ્ય, શક્તિ, જાતા - (સહજ) થયું,  
થઈ, તદ્દ - તેથી, એવં - આ પ્રમાણે, ઇયં - આ  
(સ્તુતિ), અસમીક્ષિત - અવિચારી, વિચાર્ય વિનાનું,  
કારિતા - કાર્ય, પ્રવૃત્તિ, જલ્પન્તિ - બોલે છે, વા -  
અથવા, નિજગિરા - પોતાની વાણી (ભાષા), નનુ -  
ખરેખર, પક્ષિણોર્પિ - પક્ષીઓ પણ.

#### ● સમશ્લોકી ગુજરાતી પદ્ધાનુવાદ :

(હરિંગીત)

હે ઈશ ! યોગી પણ તમારા ગુણ જે ન કહી શકે,  
સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે;

વિચારવિષાનું કાર્ય આ દેખાય મારું તેહથી,  
પણ પક્ષી શું પોતાતણી ભાષા કહો વદતા નથી ? (૬)  
(મંદાકંતા)

તારા ગુણો નવ કહી શકે નાથ યોગીજનોયે,  
તે ગાવાને મુજમહિ કહો કેમ સામર્થ્ય હોયે ?  
લાગ્યું એથી પગલું મુજ આ ભૂલવાળું કદાપિ,  
બોલે છે તોએ નિજવચનથી પક્ષીઓ રે તથાપિ. (૬)

● ભાવાર્થ : હે ઈશર ! આપના જે ગુણોનું નિરૂપણ  
યોગીજનો પણ (યથાર્થ અને પૂરું) કરી શકતા નથી,  
એવા આપના ગુણોનું વર્ણન કરવામાં મારું સ્થાન ક્યાંથી  
(મારી શક્તિ ક્યાંથી હોય) ? તો સ્તુતિ કરવાનું મારું  
આ કાર્ય વિચાર વગરનું થયું જણાય છે. અથવા (પરંતુ,  
તો પણ) પોતાની ભાષામાં પક્ષીઓ પણ બોલે છે (તેમ  
હું પણ મારી શક્તિ પ્રમાણે ગુણ સ્તવન કરું છું).

● વિશેષાર્થ / પરમાર્થ : કલ્યાણમંદિર સ્તોત્રના  
પ્રારંભથી છંદ શ્લોક સુધી ભક્તિપ્રધાન લાઘવ (લઘુતા)  
ભાવની એક શુંખલા છે અને વિવિધ ઉપમાઓથી  
સિદ્ધસેન દિવાકરસૂરિજીએ પોતાની લઘુતા અને વિનયને  
નભ્રતાપૂર્વક કાવ્યમય શબ્દોમાં દર્શાવ્યા છે. રૂપક  
અલંકાર દ્વારા તેમના ભાવોનું નિરૂપણ કર્યું છે.

૭ શ્લોક સુધી આચાર્યશ્રીએ પોતે આરંભેલું  
પાર્શ્વ પ્રભુની સ્તુતિનું કાર્ય કેટલું મહાન અને કઠિન છે  
તે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. આ કાર્ય કરવાની  
શક્તિ પોતામાં નથી એવી પોતાની લઘુતા દર્શાવવા  
ઇતાં તેઓ આ કાર્ય શા માટે કરે છે તેનું રહસ્ય અને  
સ્તોત્ર રચનાનો હેતુ ૭ થી ૮ એ ત્રણ શ્લોકમાં છે.

આ શ્લોક-૬ માં પૂર્વોક્ત ૩-૪-૫ શ્લોકના

ભાવને પુષ્ટ કરે છે. સૂરિજીએ કહેલું કે સ્તુતિ કરવાની શક્તિ નથી અને છતાં ભક્તિવિશેષથી સ્તુતિ કરાય છે. આ વાત જ અહીં વિસ્તારાય છે. પાંચમા શ્લોકમાં આપેલ બાળકની ઉપમાથી આગળ વધીને આચાર્યશ્રી પોતાને પક્ષી સાથે સરખાવીને અત્યંત લાઘવતા દર્શાવે છે. પક્ષીનો કલરવ જેવો મીઠો લાગે છે તેવું જ આ સ્તવન (“કલ્યાણમંદિર” સ્તોત્ર) પણ પોતાની ભક્તિની કાલીઘેલી ભાષામાં બન્યું હોવાથી લોકોને મીઠું લાગશે તેમ શ્રદ્ધાથી કહે છે. ગમે તેવા અલ્યશક્તિ કે અલ્ય બુદ્ધિવાળા માટે પણ, ભક્તિયોગની સુલભતા અને પરમાર્થથી બતાવી છે.

પરમ ઐશ્વર્યના સ્વામી પરમાત્માના અગમ્ય અગોચર અનંત ગુણો છે કે જે યોગીપુરુષો જાણે છે, સમજે છે અને અંશે અનુભવે છે, છતાં તે ગુણોનું યથાર્થ અને સંપૂર્ણ કથન વાણી દ્વારા કરી શકતા નથી. તેથી જ ‘અપૂર્વ અવસર’ પદમાં શ્રીમદ્ રાજયંત્રજીએ કહ્યું કે,

જે પદ શ્રી સર્વજ્ઞે દીકું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો... (૨૦)

તો પછી મારા (સિદ્ધસેન દિવાકરસૂરિજી) જેવા આપના ગુણોને વાર્ણવવા માટે શું વિસાતમાં હોય ! તેથી મને એમ લાગે છે કે માનું આ સ્તુતિ (“કલ્યાણમંદિર” સ્તોત્ર) કરવાનું કાર્ય વગર વિચાર્યુ કહેવાય. જ્ઞાનીજનો પાસે આ કાર્ય હાંસીપાત્ર બનશે. પરંતુ શું કરું ? હું લાયાર છું. મારા હદ્યમાં ઉછળતો - ઉભરાતો ભક્તિનો વેગ હું રોકી શકું તેમ નથી. જેમ પક્ષી પોતાના ભાવને વ્યક્ત કરવા માટે મનુષ્યની ભાષા બોલી શકતા નથી, તો પણ તેઓ પક્ષીભાષામાં બોલીને પોતાના ભાવ દર્શાવે છે, તેમ હું પણ મારી ભક્તિની અભિવ્યક્તિ કાલીઘેલી ભાષામાં સ્તુતિ રચીને કરીશ. પ્રભુ ! તું તો સર્વજ્ઞ છે અને મારા અંતરના ભાવને પ્રત્યક્ષ જાણે છે પછી મને શું ચિંતા ? જેવો તેવો પણ હું બાળક તો તારો

જ છું. તેથી જ આચાર્ય રત્નાકરસૂરિજી ‘રત્નાકર પચ્ચીસી’ માં કહે છે કે,

શું બાળકો મા-બાપ પાસે બાળકીડા નવ કરે,  
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે....(૩)

બાળબુદ્ધિએ પરમ ભક્તિભાવથી રચાયેલ આ સ્તુતિ સૌના હદ્યને શાંતિ, આનંદ અને તૃપ્તિ આપશે.

સભ્યગ્રદર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ રત્નત્રયના આરાધક યોગીઓ વડે પણ આપના (પાર્શ્વપ્રભુના) ગુણો વાણીથી સંપૂર્ણપણે કહી શકતા નથી, તો પછી તે કહેવાનો મને અવકાશ (સામર્થ્ય, શક્તિ) ક્યાંથી હોય ? અર્થાત્ તે કહેવાની શક્તિ મંદમતિ અને છન્નસ્થ એવા મારામાં ક્યાંથી હોય ? તેથી મારો આ સ્તુતિ કરવાનો પ્રયત્ન વિચાર્ય વિનાની જ પ્રવૃત્તિ થવાથી સ્તુતિ ન કરવી જોઈએ. આટલી વાત કરીને આચાર્ય હવે બીજા પક્ષનો વિચાર રજૂ કરે છે : સંપૂર્ણ રીતે સ્તુતિ કરવાની પોતાની શક્તિ ન હોવા છતાં પણ યથાશક્તિ પ્રયત્ન તો કરવો જોઈએ.

આચાર્યશ્રી આ શ્લોકમાં પોતે આરંભેલું કાર્ય અન્યની દાખિમાં કેવું વિચાર વગરનું જગાય છે તે સ્પષ્ટ કરે છે. તેઓ પાર્શ્વનાથ ભગવાનને કહે છે કે હે પ્રભુ ! તમારા ગુણો એટલા બધા છે કે ભલભલા યોગીઓ પણ યથાર્થ કહી શકતા નથી. યોગી એટલે મન, વચન અને કાયાના યોગને સંયમિત કરી આત્મદશાની ઉચ્ચ અવસ્થાવાળા જીવો. તેમનું ધ્યેય સંસારથી અલિમ રહીને પ્રભુ સાથે એક્ય સાધવાનું છે. આવા આત્માર્થમાં રમતા યોગીઓ પણ પ્રભુના સર્વ ગુણો વર્જવી શકતા નથી. તેવા આત્મવૈભવી યોગીઓના પડ્છાયામાં પોતાનું સામર્થ્ય કેટલું અલ્ય છે તે આચાર્યશ્રી બતાવે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં તેઓ આ સ્તોત્રનું કાર્ય અધવચથી છોડવા તૈયાર નથી.

સિદ્ધસેન દિવાકરસૂરિજીની લઘુતાપૂર્વકની નમ્રતામાં સાચા ભક્તના દર્શન થાય છે. વિદ્વાનો પોતાની

શક્તિ અનુસાર કાર્ય કરે છે પણ ભક્ત તો પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પિત કરે છે. તેથી પોતાની શક્તિનો વિચાર કરવાને બદલે ભગવાનની શક્તિમાં વિશ્વાસ રાખે છે. પોતાની ગમે તેટલી મર્યાદા હોવા છતાં, પ્રભુમાં તેને અતૂટ શ્રદ્ધા હોય છે કે પોતે આરંભેલું ઉત્તમ પવિત્ર કાર્ય પ્રભુની કૃપા અને પ્રેરણાથી સફળ થશે જ. આ રીતે ઘણી મર્યાદા હોવા છતાં આચાર્યશ્રી આરંભેલા કલ્યાણમંદિર સ્તોત્ર-સુતિની રચનાને વળગી રહે છે.

આચાર્યશ્રી કહે છે કે ગગનવિહારી પક્ષીગણ ભલે કોઈ પ્રકારના વિચારો કે શબ્દોનું ગણિત ન ગણતા હોય છતાં પોતાના આનંદગીર્ભિને કે ભાવોને પ્રગટ કરવા મધુર ગાન કરે છે. પોતાની અસ્પષ્ટ વાણી (કલરવ ગુજરવ) થી હદ્યના નિર્મળ ભાવોની આનંદયુક્ત ધારાને વહાવીને પક્ષીઓ મનમોહક ગાન કરે છે. આથી હે પ્રભુ ! હું પણ તારા ગુણોથી અત્યંત પ્રભાવિત હોવાથી ભક્તિવશાત્મક મારી શક્તિ મુજબ મારી ભાષામાં આપની સુતિ કરું તો તે ઉચ્ચિત જ છે. એમાં કોઈ દોષ નથી અને એ વિચાર્ય વિનાનું કાર્ય નહીં ગણાય. એમ આચાર્ય સિદ્ધસેન દિવાકર સૂરિજીએ ન્યાય અને યુક્તિ સંગત સુંદર સમાધાન કરીને કલ્યાણમંદિર સ્તોત્રની રચનાને વજબી ગણાવેલ છે.

પોતાની શ્રદ્ધાને બિરદાવતું પક્ષીનું ઉદાહરણ આચાર્યશ્રી કુદરતમાંથી શોધી કાઢે છે. પક્ષી અને મનુષ્ય એકબીજાની ભાષાથી અજ્ઞાણ છે. મનુષ્ય પોતાની ભાષાથી અજ્ઞાણ એવા પક્ષીઓ સમક્ષ પોતાનો આનંદ વ્યક્ત કરતા ખચકાય છે, ત્યારે પક્ષીઓ પોતાનો આનંદ મનુષ્ય સમક્ષ મધુર કલરવ કરીને વ્યક્ત કરતા જરા પણ ખચકાતા નથી. તેઓ ભાષાવાણીની મર્યાદાના લક્ષ વિના ગુંજારવ અને કલરવ આનંદથી કર્યે જાય છે અને આપણે એ માણીએ છીએ. પ્રભુના ગુણોના સ્મરણ અને ધ્યાનથી પ્રગટો અતિ આનંદ સૂરિજ પદમાં

વહાવે છે. તેમની કલ્યાણમંદિર સ્તોત્ર રચનામાંથી ટપકતા આનંદરસમાં નિમગ્ન થતા જઈએ છીએ અને તે પ્રશમ રસમાં રૂભીએ છીએ. આ જ એમની અદ્ભુત કાવ્યશક્તિનો સાચો પરિચય છે. તેમની અનુભૂતિમાં આપણી અનુભૂતિ ભળી જાય છે.

આ શ્લોકમાં વાપરેલ ‘યોગિ’ શબ્દ જૈન પરિભાષાનો નથી. યોગસાધના એ ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક તથા આધ્યાત્મિક રજમાર્ગ છે. પતંજલિના અષ્ટાગ યોગ સાથે જૈન સાધનાનો સુંદર સમન્વય છે. આધ્યાત્મિક દિણિએ મન, વચન, કાયાના યોગ એ બાબુ ઉપકરણ અને આત્માથી બિન કર્મજન્ય પ્રકૃતિ છે. એટલા માટે જિનાગમમાં યોગસાધના ન કહેતા આત્માના ભાવરૂપ ઉપયોગપ્રધાન આત્મસાધના કહેલ છે.

સિદ્ધસેન દિવાકર સૂરિ જૈવા ધુરંધર જૈનાચાર્યએ આ શ્લોકમાં યોગિ શબ્દનો પ્રયોગ કરેલ છે તેમાં એક આધ્યાત્મિક રહસ્ય છે. ગુણોનું આખ્યાન અને કથન કરવાવાળા બુદ્ધિમાન વિદ્વાન હોય છે. યોગીમાં સાધનાનો માર્ગ અને આત્મગુણોનો વિકાસ છે, જ્યારે વિદ્વાનમાં બૌદ્ધિક સંપદા છે. ગુણોનું આખ્યાન અને વિવેચન કરવું તે વિદ્વાનોનો-વચનનો વિષય છે, જ્યારે ગુણોને આત્મસાત્ત કરીને સાધનાના ક્ષેત્રમાં લાવીને તેની સાક્ષાત્ અનુભૂતિ કરવી તે સાધકો અને યોગીઓનો વિષય છે. તેઓ યોગનું અવલંબન લઈને ઉપયોગરૂપ સાધના દ્વારા આત્માને નિર્મળ કરે છે. વર્ણન વચનનો વિષય છે, જ્યારે અનુભવ સાધનાનો વિષય છે.

આચાર્યશ્રીએ આ શ્લોકમાં અવકાશ શબ્દ વાપરેલ છે. સ્થૂળ દિણિએ અવકાશ એટલે જગ્યા, સ્થાન. તે આકાશાસ્તિકાયનો ગુણ છે (અવગાહ). દ્વય અવકાશમાં ક્ષેત્રની સ્પર્શના છે. ભાવ અવકાશમાં ગુણોની અભિવ્યક્તિ અને વિકાસ છે. આ શ્લોકમાં અવકાશ શબ્દ ભાવ અને શક્તિના અર્થમાં વપરાયો છે.

અહીં સમીક્ષા નો અર્થ છે - સૌજવ, શુંગાર અને તર્કસિદ્ધ પદવિન્યાસ (રચના). તે પદોમાં કાવ્યભાવોને ભેળવીને ભાવપ્રાણ પૂરે છે.

આ શ્લોકમાં વક્તું કથં કહીને વાણીનું અસામર્થ્ય પ્રગટ કર્યું છે, અર્થાત્ “બોલવામાં (વર્ણન કરવામાં) મારો અવકાશ (શક્તિ, સામર્થ્ય) ક્યાં છે?” આ કથનથી પ્રતીત થાય છે કે ભલે બોલવામાં અસામર્થ્ય છે પરંતુ સમજવાનો, ચિંતન - મનન કરવાનો અને અનુભવવાનો અવકાશ તો ભરપૂર છે ! વક્તું શબ્દનો મર્મ તેની જ્ઞાનગરિમાને પ્રગટ કરે છે.

**ઉત્થાનિકા :** આ શ્લોક-૬ પછી, હવે આચાર્યશ્રી વિષયાંતર કરે છે. અહીં સુધી લઘુત્વભાવનું મદર્શન કરીને પોતાની વિનયશીલતા દર્શાવી. હવે આગળ કહે છે કે પરમાત્માનું નામ પણ જીવોના કલ્યાણ માટે પર્યાપ્ત છે. ભાવપૂર્વકના નામની અચિંત્ય શક્તિ છે અને નામના જપથી શાંતિ અનુભવાય છે. તત્ત્વપ્રાપ્તિના પૂર્વે તત્ત્વની પૂર્વભૂમિકાથી જ આનંદની ઉત્પત્તિ થાય છે. શ્લોક-૭ માં નામસ્મરણરૂપ સરળ સાધનાનો (મોક્ષ) નિર્દેશ કર્યો છે.

અંતમાં સર્વ જીવ ભાવપૂર્વકના પ્રભુ-નામસ્મરણરૂપ સરળ, સહજ આરાધનાથી આત્મશુદ્ધિ કરે એવી મંગલ ભાવના સાથે જિનાજ્ઞાથી કંઈ વિપરીત લખાયું હોય તો ત્રિવિષે મિથ્યા મિ દુક્કડમ્.

ॐ શાંતિ: શાંતિ: શાંતિ:

॥ શ્રી સદગુરુચરણપર્ણમસ્તु ॥

• • •

- દર્પણમેં મુખ ઓર સંસાર મેં સુખ-હોતા નહીં હૈ, બસ દિખતા હૈ.
- માના ક્રિ ક્રિંદગી કી રાહે આસાન નહીં, મગાર મુસ્કુરાકે ચલને મેં કોઇ નુકસાન નહીં.

### સમાધિતંત્રનું અમૃતરસપાન ....

(પાના નં. ૧૪ પરથી ચાલુ...)

દંડ આપીને હર્ષ પણ માને છે પરંતુ શ્રદ્ધાનમાં તો દંડ આપવો અનિષ્ટ માને છે, તેમ સમ્યક્કદિનિને પાપરૂપ ઘણો કષાય થયો હતો તે હવે પુણ્યરૂપ થોડો કષાય કરવાનો ઉપાય રાખે છે તથા થોડો કષાય થતાં હર્ષ પણ માને છે પરંતુ શ્રદ્ધાનમાં તો કષાયને હેય જ માને છે.” અંતરાત્માની શ્રદ્ધાનમાં અને અજ્ઞાનીની શ્રદ્ધામાં એક અકર્તા રહે છે, બીજો કર્તા બની કર્મ બાંધે છે.

પૂ. બેન શ્રી ચંપાબેનની અમૃત સરસ્વતી લાખે છે, “શુભનો વ્યવહાર પણ અસાર છે. તેમાં રોકવા જેવું નથી. કોઈ માણસ નગરનું ધ્યેય બાંધી ચાલવા માંડે તો વચ્ચે વચ્ચે ગામ, ખેતર, ઝડપ બધું આવે, પણ તે બધું છોડતો જાય છે. તેમ સાધકને આ શુભાદિનો વ્યવહાર વચ્ચે આવે પણ સાધ્ય તો પૂર્ણ શુદ્ધ આત્મા જ છે માટે તે વ્યવહારને છોડતો પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપમાં જ પહોંચી જાય છે. .... જો તારે તારું પરિભ્રમણ ટાળવું હોય તો તારા દ્રવ્યને તીક્ષ્ણ બુદ્ધિથી ઓળખી લે. જો દ્રવ્ય તારા હાથમાં આવી ગયું તો તને મુક્તિની પર્યાપ્ત સહેજે મળી જશે.”

- :- પદ્ધાનુવાદ :-

‘દેહાત્મધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વથી ઈચ્છે મુક્તિ સદાય.’

- શ્રી છોટાલાલ ગાંધી

‘દેહાત્મબુદ્ધિની ઈચ્છા, દિવ્ય દેહ - સુભોગની; તત્ત્વજ્ઞાની તણી ઈચ્છા, દેહ ભોગ વિયોગની.’

- પૂ.શ્રી બ્રહ્મચારીજી

‘લક્ષ્મી મિલે, મિલન હો, મમ હો વિવાહ,

મૂઢાત્મકો વિષય કી દિનરૈન ચાહ ।

જ્ઞાની, વશી, વિમલ, માનસ, આત્મવાદી

મૂઢાત્મ સદૃશ નહીં, પર અપ્રમાદી ॥’

- પૂ. આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ  
(કુમશઃ)

## જળ અંગ જીવન

### પારુલબેન બી. ગાંધી

ભારત આમ જોઈએ તો નદીઓનો દેશ છે. કેટલીય મહાનદીઓ સદીઓથી આ ધરાતળને સીચીને હરિયાણી બનાવતી એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જાય છે, પરંતુ વર્તમાને જલોબલ વોર્મિંગની અસરને કારણે નદીઓ સૂક્ષ્મ રહી છે. દિવસે દિવસે વરસાદ ઓછો થતો જાય છે. ચોમાસું ધીમું પડતું જાય છે. આવા સમયે લોકોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે. જો આ બાબત પર અત્યારથી જ ધ્યાન નહિ આપવામાં આવે તો એક દિવસ એવો આવશે કે માણસ પાણીના ટીપા માટે પણ તરફડતો હશે.

વાસ્તવિકતા એ છે કે ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ભૂતળ ખૂબ જ ઉંડા જતા રહ્યા છે. ‘નાસા’ એ જાહેર કરેલા નવા ડેટા પ્રમાણે આગામી થોડા વર્ષોમાં ઉત્તર અને પશ્ચિમ ભારતનો મોટા ભાગનો વિસ્તાર પીવાના પાણીની અછતને કારણે ખાલસા કરવો પડશે. અહીંથાં નાગરિકો વસવાટ કરી શકે તેવી શક્યતાઓ નહિવત્ત છે. એક અભ્યાસના તારણ પ્રમાણે ભારતના કુલ ભૂમિપ્રદેશમાંથી ૫૦% વિસ્તારમાં ભૂગર્ભ જળ હવે રહ્યા નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી કેટલીક ક્લિપો એવું દર્શાવે છે કે ૧૫૦૦ ફુટ ઉંઠિથી પણ જળને બદલે લાવા નીકળી રહ્યા છે. આ બધા આવી રહેલ ભયંકર ભાવિનાં એંધાણ છે.

વિધિની વક્તા એ છે કે પશુઓ પણ આજે પાણી માટે લડી રહ્યા છે. દૈનિક અખબારમાં આવેલા એક અહેવાલ પ્રમાણે જુનના પૂર્વિંમાં મધ્યપ્રદેશનાં દેવાસમાં પુંજાપરા પાસેના જંગલમાં વાંદરાઓના એક સમૂહે નદીમાં બચેલા થોડા પાણી પર કબજો જમાવી લીધો. જૂથ બહારનાં કોઈપણ વાનરને તેઓ પાણીની નજીક આવવા દેતા નહોતા. આ પરિસ્થિતિને કારણે પાણી ન મળી શકવાથી તરફડીને ૧૫ જેટલા વાનરો મૃત્યુને શરણ થયા.

રાજસ્થાનનાં સરહદી જિલ્લાઓ બાઉન્ડર અને

જેસલમેરમાંથી અત્યારે મૃત પશુઓના પડતર કંકાલ અસ્થિઓનાં ટ્રકનાં ટ્રક ભરાઈને રવાના થઈ રહ્યા છે. આ એ પશુઓના કંકાલ છે જેઓ પાણી વિના તરફડીને મૃત્યુ પામ્યા છે. ભારતનાં મોટાભાગનાં રાજ્યોના ઘણા જિલ્લા - તાલુકાઓને ગયા વર્ષે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.

ટૂંકમાં કહીએ તો અત્યાર સુધી જે જળ સુલભ હતું તે હુર્બલ બનતું જાય છે. જો આવા સંજોગોમાં લોકો જાગીને પોતાની રીતે કાર્ય કરી જળસંગ્રહ, જળબચાવ અભિયાન ચલાવશે નહિ તો બહુ નજીકના ભવિષ્યમાં પાણી માટે લડાઈ થતી જોવા મળશે.

પાણીના અભાવમાં મૃત્યુને વહાલું ન કરવું હોય, લડાઈઓ ન લડવી હોય તો આજથી જ નહિ, અત્યારથી જ પાણી બચાવ અભિયાન શરૂ કરી દેવાનું છે. આ માટે દરેક નાગરિકે પોતાની રીતે પ્રયત્નો કરવા ખૂબ જ જરૂરી છે. આ માટે નીચેની જાગૃતિ ખૂબ જ જરૂરી છે :-

(૧) કોઈપણ વ્યક્તિ પોતાનાં ઘર, ફળિયા વગેરે ધોવા માટે પાણીને નકામું વેડફશે નહિ. પાણીના એક એક ટીપાને ધી નું ટીપુ સમજી તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

(૨) પીવા માટે પાણી લેતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે મારે કેટલું પાણી પીવું છે. બે ધૂંટ પીને પઢી પોણો ગલાસ ગટરમાં રેઝિએ તે હાથે કરી પોતાના પગ પર કુહાડી મારવા જેવી વાત સાબિત થશે.

(૩) મોટા પ્રસંગોમાં અજ અને પાણીનો વેડફાટ ખૂબ સામાન્ય બની ગયા છે. કેટલાયે પ્રદેશોમાં ભૂખમરાની, કુપોષણની, ભોજન ન મળવાની પરિસ્થિતિ જોવા મળે છે. કેટલાયે લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે ત્યારે આપણે અજનો એક કણ પણ કેવી રીતે વેડફાટ શકીએ? આ માટે અનિવાર્યપણે કોઈ ઓહું ન કરે તે જોવાની જવાબદારી જે તે આયોજકના યજમાનની રહે છે અને

તેણે એ માટે લોકો તૈનાત કરી એંહું ન મૂકે તેની ખાસ તક્કેદારી રાખવી જોઈએ. તેમ જ પાણી પણ જોઈએ તેટલું જ લેવાય તેનું બરાબર ધ્યાન રાખવું જોઈએ.

(૪) આ માત્ર સરકારની જવાબદારી નથી. નાગરિક તરીકે આપણે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બને છે. ‘ગામનું પાણી ગામમાં’ અભિયાન ચલાવી સરોવર, ફૂવા, તળાવ, તેમ વગેરેમાં યોગ્ય રીતે પાણીનો સંગ્રહ થાય તેવું આયોજન કરવું.

(૫) સરકાર આ માટે પ્રોત્સાહક યોજનાઓ બનાવે. લોકોને જગસંગ્રહ માટે વધુમાં વધુ જ્ઞાનકારી, સહાય, માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

(૬) બિનસરકારી સંગઠનો, સૈચિક સંસ્થાઓએ આ કાર્ય માટે આગળ આવવું ખૂબ જરૂરી છે. તેઓ વૃક્ષારોપણ કરી, વૃક્ષ બરાબર ઊછારી ન જાય ત્યાં સુધીની કાળજી રાખી વૃક્ષો ઊછે તે માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.

(૭) પાણીના ઉપયોગ માટે ઘરે ઘરે ભીટર બેસાડી વ્યક્તિ પ્રમાણે જરૂરિયાત મુજબ પાણી આપવું જોઈએ. વધારે પાણી આવતું હોય તો માણસો જરૂરિયાતથી વધારે પાણી ઢોળે છે. ઘણી વખત માણસો સંડાસના અને ગટરમાં નળ ખુલ્લા મુકી દે છે અને પાછા એમ કહે છે કે ગટર ભરાઈ ન જાય ને એટલે તે જરૂરી છે!

(૮) જે લોકો પાણી વેડફટા હોય તેને માટે આકરા દંડની જોગવાઈ કરવી જોઈએ.

(૯) ભૂગર્ભજળ વાપરવા ઉપર પણ અંકુશ લાદવાની જરૂર છે. પોતાને ઘરે ઓછું પાણી આવતું હોય તો આજુબાજુમાં ઉકી હોય ત્યાથી લાવીને પાણીનો આડેધ વપરાશ થાય છે. સરકારી નળમાં પાણી આવતું ન હોય કે ઓછું આવતું હોય તો કરક્સર કરી વાપરવાને બદલે ભૂગર્ભજળ આડેધ વાપરવામાં આવે છે.

(૧૦) ચોમાસા દરમિયાન વહી જતાં પાણીને રોકવા સામાજિક સંસ્થાઓએ સરકાર સાથે મળી એક આંદોલન સ્વરૂપે પ્રચારયુક્ત ચલાવવું જોઉંએ.

(૧૧) લોકોને આકાશી જળ ભૂગર્ભમાં ઉતરે તે માટે માર્ગદર્શન આપી, દરેક ઘરમાં તે પાણી જમીનમાં ઉતરે તે માટેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

(૧૨) પર્યાવરણને અત્યંત ઉપયોગી વૃક્ષો વધુમાં વધુ વાવી, ઉછેરી, તેની માવજત કરવાથી વરસાદ આવશે, દુષ્કાળ ઓછા પડશે અને જમીનમાં પાણીના સંગ્રહની ક્ષમતા વધશે.

(૧૩) રસ્તાની બસે બાજુએ ઘટાદાર વૃક્ષો વાવી તેને ઉછેરવા જોઈએ, જેથી હવાનું પ્રદૂષપણ ઘટે, ઓક્સિજનનું પ્રમાણ વધે અને તેથી તન-મનનાં રોગો ઘટે.

(૧૪) હવે પણી જે મકાનોની નવી મંજૂરી આપવાની હોય તેમને માટે પરકોલેશન ફૂવાઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત કરવો જોઈએ.

(૧૫) બહુમાળી મકાનોનાં મોટા પ્રોજેક્ટમાં એક તળાવ હોવું જ જોઈએ તેવો નિયમ કરવો જોઈએ. તેનાથી જે તે વસાહતની સુંદરતામાં વધારો થશે. બાળકોને, વૃદ્ધોને ખુલ્લી હવા, ઠંડી હવામાં રમવા અને બેસવા મળશે. જેનાથી તંદુરસ્તી સારી થશે.

(૧૬) મોટા શહેરોમાં તો ઘરે ઘરે નળ હોય છે. તેથી થોડું ઘણું પાણી મળી જ રહે છે. પરંતુ ગામડાઓમાં પાણીની પરિસ્થિતિ બહુ વિકટ છે. નેતાઓની મીટીંગો, સત્રો આવા અંતરિયાળ ગામમાં રાખવા જોઈએ, જેથી તેઓને ખબર પડે કે વાસ્તવિકતા શું છે.

(૧૭) જો યોગ્ય રીતે આયોજન કરી પાણીનો બચાવ, સંગ્રહ વગેરે પર અત્યારથી ધ્યાન આપવામાં નહિ આવે તો બહુ જલ્દી એવી પરિસ્થિતિ આવશે કે રાજ્યો રાજ્યો, ઘર-ઘર વચ્ચે, માનવી-માનવી વચ્ચે જળજન્ય વૈમનસ્ય વધશે.

પાણીનું એક એક ટીપું મહત્વનું છે એ વાસ્તવિકતા સમજી લોકોએ અને સરકારે જાગવાની જરૂર છે. આપણી ભાવ પેઢીને પાણીની ભયંકર અધતનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ ઊભી ન થવા દેવી હોય તો પાણીનાં એક ટીપાનો ઉપયોગ ધી ની જેમ કરો. જળ એ જ જીવન છે. જળ વિના મૃત્યુ છે. જાગો ભાઈઓ-બહેનો, પાણીને બચાવશું તો જ જવસૂચિ બચી શકશે.

ગતિ કે લિયે ચરણ ઔર પ્રગતિ કે લિયે

આચરણ બહુત જરૂરી છે.

## અમૃતમહોત્સવની અનોખી ઉજવણી

### મહેન્દ્રભાઈ કે. ખંડાર

શ્રીમદ્ રાજયંત્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા આશ્રમના સ્થાપક - અધિકારી પૂ. શ્રી આત્માનંદજી સાથે, શ્રી હેમેન્દ્રભાઈ બી. શાહ ૧૯૬૦ થી સંકળાયેલા હતા. આશ્રમની સ્થાપના અને વિકાસમાં ઘણો મહત્વનો ફાળો આપવા સાથે હેમેન્દ્રભાઈ એક ઉત્તમ મુમુક્ષુ હતા. સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઘણી સેવાઓ આપી.

હેમેન્દ્રભાઈના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ એચ. શાહ પિતાના પગલે, કોબા આશ્રમના ટ્રસ્ટી તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

પ્રકાશભાઈના જ્યોતિર્લિંગનો અમૃત મહોત્સવ પ્રકાશભાઈ, તેમના ધર્મપત્ની સુરેખાબેન, સુપુત્રી અમોલીબેન, સુપુત્ર હૃવભાઈ - પુત્રવધૂ રોશનીબેન અને કુટુંબીજનોએ સમાજસેવા અને માનવતાના મૂલ્યો સાથે મૌલિક અને વિશિષ્ટ રીતે ઉજવણી કરી. ચીલાચાલુ પાર્ટી માહોલને બદલે સ્થાનિક-રાજ્ય-રાષ્ટ્રીય સ્તરે સમાજસેવા કરતી ૨૦ સંસ્થાઓને આમંત્રીને તેમની પ્રવૃત્તિઓનો પરિચય કરાવીને, આર્ટ ઓફ લીવીંગના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય સુવિષ્યાત પૂ. શ્રીશ્રી રવિશંકરજીને ખાસ વિનંતીથી હાજર રાખીને તેમના પવિત્ર હસ્તે દરેક સંસ્થાઓને પ્રમાણપત્ર, એવોર્ડ, આર્થિક યોગદાન અને આશીર્વાદ આપ્યા.

અમદાવાદ રોગરોડના હેલ્પેટ ટ્રાફિક સર્કલ પાસે આવેલ જી.એમ.ડી.સી. ગુજરાત યુનિવર્સિટીના અધ્યતન વિશાળ કન્વેશન હોલમાં ૨૪૦૦ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને આમંત્રિતોની હાજરીમાં નીચેની ૨૦ સેવા સંસ્થાઓની પ્રવૃત્તિઓનું પ્રદર્શન-વીડીયોથી પરિચય કરાવીને દરેક સંસ્થાને બિરદાવી.

(૧) આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ (અમદાવાદ, +૯૧ ૯૨૭૦ ૦૭૪૬૦) : આસ્થા-આનંદધામ એ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોની સંભાળ લેનાર અને તેમને સ્વતંત્ર રીતે રહેવા હેતુલક્ષી જીવન આપતું ધર છે; જ્યાં એમને સારી સુવિધા આપી તેમનો સર્વાંગી વિકાસ

કરવામાં આવે છે કે જેથી તેઓ સ્વ-નિર્ભર બને અને ગૌરવભેર જીવન વીતાવે. વ્યાવસાયિક પુનર્વસન, બાળકોના વિશિષ્ટ કાર્યક્રમો વગેરે પ્રવૃત્તિઓ છે.

(૨) સર્વોદય પરિવાર ટ્રસ્ટ (પીડ્વળ, જી. વલસાડ, +૯૧ ૨૬૩૩ ૨૮૨૫૪૦) : ધરમપુરથી ૨૫ ક્રિ.મી. પીડ્વળ ગામે આદિવાસી, પદ્ધતાત, દારુણ ગરીબીવાળા વિસ્તારમાં દાક્તરી સેવા, અનાજરાહત, રોજરોટી માટે ખાદીકામ, નરસરી, શાળા, છાત્રાલય, દારુબંધી, સમૂહલગ્ન, છાપરાના નણિયા, ચેકડેમ, જેતી સહાય વગેરે પ્રવૃત્તિઓ છે.

(૩) હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (અમદાવાદ, +૯૧ ૭૮ ૨૬૬૧૦૮૦૧) : મૂળ પોલીયો ફાઉન્ડેશન, પોલીયો તપાસ-તાલીમ-સારવાર, બાળકોના જરૂરી ઓપરેશન, કેલીપર્સ આદિ સાધનોનું વિતરણ, અંધત્વ નિવારણ, ડાયાલીસીસ, ખૂંધ સારવાર વગેરે પ્રવૃત્તિઓ છે.

(૪) આર્ટ ઓફ લીવીંગ (બેંગલોર, +૯૧ ೮૦ ૬૭૬૧૨૩૪૫) : સ્થાપક અધિકારી શ્રી શ્રી રવિશંકરજી, ૧૫૦ દેશોમાં ૫૦૦૦ થી વધુ કેન્દ્રો ધરાવનાર સંસ્થા છે. હાઇજીન, હેલ્થ, હોમ ફોર હોમલેસ, હ્યુમન વેલ્યુઝ અને હાર્મની ઈન ડાઈવર્સિટી, શિક્ષણ, શિબિરો, જળ સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, કુદરતી આફ્ટોમાં સહાય, સેવા-સાધના-સત્સંગ-ધ્યાન-પ્રાણાયામ-યોગાસન વગેરે પ્રવૃત્તિઓ છે.

(૫) વિચરતા સમુદ્દ્ર સમર્થન મંચ (અમદાવાદ, +૯૧ ૭૮ ૨૬૮૦૩૭૮) : વાદી, મદારી, બજારિયા, નટ, સરાણિયા આદિ ૪૦ વિચરતી ગરીબ જાતિ માટે રહેઠાણ, શિક્ષણ, રોજગારી, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ, મતદાર અને બી.પી.એલ. કાર્ડ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૬) મુનિ સેવા આશ્રમ (ગોરજ, જી. વડોદરા, +૯૧ ૨૬૬૮ ૨૬૫૩૦૦) : ગ્રામીણ લોકોના આરોગ્ય, શિક્ષણ, સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો કરે છે. બાલમંદિર,

સ્કુલ, ભગિની મંદિર, નર્સિંગ કોલેજ, કેન્સર હોસ્પિટલ, બાળકોની નર્સરી વગેરે પ્રવૃત્તિઓ છે.

(૭) નવભારત જાગૃતિ કેન્દ્ર (અમૃતનગર, આરખંડ, +૮૧ ૯૪૪૬ ૨૬૩૩૩૨) : ગ્રામીણ વિસ્તારમાં સ્કુલો, શિક્ષણ સહાય, અનાથાલય, આંખની હોસ્પિટલો, દિવ્યાંગ સંભાળ, નારીશક્તિ, રોજગારલક્ષી તાલીમ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૮) સદ્ગિયાર પરિવાર (અમદાવાદ, +૮૧ ૭૯ ૨૬૮૯૧૪૧૫) : સુવિયારનો પ્રસાર, શિક્ષણ સહાય, દર્દી રાહત, ટિફિનસેવા, સિનિયર સીટીજન ગૌરવ, મહિલા ઉક્ર્ખ્લ, વિકલાંગ શાળા અને તાલીમ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૯) સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ (હિમતનગર, +૮૧ ૨૭૭૨ ૨૪૪૩૩૭) : રક્તપિત્તગ્રસ્તોને આવાસ-ભોજન-સારવાર-શિક્ષણ, ગૌશાળા, ઉપેક્ષિત અને મંદબુદ્ધિવાળાને આશ્રય વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૦) સી.યુ.શાહ પ્રજાયક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર, +૮૧ ૨૭૫૨ ૨૮૩૧૦૦) : પ્રજાયક્ષુ બાળાઓને આશ્રય, શિક્ષણ, સ્વનિર્ભરતા, સક્ષમતા, અંધજન છાત્રાલય, અંધજન રોજગારી, પુનર્વસન વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૧) સેવા રૂલે (ઝગડીયા, જિ. ભરુચ, +૮૧ ૨૬૪૫ ૨૨૦૦૨૧) ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર, માતૃબાળકલ્યાણ, નવજાત શિશુ સંભાળ, ટેકનીકલ રોજગારી તાલીમ, મહિલા સશક્તિકરણ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૨) ભાષણાણી ટ્રસ્ટ (ઉત્તર ગુજરાત) : ગ્રામીણ વિસ્તાર અને ગરીબ પદ્ધત જાતિ માટે આરોગ્યવર્ધક, બાળપોષણ, આંખસંભાળ, શિક્ષણ, ગૃહઉદ્યોગ, આંગણવાડી વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૩) સ્વાશ્રયી મહિલા સેવા કેન્દ્ર (અમદાવાદ, +૮૧ ૭૯ ૨૫૫૦ ૬૪૪૪) : સંગાઈ, સલામતી, ધંધા રોજગાર વિકાસ, ટેકનોલોજી તાલીમ, મહિલા હક્કો, ગૃહઉદ્યોગ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૪) યોગાંજલિ કેળવણી મંડળ (સિદ્ધપુર, જિ.

પાટણ, +૮૧ ૨૭૬૭ ૨૨૪૭૦૭) : સમાજના છેવાડાના અને વંચિત વર્ગના લોકોનો નાત-જાત-ધર્મના ભેદભાવ વગર સર્વાંગી વિકાસ, ઘરવિહોણા માટે મકાન, અનાજરાહત, મહિલાતાલીમ કેન્દ્રો, નેત્રયજ્ઞો, બાળ શિક્ષણ મંદિરો અને છાત્રાલય, માતૃધર, રાહતકાર્યો વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૫) સજીવ ખેતી મિશન-જતન (વડોદરા, +૮૧ ૨૬૫ ૨૩૭૧૪૨૮) : પ્રાકૃતિક પ્રદૂષણ-ખનન, ખોરાકમાં આવતા ઝેરના અંશો, ખેતીમાં ઘટતી આવક, પર્યાવરણ-મિત્ર, આરોગ્ય માટે સલામત અને ખેડૂતને પોષાય તેવી સજીવ ખેતીના પ્રસારની પ્રવૃત્તિ છે.

(૧૬) જીવદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ, jivdaya@jivdayatrust.org) બીમાર અને ધવાયેલ પશુ-પક્ષીઓને તબીબી સારવાર, પીડારાહત કાર્યો, પુનઃવસવાટ, મોબાઇલ ક્લિનીક, પશુ-પક્ષીનું દવાખાનું વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૭) ગ્રામ સ્વરાજ સંઘ (નીલપર, કચ્છ, +૮૧ ૨૮૩૦ ૨૮૩૨૧૮) : શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજણીજોડાણ, અંગણવાડી, વૃદ્ધ પેન્શન, ભૂકુંપ સહાય, વિકલાંગ સેવા વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૮) સંવેદના (અમદાવાદ, www.samvedana.org.in) સામાજિક અને આર્થિક રીતે પદ્ધત બાળકો, યુવાનો અને સ્ત્રીઓ માટે જુંપડપણી, બાળપોષણ, સ્કોલરશીપ, વોકેશનલ ટ્રેઈનિંગ, કૌશલ્ય તાલીમ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૧૯) બંસી ગીર ગૌશાળા (અમદાવાદ) : આદર્શ ગોપાલન, સંવર્ધન, સરળ ગો આધારિત કૃષિ, ઔષધિ નિર્માણ, ગુરુકુળ શિક્ષણ, ગૌચર પુનઃનિર્માણ, ગોતીર્થ વિદ્યાપીઠ વગેરે પ્રવૃત્તિઓ છે.

(૨૦) લાફીંગ કલબ (અમદાવાદ) : શારીરિક અને માનસિક તંદુરસ્તી, સામાજિક સહપ્રવૃત્તિ વગેરે પ્રયોજન સાથે જ્ઞાતી-કોમ-ધર્મ-બાળ યુવાન વૃદ્ધ બધા માટે છે. નિર્ભેણ આનંદ અને ગમ્મત સાથે તંદુરસ્તીવર્ધક સામાજિક પ્રવૃત્તિ છે.

સમારોહને “જ્યોતિર્મય મનનો ઉધાડ અને હદ્યનું (અનુસંધાન પાના નં. ૩૧ પર)

# પુસ્તક સમાલોચના

મિતેશભાઈ એ. શાહ

(નોંધ : આ વિભાગ માટે ગ્રંથ કે પુસ્તકની બે નકલ મોકલવા વિનંતી)

(१) पुस्तकानुं नाम : ગુજરાતી વિશ્વકોશ ગ્રંથગૌરવયાત્રા

વિશેષાંક સંપાદક : શ્રી પ્રમોદ શાહ પાના : ૮૪ મુલ્ય : લખેલ નથી.

સુંદર આઈ પેપર વાપરેલ છે. ૪૧ જેટલા લેખકોના ગુજરાતી વિશ્વકોશ વિષયક લેખો આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. પૂજ્યશ્રી મોટાએ ગુજરાતી ભાષામાં વિશ્વકોશની રચના માટે વિચારબીજ વાયું હતું. ગાંધીવાઈ કાર્યકરણ. સાંકળયંદભાઈ પટેલની પ્રેરણાથી સારસ્વત પદ્મભૂપણ ડૉ. ધીરુભાઈ ઠાકરે વિશ્વકોશની પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો અને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ચંદ્રકાંતભાઈ શેઠ અને ધીરુભહેન પટેલે પૂરા ખંત અને પરિશ્રમથી આ કાર્યને આગળ વધાર્યું. શેઠ આંશંદજી કટ્યાણજી પેઢીના પ્રમુખશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈનું માગદર્શન પણ મળતું ગયું. ઈ.સ. ૧૯૮૫ ની બીજી ડિસેમ્બરે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સહયોગથી મળેલા મકાનમાં વિશ્વકોશની વિરાટ યોજનાનું સ્વખ સાકાર થવા માંડ્યું અને આજે અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં એક અધ્યતન ભવ્ય મકાનમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પોતાની વિવિધ પ્રવૃત્તિઓ સુપેરે ચલાવી રહ્યું છે. ૧૯૮૭ થી ૨૦૦૮ એમ રૂપ વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના રૂપ ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવ્યું છે, જેમાં ૧૭૦ જેટલા વિષયો સમાવેશ પામે છે. આ વિશ્વકોશ ૧૫૮૭ જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલ છે. ૧,૭૩,૫૦,૦૦૦ જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વમધ્યમ વિશ્વકોશ છે. ખરેખર આ ગ્રંથો ગુજરાતી ભાષાની શોભા અને સમૃદ્ધિ છે. વર્તમાનમાં એના નવ ગ્રંથોનું પુનર્મુક્તણ થઈ ચૂક્યું છે અને બાદીના ગ્રંથોનું પુનર્મુક્તણ ચાલી રહ્યું છે. ગુજરાતી ભાળ વિશ્વકોશના એકથી સાત ગ્રંથો પ્રગટ થઈ ચૂક્યા છે અને પરિભાષાકોશ, નાટ્યકોશ અને ચિત્રકોશનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતી ભાષાને સરસ, સુંદર અને સરળ બનાવવા માટે અને વિશ્વકોશ રચનાની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા માહિતીનો ભંડાર આપવા માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અભિનંદનનું અધિકારી છે. ખરેખર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે વિવિધ ગ્રંથો પ્રકાશિત કરીને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે. ઈતિહાસ આ ભગીરથ કાર્યની માનબેર નોંધ લેશે.

ગુજરાતી ભાષાને ગૌરવાન્વિત કરનાર વિશ્વકોશના ગ્રંથો લોકો સુધી પહોંચે, લોકો જાણો-સમજે અને આ કોશનું લોકદર્શન થાય તે હેતુથી હાથીની અંબાડી પર વિશ્વકોશ ગ્રંથો બિરાજમાન કરી વિશ્વકોશ ‘ગ્રંથગૌરવયાગ્રા’ નું આપોજન કરવામાં આવ્યું હતું.

## અમૃતમહોત્સવની ... (પાના નં. ૩૦ પરથી ચાલુ...)

જોડાણ” એવું ભાવાત્મક યથાર્થ નામ આપેલ. શ્રી શ્રી રવિશંકરજીએ માનવતા, દ્યા-દાન અને સામાજિક કર્તવ્ય પર મનનીય પ્રવચન આપીને સહૃદે ધ્યાનનો અભ્યાસ કરાવીને આશીર્વાદ આપ્યા. નાદુરસ્ત તબિયત હોવા છતાં પૂ. શ્રી આત્માનંદજી આશીર્વચન આપવા ખાસ પથારેલ. બસે સંતોનું સુભગ મિલન થયું. શ્રી શ્રી રવિશંકરજીએ પૂ. સાહેબજીને શાલ ઓળાડીને અભિવાદન કર્યું. કાર્યક્રમના અંતમાં દરેક આંસુનિતને સ્મૃતિચિહ્ન ભેટ આપીને પ્રીતિભોજન રાખેલ. સમગ્ર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી, ઉત્સાહસભર, સફળ અને અંતરચક્ષુ ખોલનાર બની રહ્યો હતો.

સાધારણ સ્થિતિમાંથી મોટા ઉદ્યોગપતિ બનેલ આએ. શ્રી પ્રકાશભાઈનું જીવન ઘણું સરળ નભે અને પ્રેરણાદાયી છે. ખૂબ વસ્ત હોવા છતાં અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં મૂક્સેવા અને યોગદાન આપી રહ્યા છે. આવકના ૧૦% ઉપરાંત દર વર્ષે લગભગ ૧ માસનો સમય સેવા-સંસ્થાઓને આપે છે તે તેમને ધ્યાન છે. સમગ્ર કોબા પરિવાર તેમના આ અભિગમ અને જીવનને બિરદાવીને તેમના તંદુરસ્ત સુદીર્ઘ આયુ માટે પરમાત્માને પ્રાર્થના કરે છે.

## ભાગ વિભાગ



### સંકલન : મિતેશબાઈ એ. શાહ

#### (૧) સત્યપ્રિયતા

પ્રખર દેશદાન ધરાવતા શ્રી પુરુષોત્તમદાસ ટંડન સત્યના ભારે આગ્રહી હતા. તેઓ માનતા હતા કે સત્યનું પાલન મન, વચન અને કાયાથી થવું જોઈએ. સત્યવાદી કદી પણ મનથી અસત્ય વિચારે નહિ, વચનથી અસત્યનું ઉચ્ચારણ કરે નહિ અને પોતાની કાયાથી કોઈ અસત્ય કાર્ય કરે નહિ.

તેમનો પુત્ર એક શાળામાં અભ્યાસ કરતો હતો. તેની તેજસ્વિતાની પ્રશંસા માત્ર શાળાના વિદ્યાર્થીઓ સુધી જ મર્યાદિત નહોતી રહી, બલકે, શાળાના અધ્યાપકો પણ તેની ગ્રહણશક્તિનાં વખાડી કરતાં થાકતા નહોતા. એ પુત્રને મેટ્રિકની પરીક્ષા આપવાનો સમય આવી પહોંચ્યો. તે વખતે શિક્ષણભાતાનો એક નિયમ તેની આડે આવ્યો.

એ સમયે શિક્ષણભાતાનો એક એવો નિયમ હતો કે, જે વિદ્યાર્થી લઘુતમ સોળ વર્ષનો હોય એ જ વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે. આથી સોળ વર્ષ કરતાં નાની વયનો વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં બેસી શકતો નહિ.

ટંડનજીના પુત્રની વય પંદર વર્ષની હતી, એટલે નિયમ અનુસાર તે મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે એમ હતું નહિ. ડેડમાસ્ટરને થયું કે આ તેજસ્વી વિદ્યાર્થીના હિત માટે મારે કશુંક કરવું જ રહ્યું. અને તેમને આ માટે એક ઉપાય પણ જરી આવ્યો.

એક દિવસ તેઓ પરીક્ષા માટેનું એક ફોર્મ લઈને ટંડનજી પાસે પહોંચ્યા અને એ ફોર્મ તેમની સામે ધરીને બોલ્યા, “આ ફોર્મ તમે ભરો. પણ હા, એક વાતનું ધ્યાન રાખજો. જુઓ, પુત્રની વય સોળ વર્ષની ભરજો. જો એથી ઓછી ભરશો તો એ મેટ્રિકની પરીક્ષામાં બેસવા અયોગ્ય ગણાશે.”

ટંડનજી બોલી ઉઠ્યા, “તમે આ શું બોલો છો!

બાળકોને સત્ય બોલવાના રોજ પાઈ ભણાવતા તમે શિક્ષક જ મને અસત્યના રાહ પર લઈ જવા મારો છો? ના, મારાથી અસત્યનો આશ્રય લેવાશે નહિ. મારા પુત્રના એક નાનકડા સ્વાર્થ કે હિત ખાતર હું અસત્યનો આશ્રય લઉં એ કરતાં હું મરી જવાનું વધારે પસંદ કરીશ. મારાથી ફોર્મમાં એવું જૂઠું લખી શકાશે નહિ.”

ટંડનજીની આ સત્યપ્રિયતાને ડેડમાસ્ટર જોઈ જ રહ્યા.

#### (૨) લોકશ્રેયની ભાવના

અંગ્રેજ વિજાની સર હમ્ભી તેવીએ એક ‘સેફટી લેમ્પ’ (સુરક્ષાયુક્ત દીપ) ની શોધ કરી હતી. કોલસાની ઊરી ખાણોમાં કામ કરતા મજૂરો માટે આ ‘સેફટી લેમ્પ’ એક આશીર્વાદરૂપ બની રહ્યો. જિંદગીના જોખમાંથી ઉગારનાર એક જીવનરક્ષક સમાન એ સિદ્ધ થયો. આ ‘સેફટી લેમ્પ’ ના પ્રતાપે કોલસાની ખાણોમાં થતી દુર્ઘટનાઓથી કામદારોનું રક્ષણ થવા લાગ્યું.

તેવીએ આમ છતાં ‘સેફટી લેમ્પ’ ને પેટન્ટ કરાવ્યો નહિ. જો આવી નવી નવી શોધ પેટન્ટ કરાવવામાં આવે તો એના શોધકને મબલખ કમાણી થાય. છતાં તેવીએ પોતાની આ શોધને પેટન્ટ કરાવી નહિ.

આ જોઈને તેના કેટલાક મિત્રોને ખૂબ નવાઈ લાગી. તેવી પોતાની શોધને પેટન્ટ કેમ કરાવતો નથી એ વાત જ એ મિત્રોની સમજમાં આવતી નહોતી.

એકવાર તેવીના કેટલાક મિત્રો, પ્રશંસકો અને હિતેચુંઓ એના ધેર આવ્યા અને તેઓ આ વિજાનીને પૂછવા લાગ્યા, “અરે તેવી, તું તારી આ શોધને પેટન્ટ શા માટે કરાવતો નથી?”

“આથી શો ફાયદો ?”

“જો તું એને પેટન્ટ કરાવે તો તને અઠળક પૈસો પ્રામ થાય અને તું સુખચેનથી તારી જિંદગી ગુજરી શકે! અમે તો ઈચ્છાએ છીએ કે તું વહેલામાં વહેલી તકે આ શોધને પેટન્ટ કરાવી લે.”

દેવીએ ખૂબ ધીરજ અને શાંતિથી આનું કારણ સમજાવતાં મિત્રોને કહેવા માંડ્યું, “સાંભળો, મેં તો સ્વાખે પણ આ શોધને પેટન્ટ કરાવવાનું વિચાર્યું નથી. આ શોધ પાઇળનો મારો મુખ્ય ઉદ્દેશ માનવસેવા છે. બાકી મને તો પેટ ભરવા લૂખોસૂકો રોટલો મળી રહે છે. ધારી લો કે હું આ શોધને પેટન્ટ કરાવું અને મબલખ ધનની પ્રાપ્તિ થાય તો પણ એનાથી મારી ક્રિત્તમાં કોઈ વૃદ્ધિ થનાર નથી. મારી સાચી દોલત, સંપત્તિ અને ઐશ્વર્ય તો જનતાનું શ્રેય જ છે! જનતાનું આ શોધ દ્વારા જ શ્રેય સધાર્ય રહ્યું છે એ જ મારી સાચી સંપત્તિ છે!”

આ માનવતાવાદી વિજ્ઞાનીની લોકશ્રેય માટેની ઉમદા ભાવનાને સહુ મિત્રો અને શુભેચ્છકો જોઈ જ રહ્યા.

### (૩) ભચપણથી જ દેશદાઝ

ઈટાલીનો એક મોટો દેશભક્ત ! નામ એનું જોસેફ મેઝેની !

મેઝેનીએ પોતાની માતૃભૂમિ માટે ઘણો મોટો ભોગ આપ્યો હતો. એને ગરીબો પ્રત્યે ખૂબ જ લાગણી હતી. કોઈ પણ ગરીબ માણસ તેની નજરે પડે કે એ તેની મદદે દોરી ગયા વિના રહે નહિ.

એકવાર એ પોતાની મા સાથે બજારમાં ફરવા નીકળ્યો. એની માતાએ તેના બિસ્સામાં થોડા પૈસા મૂક્યા હતા, જેથી મેઝેની બજારમાંથી એને ગમતી વસ્તુઓ ખરીદી શકે.

ચાલતાં ચાલતાં મા-દીકરો એક ચોકમાં આવી પહોંચ્યા. ચોકના એક ખૂણો કોઈ બિખારી ઊભો હતો. એનાં કપડાં સાવ ફાટી ગયાં હતાં અને ભૂખને કારણે પેટમાં વેંતએકનો ખાડો પડ્યો હતો. તે બોલી રહ્યો હતો, “કોઈ પાઈ પૈસો આપો. દિવસ આખાનો ભૂખ્યો છું. પેટમાં અનાજનો એક દાણો પણ પડ્યો નથી.”

મેઝેનીના કાને આ શબ્દો પડ્યા કે એ ઊભો રહી ગયો. બીજી જ ક્ષણે એણે પોતાનો હાથ પોતાના કોટના એક બિસ્સામાં નાખ્યો અને માએ એને જે કંઈ પૈસા આપ્યા હતા એ બધા જ પૈસા બહાર કાઢીને પેલા બિખારીના હાથમાં મૂકી દીધા.

મા તો ફાટી આંખે આ જોઈ જ રહી.

તે બોલી, “અરે મેઝેની ! તે આ શું કર્યું ?”

મેઝેની બોલ્યો, “મા, મેં જે કરવા જેવું હતું એ જ કર્યું છે! આ બિચારો સાવ ભૂખ્યો છે. તેના પેટમાં અનાજ જશે તો આપણાને તે કેવી દુલ્લાદેશે ! અને મા, આપણા દેશમાં વસતા આવા ગરીબ લોકોને આપણે મદદ ન કરીએ તો આપણે દેશના સાચા નાગરિકો કેમ કહેવાઈએ ?”

અને માને પણ થયું કે મારો મેઝેની મોટો થઈને જરૂર દેશવાસીઓની સેવા કરશે. અને માતાના એ શબ્દો સાચા પડ્યા. મેઝેની મોટો થઈને ઈટાલીનો મહાન દેશભક્ત બન્યો.

### શું છે ભક્તિ ?

- ભક્તાહદ્યની વ્યથા છે ભક્તિ.
- પ્રભુના ગુણોની કથા છે ભક્તિ.
- શ્રદ્ધા અને સમર્પણનું સ્થાન છે ભક્તિ.
- ભક્તોના હદ્યનું ગાન છે ભક્તિ.
- શબ્દથી મૌનનું સંગીત છે ભક્તિ.
- પરમ સાથે થનારી પ્રીત છે ભક્તિ.
- રાગને રગદોળનાર છે ભક્તિ.
- દ્વેષને દૂર કરનાર છે ભક્તિ.
- મોહને માત કરનાર છે ભક્તિ.
- લોભને પરાસ્ત કરનાર છે ભક્તિ.
- કોધને કકળાવનાર છે ભક્તિ.
- જીવનમૈત્રીનો રણકાર છે ભક્તિ.
- શુદ્ધિનો સત્કાર છે ભક્તિ.
- સંયમનો ધબકાર છે ભક્તિ.
- સિદ્ધિપદનો શાશગાર છે ભક્તિ.

## સમાજ-સંસ્થા દર્શન

### સંસ્થામાં ચુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન

યુવાપેઢીનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, ખાસ કરીને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થામાં તા. ૨૭-૧૨-૨૦૧૮ થી તા. ૨૮-૧૨-૨૦૧૮ (શુક્ર થી રવિ) દરમિયાન યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, સ્વાધ્યાય, સંસ્કારલક્ષી ધર્મવાર્તા, કવીજ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર અંગેની વિશેષ માહિતી નીચે મુજબ છે :-

- (૧) શિબિરમાં ૧૫ થી ૪૫ વર્ષની ઉમરના ભાઈ-બહેનો ભાગ લઈ શકશે.
- (૨) શિબિરની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ. ૧૫૦/- (એકસો પચાસ પૂરા) રહેશે.
- (૩) શિબિરાર્થીઓએ સફેદ વચ્ચો પરિધાન કરવા આવશ્યક છે. ભાઈઓએ સફેદ લેંઘો-જર્બો અને બહેનોએ સફેદ કુર્તી-પાયજામા પહેરવા આવશ્યક છે.
- (૪) શિબિરમાં પૂજયશ્રી આત્માનંદજી, બા.બ્ર. સુરેશજી સિવાય બહારથી આમંત્રિત શ્રી શુત્રપ્રજ્ઞસ્વામીજી, યોગાચાર્ય શ્રી દુષ્ટંતભાઈ મોદી ઈત્યાદિ વિશેષ વિદ્વાનોના સત્સંગનો લાભ મળશે.
- (૫) શિબિરાર્થીઓએ તા. ૨૬-૧૨-૨૦૧૮ સાંજ સુધીમાં અથવા તા. ૨૭-૧૨-૨૦૧૮ સવારે ૭.૦૦ વાગ્યા સુધીમાં સંસ્થામાં પહોંચી જવું અનિવાર્ય છે.
- (૬) તા. ૨૬-૧૨-૨૦૧૮ ના સાંજે ભોજન લેવાના હો તો અગાઉથી સંસ્થાના કાર્યાલયમાં માહિતી આપવી, જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે.
- (૭) શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓએ પોતાના નામ અગાઉથી સંસ્થાના કાર્યાલયમાં નોંધાવી દેવા વિનંતી.
- (૮) સંપૂર્ણ શિબિર દરમિયાન સંસ્થામાં રોકાવાનું રહેશે. અપ-ડાઉન થઈ શકશે નહિ.
- (૯) સંપર્કસૂચો : (૧) કાર્યાલય - (૦૭૯) ૨૩૨૭૬૨૧૮ (૨) બ્ર.શ્રી કપિલભૈયા - ૯૪૨૭૩૦૬૪૭૩ (૩) બા.બ્ર. જનકદીદી - ૭૩૫૮૩૦૦૮૩૮ (૪) શ્રી હિત મોદી - ૯૪૨૭૬૬૮૩૫૪

### સંસ્થામાં દીપાવલી આરાધના શિબિર સાનંદ સંપત્તિ

આપણી સંસ્થામાં તા. ૨૬-૧૦-૨૦૧૮ થી તા. ૨૮-૧૦-૨૦૧૮ દરમિયાન દીપાવલી આરાધના શિબિર ઉલ્લાસમય ધર્મમય વાતાવરણમાં સંપત્ત થઈ. શિબિરનું સફળ સંચાલન પ્રતિભાશાળી મુમુક્ષુ આદ. શ્રી શરદભાઈ ડેલીવાળાએ કર્યું હતું.

**સ્વાધ્યાય :** પૂજયી આત્માનંદજીના સ્વાધ્યાય વીડિયો કેસેટના આધારે યોજાયા હતા.

એલ. ડી. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજ્ના ડાયરેક્ટર, બહુમુખી પ્રતિભા ધરાવનાર, બા.બ્ર. તથા તપસ્વી આદ. ડૉ. જિતેન્દ્રભાઈ શાહે 'શ્રી જ્ઞાનસાર' - અધ્યાય-૨૧ ના આધારે સ્વાધ્યાય આપતા જણાયું

કે જ્ઞાનસાગરને વલોવીને જ્ઞાનનું રહસ્ય ‘જ્ઞાનસાર’ માં ભર્યું છે. તર પ્રકરણો દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવાનો માર્ગ તેમાં સ્વીધ્યો છે. મનુષ્યભવને પામવો એ અવસર છે. તેને સાર્થક કરવા પ્રયત્ન ન કરીએ તો જન્મ-મરણના ચક્કમાં અટવાયેલા રહીશું. જગતમાં સર્વત્રેષ મંગળ તે ધર્મ છે. સમયનો સુદૃપ્યોગ કરીએ તો જીવન જીતી જવાય. ૧ દિવસમાં માનવી લગભગ ૭૦,૦૦૦ વિચારો કરે છે, જે રાગ-દ્રેષ સાથે જોડાયેલા છે. દુઃખ એ કાર્ય છે તો તેનું કારણ કર્મ છે. ચાર બાબતો સાધકે અવશ્ય કરવી જોઈએ : (૧) આત્માને જ્ઞાનવાની કોશિશા, (૨) કર્મસિદ્ધાંતને જ્ઞાનવો, (૩) કર્મભાંથી મુક્ત થવાની વિધિ જ્ઞાનવી (૪) સંસારના સ્વરૂપને સમજવું. જ્યાં સુધી આપણે ભીતરમાં ઊંડા નહિ ઉઠાડીએ ત્યાં સુધી આપણી દાણી પર ચઢેલી મોહની કાંચળી ઉત્તરશે નહિ. કર્મની વિચિત્રતાઓ જોઈને સમભાવ ધારણ કરવાનો છે. સેવા અને સમર્પણભાવથી કરેલા સત્કાર્યોનું અનેકગણું ફળ મળે છે. આત્માનું વિસ્મરણ થવું તે પ્રમાદ. જગતમાં પરવશતા જેવું કોઈ દુઃખ નથી. કર્મ કોઈ વાર સુખના શિખરે બેસાડી દે તો કોઈ વાર દુઃખની ખાઈમાં પણ ફેંકી દે ! ‘ઉપયોગ’ ને મલિન ન થવા દેવો. ‘ઉપયોગ’ ને આત્મા તરફ લઈ જવાનો છે. આધ્યાત્મિક વિકાસ માટે સેવા, સમર્પણ અને સમત્વભાવ જરૂરી છે. ઇન્દ્રિયો પ્રત્યેની આસક્તિને કારણે જીવમાં ત્યાગ-વૈરાગ્ય ઉત્પન્ન થતાં નથી. ઊંટના પીઠ જેવો વાંકોચુંકો આ સંસાર છે. તુચ્છ વસ્તુઓ (વિષયભોગો) માટે ઉત્તમ વસ્તુ (માનવભવ) જીવ બગાડે છે. સંસારમાં કડવા અનુભવો થવા છતાં જીવ જાગૃત થતો નથી ! ગુમાવેલા આરોગ્ય, ધન, પદ, પ્રતિક્રિયા તો પાછા મેળવી શકાય છે પણ એક વાર ગુમાવેલો સમય પાછો મેળવી શકાતો નથી. જે વિદ્યા આત્માનું કલ્યાણ કરનારી હોય તે સાચી વિદ્યા. મનન-ચિંતન-નિદ્રિધ્યાસનની ભૂમિકામાં ન જઈએ ત્યાં સુધી શ્રવણ કાર્યકારી નથી.

આદ. બા.બ્ર.શ્રી સુરેશજીએ ‘ઉપમિતિભવપ્રપંચકથા’ ના આધારે રસપ્રદ શૈલીમાં, તત્ત્વસભર સ્વાધ્યાય આપ્યા હતા. તેઓશ્રીએ જણાવ્યું કે ધર્મકથા સાંભળતા સંવેગ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. જોટાને સાચું મનાવે તેનું નામ મોહરાજા. સદ્ગુરુ અને આગમોના શરણમાં નથી રહેતા ત્યાં સુધી સંસારીભાવો પરેશાન કરે છે. માનવભવમાં સાધનાને સાનુક્ષણ સંયોગો મળવા છતાં જીવ સત્પુરુષાર્થ કરતો નથી! પરદવ્યો (દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ) ને ગ્રહણ કરવાં તે પણ એક પ્રકારની ચોરી છે! વિષયાદિનું સેવન કરીને રાજી થવું તેનું નામ રોક્રધ્યાન. અવિવેકથી અભિમાનનો જન્મ થાય છે. રાગ પ્રિયજનોના દોષોને જોવા દેતો નથી અને દેખ શત્રુના ગુણોને જોવા દેતો નથી. જ્યાં સર્વ પ્રકારના દુર્ગુણો રહે છે તેનું નામ તામસ ચિત્ત. ત્રણ લોકમાં સંસારી જીવો પર જેનું એકચ્ચકી શાસન ચાલે છે તેનું નામ મોહરાજા. જૂઠી માન્યતાઓ પર રાગ કરાવે તે દાખિયાં. દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગ કેવળીગમ્ય છે. રાગ, દેખ અને મોહની નિવૃત્તિ થાય તેવો લક્ષ રાખવો.

**મંત્રજાપનો કાર્યક્રમ :** ઘાતીકર્મની ૪૭ પ્રકૃતિઓનો નાશ થાય તેવી ભાવનાથી પર્વ દરમિયાન રાત્રે નીચે જગાવેલ મંત્રોની ૪૭ માળાઓનો કાર્યક્રમ યોજાયો હતો : (૧) સહજાત્મસ્વરૂપ પરમગુરુ (૨) આત્મભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે (૩) પરમગુરુ નિર્ણય સર્વજ્ઞદેવ (૪) મમ સદ્ગુરુ ચરણ સદા શરણાં (૫) સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.

**પ્રક્રિયા :** દીપાવલીના શુભ દિને વિવિસહિત ભગવાનને નિવાણિલાદુ ચઠાવવાનો કાર્યક્રમ યોજાયો હતો; જે માટેનો આર્થિક સહયોગ આદ. શ્રી દિનેશભાઈ બાવીસી (રાજકોટ) તરફથી સાંપદ્યો હતો. બેસતાવર્ષના શુભ દિને સૌચે પૂજયશ્રીના શુભાશિષ પ્રાર્મ કર્યા હતા. પર્વ દરમિયાન નીચેના દાનવીર મહાનુભાવો તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું - (૧) આદ. શ્રી પ્રકાશભાઈ હેમેન્ડ્રભાઈ શાહ, અમદાવાદ (૨) આદ. શ્રી જ્યંતિભાઈ પુષ્પાબેન શાહ (લંડન). બેસતા વર્ષના શુભ દિને ઉત્તમ મુમુક્ષુ, સેવા, સર્મર્પણતા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આદ. સુધાબેન પ્રકુલભાઈ લાખાણીની સાધનાકુટિરમાં પૂજયશ્રી, પૂજય બહેનશ્રી અને મુમુક્ષુ ભાઈ-બહેનો પધાર્યા હતા. લાખાણી પરિવારે સૌનું ઉઘાસભર સ્વાગત કર્યું અને સૌનું

મોં મીહું કરાવ્યું હતું. આ ઉપરાંત તેઓશ્રી તરફથી દરેકને રૂ. ૨૦/- ની પ્રભાવના કરવામાં આવી હતી. બેસતા વર્ષના શુભાદિને આદ. શ્રીમતી ઈન્દ્રુભેન જવેરી તરફથી સાકરની પ્રભાવના કરવામાં આવી હતી. સંસ્થાના પ્રકાશનો પર ૫૦% ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શ્રી નીતાબેન લોડીયા, શ્રી રેખાબેન પરમાર્થી, શ્રી સુશીલાબેન કારાણી અને શ્રી ભારતીબેન કારાણીએ પ્રેમપરિશ્રમપૂર્વક કલાત્મક અને પ્રેરણાદાયક રંગોળી બનાવી હતી.

### મહાવીરસ્વામી નિવાણ કલ્યાણક

દિવાળીની રાત્રે ભગવાન મહાવીરસ્વામી નિવાણ પામ્યા. તે પછી થોડા કલાકોમાં નવા વર્ષના પરોઢિયે ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. એક જ રાત્રિમાં બનેલ આ બસે મહાન પ્રસંગોનું જૈન સમાજમાં ઘણું મહત્વ છે. ભવિકજનો દિવાળીની રાત્રે ધણી આરાધના કરીને ધન્યતા અનુભવે છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ. મહેન્દ્રભાઈ ખંધારના માર્ગદર્શન નીચે કોબા આશ્રમના ૨૫ મુમુક્ષુઓએ દિવાળીની રાત્રે જિનમંદિરમાં ૮:૩૦ થી ૧૨:૩૦ વિધિપૂર્વક ભાવથી આરાધના કરી. તેમાં ત સામાયિક, ૧૨૫ લોગસનો કાઉસર્ગ અને “મહાવીર સ્વામી પરિનિવાણ, ગૌતમ સ્વામી કેવળજ્ઞાન” ની માળાઓ હતી. દેવ-ગુરુ કૃપાથી આરાધના સાનંદ સંપત્ત થઈ.

### સંસ્થામાં ‘શ્રી તત્ત્વાર્થસૂત્ર’ ના આધારે લેખિત કસોટી સંપન્ન

મુમુક્ષુ ભાઈ-બહેનો આગમોનો અભ્યાસ કરીને તત્ત્વચિત્તન દ્વારા તત્ત્વની પ્રામિનો ઉદ્યમ કરી શકે તેવા શુભ આશયથી સંસ્થામાં અવારનવાર લેખિત કસોટીઓનું આયોજન કરવામાં આવે છે. જૈનધર્મનો સર્વમાન્ય ગ્રંથ એટલે ‘શ્રી તત્ત્વાર્થસૂત્ર’. તા. ૨૫-૧૦-૨૦૧૮ ના રોજ સંસ્થામાં ‘શ્રી તત્ત્વાર્થ સૂત્ર’ ની ટીકા ‘તત્ત્વાર્થપ્રોગ્નિ’ ના આધારે અધ્યાય-૧ (સૂત્ર ૧ થી ૮) ની લેખિત કસોટી પોજવામાં આવી હતી. પ્રતિભાસંપત્ત અને સંસ્થાને સમર્પિત એવા આદ. બા.બ્ર. શ્રી સુરેશજીએ પ્રેમપરિશ્રમ લઈ ઉપરોક્ત વિષયની તત્ત્વસભર સુંદર માહિતી સૌને પીરસી છે. તેઓએ આ વિષય પર રસસભર અને ચિંતનાત્મક સ્વાધ્યાય પણ સંસ્થામાં આપેલ છે. સારી સંખ્યામાં મુમુક્ષુ ભાઈ-બહેનોએ આ લેખિત કસોટીમાં ભાગ લીધો હતો. પેપર ટાઈપ કરાવવું, મુફ્ફરીડિંગ, અનુવાદ તેમજ પેપર તપાસવા વગેરે કાર્યવાહીમાં સેવાભાવી અને ભક્તહૃદય મુમુક્ષુ આદ. શ્રી ચંપકભાઈ પરમાર્થીએ સુંદર યોગદાન આવ્યું હતું; જેની સાભાર નોંધ લઈએ છીએ. લેખિત કસોટીમાં આગવું સ્થાન પ્રામ કરનાર મુમુક્ષુ ભાઈ-બહેનોના નામ અને ગુણ નીચે મુજબ છે :

- (૧) બ્ર. કપિલભૈયા - ૮૭ (૨) બા.બ્ર. જનકદીદી - ૮૮ (૩) બા.બ્ર. અલકાદીદી - ૮૯ (૪) શ્રી મહેન્દ્રભાઈ ખંધાર - ૮૭ (૫) ડૉ. રાગિણીબેન શાહ - ૮૩ (૬) શ્રી ભારતીબેન મહેતા - ૮૩ (૭) બ્ર. સંધ્યાબેન - ૮૧ (૮) શ્રી અશોકભાઈ પી. શાહ - ૮૦ (૯) શ્રી તરલાબેન બાવીસી - ૭૮ (૧૦) શ્રી સુજાતાબેન મહેતા - ૭૮ (૧૧) શ્રી રમણભાઈ શાહ - ૭૯ (૧૨) શ્રી કેલાસબેન શાહ - ૭૫ (૧૩) ડૉ. શર્મિષ્ઠાબેન સોનેજી - ૭૨ (૧૪) શ્રી સુસ્મિતાબેન શાહ - ૭૨ (૧૫) શ્રી અનુપમભાઈ શાહ - ૭૨ (૧૬) શ્રુતિબેન માલદે - ૭૧.

### શ્રી આત્મસિદ્ધિ પારાયણ

(૧) સંસ્થામાં તા. ૩૧-૧૦-૨૦૧૮ ના દિવસે ઉત્તમ મુમુક્ષુ સ્વ. હિંમતલાલ છોટાલાલ શાહ (ઘાટકોપર, મુંબઈ) ની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવારજનો પૂજ્ય લીલાબેન, બા.બ્ર. ચેતનભાઈ, સ્વ. ધીરેનભાઈના ધર્મપત્નિ મીનાબેન, સુધાબેન, જ્યશ્રીબેન તરફથી શ્રી આત્મસિદ્ધિશાખનું પારાયણ રાખવામાં આવ્યું હતું. પારાયણ બાદ પૂજ્યશ્રી આત્માનંદજનો વીઠિયો કેસેટ (શ્રી આત્મસિદ્ધિ-૧૨૮) ના આધારે સ્વાધ્યાય પોજાયો હતો. પારાયણ પહેલાં શ્રી આત્મસિદ્ધિશાખની પૂજા રાખવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય લીલાબેનના પરિવારજનો અને મુમુક્ષુ ભાઈ-બહેનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગુણાનુવાદ કરતાં બા.બ્ર.શ્રી પરિમલભાઈ ખંધારે જગ્યાવ્યું કે સ્વ. હિંમતભાઈના ચારેય સંતાનોએ ધર્મવારસો જાળવી રાખ્યો છે અને તેમાં અભિવૃદ્ધિ કરી છે. સ્વ. હિંમતભાઈ ભાવપૂર્વક આરતી ઉતારતા અને સતત પ્રભુસ્મરણ કરતા. તેઓને કવિ હુલા કાગનું ‘હે જ તારા આંગણિયા પૂઢીને .... ગીત ખૂબ ગમતું. અંતિમ સમયે નવકારમંત્રના ભાવમાં તેઓએ દેહત્યાગ કર્યો.

બા.બ્ર. ચેતનભાઈ શાહે જણાવ્યું કે મારા પિતાજીનું જીવન સંઘર્ષમય હતું. શૂન્યમાંથી તેઓને સર્જન કરવું પડ્યું હતું. પરમહૃપાળુદેવના પરિચયમાં આવ્યા પછી તેઓને હૃપાળુદેવ પ્રત્યે અતૂટ શૈક્ષા અને શરણાગતિ પ્રગત્યાં; જે સંસ્કાર પરિવારમાં જોવા મળે છે. તેઓ નાનપણાથી અમને ભક્તિ કરવા લઈ જતા. પૂજ્યશ્રી આત્માનંદજીનો પરિચય ધાટકોપરમાં થયો. પૂજ્યશ્રીએ ઈ.સ. ૧૯૮૨ માં વાત્સલ્યભાવથી પ્રેરાઈ ઘરમાં પગલાં કર્યા. પૂજ્ય સાહેબજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ઋણસ્વીકાર કરીએ છીએ. મારા પિતાજી મને કહેતા, “હું (ધર્મની) ટ્રેન ચૂકી ગયો પણ સૌભાગ્યથી છેલ્લો ઉંબો પકડી લીધો. તારી બધી સગવડ થઈ જશે. તું ધર્મમાર્ગ આગળ વધ.” કોબા એટલે વાત્સલ્યનો આશ્રમ.

પૂજય બહેનશ્રીએ જગ્ણાયું કે સ્વ. હિમતભાઈનું જીવન ભારતીય સંસ્કૃતિને અનુરૂપ હતું. તેઓ દેશભક્ત હતા. સ્વરાજની લડાઈમાં તેઓ જેલમાં ગયા હતા. તેઓ ગાંધીરંગથી રંગાયા હતા અને ખાઈ પહેરતા. આદ. લીલાબેનનું આદર્શ જીવન જોઈને હદ્ય નમી પડે છે. તેઓ અવારનવાર પરિવારજનો સાથે સંસ્થામાં પધારી સત્સંગનો લાભ લે છે. સ્વ. હિમતભાઈના આત્માને ભાવપૂર્વક સ્મરણાંજલિ અપીએ છીએ.

આ પ્રસંગે પૂજ્ય લીલાબેન પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.

(૨) તા. ૦૩-૧૧-૨૦૧૮ ના દિવસે સ્વ. શ્રી કિશોરભાઈ કાંતિલાલ ખંધારના આત્મશૈયાર્થે તેઓના પરિવારજનો (આદ. શ્રી સુષ્માબેન, બા.પ્ર. શ્રી પરિમલભાઈ, શ્રી મોનાબેન - શ્રી મુકેશભાઈ, શ્રી સોનાબેન - શ્રી ડિમ્પલભાઈ) તરફથી આપણી સંસ્થામાં શ્રી આત્મસિદ્ધિ પારાયણ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય આચાર્યશ્રી વિદ્યાસાગરજી વિરચિત શ્રી ચોવીસ તીર્થકરોની દોહા સુતિ, શ્રી જિનવાણી સુતિ, મંગલભાવના વગેરેનું ભાવપૂર્વક પારાયણ કરેલ.

સ્વ. કિશોરભાઈનો ગુણાનુવાદ કરતાં આદ. શ્રી મનહરભાઈ જશવાણીએ જગ્યાયું કે કિશોરભાઈમાં રહેલા સદ્ગુણોને આપણે જીવનમાં પ્રગટાવીએ તો તેઓને સાચી શ્રદ્ધાંજલી આપી ગણાય. આધુનિક યુગના શ્રવણ બા. બ્ર. શ્રી પરિમલભાઈ છે કે જેઓએ તેમના માતાપિતાની ખૂબ સેવા કરી છે. કિશોરભાઈએ સંતાનોને સુસંસ્કારો આપ્યા. તેઓનો પરિવાર ધર્મભ૟ જીવન જીવે છે.

કિશોરભાઈના ભાઈ આદ. શ્રી રમેશભાઈ ખંધારે ગુણાનુવાદ કરતાં જણાવ્યું કે અમારા પાંચેય ભાઈઓમાં તેઓનું વ્યક્તિત્વ વિશિષ્ટ હતુ. તીવ્ર સ્મરણશક્તિ, ધર્મભાવના, દફ સંકલ્પશક્તિ, સમતાભાવ જેવા સદ્ગુણોવાળું તેઓનું વ્યક્તિત્વ હતું. કેન્સર જેવા અશાતાના ઉદ્યમાં કિશોરભાઈ સમતાભાવ રાખી શક્યા હતા.

બા.બ્ર. શ્રી ચેતનભાઈએ શ્રદ્ધાજલી અર્પતા જણાવ્યું કે કિશોરભાઈ ધર્મનુરાગી શ્રાવક હતા. જીવનના અંતિમ ૨૦ વર્ષો તેમણે સત્તસંગ અને શાસ્ત્રપારાયણમાં વીતાવ્યા. તેઓએ ઈષ્ટોપદેશ, છ દ્રાગા, તત્વાર્થ સૂત્ર, દ્વય સંગ્રહ જેવા અનેક શાસ્ત્રો કંઈસ્થ કર્યા હતા. શ્રી પરિમલભાઈએ રાત-દિવસ શારીરિક અને આત્મિક સેવા કરીને સુપુત્ર તરીકેનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું. અમેરિકા જઈ પરિમલભાઈએ ઉચ્ચ અત્યાસ કર્યો પણ તેઓનું મન આધ્યાત્મિક સાધનામાં જોડાઈ ગયું. મુક્તાગિરિ સિદ્ધક્ષેત્રમાં પરિમલભાઈએ આજીવન બ્રહ્મયર્થવત અંગીકાર કર્યું હતું.

કિશોરભાઈના ભાઈ આદ. શ્રી મહેન્દ્રભાઈ બંધારે ગુણાનુવાદ કરતાં જણાવ્યું કે કિશોરભાઈએ ધર્મની જ્યોત જગાવી પોતાના જીવનમાં ધર્મને વણી લીધો હતો. તીર્થના ઉછરંગી, વાત્સલ્ય, પરોપકાર, કુટુંબપ્રેમ, સમતાભાવ જેવા અનેક સદ્ગુણો તેઓ ધરાવતા હતા. તેઓ કોબા આશ્રમમાં સત્સંગ અર્થે અવારનવાર પથારતા. અમને કહેતા કે પૂજ્ય સાહેબજીનું શરણ છોડશો નહિ. કળિયુગમાં આવા પુરુષો ઓછા મળશે. પૂ. સાહેબજીનું સૂત્ર “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” કિશોરભાઈએ તેમના જીવનમાં ચરિતાર્થ કરેલ. મહેન્દ્રભાઈ અને અન્ય નાના ભાઈ-બહેનોને અમેરિકા ભણવા મોકલવામાં તેમનો સિંહફાળો હતો. કિશોરભાઈનું લાંબુસંતોષી-સાદૃ-ધર્મમય જીવન અને અંતિમ શાંતિ-સમતા જોતા તેઓ જીવન અને મૃત્યુને સફળ કરી ગયા.

બા.બ્ર. આદ. શ્રી પરિમલભાઈ બંધારે જણાવ્યું કે સંસારી પિતાએ પરમપિતા પરમાત્મા તરફ અંગુલિ-નિર્દેશ કર્યો તે તેમનો મોટો ઉપકાર છે. આપણી ચામડીના જોડા બનાવીને મા-બાપને પહેરાવીએ તો પણ તેઓનું ઋણ ચૂકવી ના શકાય. તેઓને ધર્મના માર્ગ વાળીએ તો ઋણમુક્ત થવાય. મારા પિતાશ્રી તકલીફોને હળવાશથી લેતા. જાગૃતિપૂર્વક શાખપારાયણ કરતા. કોબા આશ્રમને પોતાનું ધર ગણતા. કિશોરભાઈની મોટી સુપુત્રી મોનાબેન IAS થઈને રૂ. ૨ વર્ષથી પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક પ્રજાની સેવા કરે છે. હાલ ટોકિયોમાં ભારતિય એલચી કયેરોમાં આર્થિક અને ઔદ્યોગિક બાબતોના સચીવ છે. તેમણે પોતે એક કાવ્ય રચીને મોકલેલ કે જેમાં પિતા (કિશોરભાઈ) ના પ્રેમ-વાત્સલ્ય-હુંફ સુંદર રીતે વણી લીધેલ. નાની સુપુત્રી સોનાબેને તે વાંચી સંભળાવેલ અને સૌની આંખો ભીની થયેલ.

પૂજ્ય બહેનશ્રીએ ગુણાનુવાદ કરતા જણાવ્યું કે બંધાર પરિવારના સદ્ગુણો જાણી હેયું ભાવથી ગદ્દગદિત થઈ જાય છે. આપ સંસ્થામાં પધારીને અમારા સૌનું સમાધિમરણ થાય તેવા પ્રયત્નો કરજો.

આ પ્રસંગે આદ. શ્રી સુખમાબેન બંધાર પરિવાર તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.

### ગોધમજી મુકામે સત્સંગ મેળાવડો સાનંદ સંપત્તિ

તા. ૦૩-૧૧-૨૦૧૮ ના દિવસે ગોધમજી (તા. ઈડર) મુકામે સત્સંગ મેળાવડો યોજાયો હતો. શ્રી લાલજીબાપા મુમુક્ષુમંડળના તત્ત્વાવધાનમાં સ્વ. હીરાબેન કેશાભાઈ સુતરિયાના સ્મરણાર્થે સુતરિયા પ્રહૂલાદભાઈ અને વિષ્ણુભાઈ કેશાભાઈ દ્વારા ઉપરોક્ત સત્સંગ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સંસ્થાના પ્રતિનિધિ તરીકે આદ. બા.બ્ર. સુરેશજી ગોધમજી પધાર્યા હતા. આદ. સુરેશજીએ જીવનું સંસારપરિભ્રમણ, મનુષ્યદેહની દુર્લભતા, પાપોથી મુક્તિ, ભક્ષ્ય-અભક્ષ્યનો વિવેક વગેરે મુદ્દાઓને અનુલક્ષીને સરળ છતાં સચોટ શૈલીમાં સ્વાધ્યાય આપ્યો હતો. સમાર્ભમાં લગભગ ત્રણ હજાર જેટલા ભક્તજનો પધાર્યા હતા. ભોજનપ્રસાદી લીધા બાદ સૌ છૂટા પડ્યા હતાં.

### યુગપુરુષ પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૮મી જન્મજયંતિના ઉપકમે શ્રદ્ધિવસીય સત્સંગ-સ્વાધ્યાય-ભક્તિના કાર્યક્રમ સાનંદ સંપત્તિ

સંસ્થાની વિનંતિને સ્વીકારી રાજકોટથી આદ. શ્રી સુધીરભાઈ મહેતા કોબા પધાર્યા હતા. તેઓએ તા. ૧૧-૧૧-૨૦૧૮ થી તા. ૧૩-૧૧-૨૦૧૮ કુલ ત્રણ દિવસ દરમાન પરમકૃપાળુદેવના અલૌકિક અંતરંગ ચારિત્રની વચનામૃતજ્ઞના વિવિધ પત્રાંકોના આધારે સુંદર છણાવટ કરી હતી. તેથી સૌના ભાવ ઉલ્લસિત થયા હતા.

પૂજ્યશ્રી ગોકુળભાઈના પધારવાથી સોનામાં સુગંધ ભળી હતી. તેઓએ ‘પાહુડ દોહા’ ના આધારે મનનીય સ્વાધ્યાયમાં જણાવ્યું હતું કે દેહસ્થિત આત્માને સ્વસંવેદન દ્વારા જાણી લેવો તે માટે જ બધી સાધના છે.

આદ. બા.બ્ર. સુરેશજીએ તેમના સ્વાધ્યાયમાં જણાવ્યું હતું કે આપણે કૃપાળુદેવના જીવન સાથે આપણા જીવનને મેળવવું. આપણે તેમના જીવનને આત્મસાત્ત કરવું.

સવારે દૈનિક આજ્ઞાભક્તિ, અભિષેક તથા પૂજા કરવામાં આવી હતી. જન્મદિન નિમિતે શ્રી આત્મસિદ્ધ શાસ્ત્રજ્ઞની પૂજા કરી હતી. પૂર્ણિમાના દિને સવારે શ્રી રાજમંદિરમાં ભક્તિ કરી હતી તથા રાત્રે વિશેષ ભક્તિનું આયોજન હતું; જેમાં મુમુક્ષુઓએ ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરી હતી. તા. ૧૩ મી એ સવારે નંદીશ્વરદીપની પૂજા કરી હતી.

ત્રણેય દિવસ મુમુક્ષુઓના સૌજન્યથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.

આસો માસની આયંબિલની ઓળી

સંસ્થામાં નીચેના મુખ્ય ભાઈઓએ આસો માસની આયંબિલની ઓળી કરી હતી. (૧) શ્રી રમણભાઈ શાહ (૨) શ્રી રમેશભાઈ ખંધાર. આ ઉપરાંત અનેક મુખ્ય ભાઈ - બહેનોએ શક્તિ અનુસાર છૂટક આયંબિલ કર્યા હતા. તપસ્વી ભાઈ-બહેનોને સંસ્થા તરફથી અનુમોદના સહ ધ્યવાદ પાઠવીએ છીએ.

સંસ્થામાં બા. ફ્ર. ડૉ. સુજાતાદીદીની સ્વાધ્યાયશ્રેણી સંપદ્ધ

આપણી સંસ્થામાં તા. ૨૪-૧૧-૨૦૧૮ થી તા. ૦૧-૧૨-૨૦૧૯ દરમિયાન બા.બ્ર. ડૉ. સુજાતાદીદીની પૂજ્ય આચાર્યશ્રી નેમિયંડ સિદ્ધાંતચક્વતી વિરચિત ‘શ્રી ગોમટસાર (જીવકાંડ) અધિકાર-૧’ ના આધારે સ્વાધ્યાપશ્રેષ્ઠી સંપત્ત થઈ. આદ. સુજાતાબેને ‘શ્રી સમયસાર’ ની શ્રી જ્યસેન આચાર્યની ટીકા પર સંસ્કૃતમાં Ph.D. કરેલ છે. પૂજ્ય સમંતભદ્ર મહારાજ પાસે તેઓશ્રીએ આજીવન બ્રહ્મચર્ય પ્રત અંગીકાર કર્યું. તેઓએ ગ્રાં પ્રતિમા ધારણ કરેલ છે. તેઓશ્રીએ ‘શ્રી લબ્ધિસાર’ ગ્રંથનો સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. તેમાં કરણાનુયોગના કઠિન ગણિતનું સરળતાથી સમજ શકાય તેવું આલેખન કર્યું છે. કુંભોજમાં કરુણાનુયોગની અનેક શિબિરો કરાવી છે. ગુરુકુળના બાળકોના સંસ્કારસિંચનમાં પણ તેઓશ્રીએ સુંદર યોગદાન આપ્યું છે. તેઓ સને ૧૯૮૪ માં કોબા સંસ્થામાં પ્રથમ વખત પદ્ધાર્ય હતા. સંસ્થાના સ્વાધ્યાયહોલનું ઉદ્ઘાટન તેઓશ્રીના વરદ હસ્તે થયું હતું. તેઓ સમંતભદ્ર મહારાજના સાન્નિધ્યમાં રહ્યા છે તેમજ આદ. ગજાબેન પાસે રહીને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો છે.

સંસ્થામાં યોજાયેલ સ્વાધ્યાયશૈક્ષણી દરમિયાન તેઓશીએ શ્રી ગોમટસાર (જીવકાંડ) અધિકાર-૧ ની દૃગાથાઓને સરળ છતાં સચોટ, તર્કબદ્ધ શૈલીમાં પ્રસ્તુત કરી મનનીય સ્વાધ્યાય આપ્યા હતા. સૌને તત્ત્વજ્ઞાન પીરસ્યું હતું. તેઓના સ્વાધ્યાયશ્રવણથી મુમુક્ષુ ભાઈ-બહેનોએ સંતોષ અને આનંદની લાગણી અનુભવી. બ્ર. રીનાબેન શાહે સાત દિવસના સ્વાધ્યાયનો સારાંશ (શોર્ટ સમરી) પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રોજેક્ટર પર પ્રસ્તુત કરીને સમજાવ્યો હતો.

સંસ્થામાં બોડી પ્રોફ્ફાઈલ (પેથોલોજી) તપાસ કેમ્પ સંપત્તિ

સંસ્થા સંચાલિત મેડિકલ સેન્ટરના ઉપકમે તથા ગ્રીનકોસ પેથોલોજી એન્ડ મોલેક્યુલર લેબોરેટરીના સહયોગથી પૂજ્યશ્રી આત્માનંદજીના ૮૮મા જન્મમંગળદિન નિમિત્તે, આદ. શ્રી તરલાભેન દિનેશભાઈ બાવીસી પરિવાર (રાજકોટ) ના સૌજન્યથી સંસ્થામાં તા. ૦૧-૧૨-૨૦૧૮ ના દિવસે બોડી પ્રોફાઇલ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્યશ્રી આત્માનંદજીના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય અને શ્રી નવકારમંત્રના ઉચ્ચાર સહ કેમ્પનો શુભારંભ થયો. પ્રાસંગિક ઉદ્ઘોધનમાં સંસ્થાના ટ્રસ્ટી મહોદ્ય આદ. ડૉ. રાજેશભાઈ સોનેજીએ સેવાધર્મનું મહત્વ સમજાવીને કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનારા સેવાભાવી મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો. આ હેલ્થ ચેક અપ કેમ્પમાં નીચે મુજબના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. CBC, SGPT (લીવર માટે) TSH(થાઇરોઇડ માટે), વિટામિન-ડી-૩, Lipid Profile (ક્રોલેસ્ટ્રોલ માટે), ક્લિઝિયમ (હાડકા માટે), Creatinine (ક્રીની), વિટામિન-B12, બ્લડ સુગર અને Uric Acid (વા માટે).

૭૨૭ વ્યક્તિઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા માટે ડૉ. રાજેશભાઈ સોનેજી ઉપરાંત શ્રી નીતાબેન લોહિયા, શ્રી પ્રજોશભાઈ પટેલ, શ્રી ચંપકભાઈ પરમાર્થી, શ્રી દીપકભાઈ શેઠ, શ્રી ધવલભાઈ અભી, શ્રી નરેન્દ્રભાઈ કાપડી વગેરે સેવાભાવી મહાનુભાવોએ બહુમુખી યોગદાન આવ્યું હતું. આ ઉપરાંત ગૃહપતિશ્રી મેહુલભાઈ પંડ્યા તથા ગુરુકુળના વિદ્યાર્થીઓ, શ્રી હરીશભાઈ વાંદેલા, શ્રી સુનીલભાઈ રાવલે પણ પોતાની સેવાઓ આપી હતી.

### સંસ્થામાં ડિસેમ્બરની આધ્યાત્મિક શિબિર સાનંદ સંપદ્રમણ

પૂજ્યશ્રી આત્માનંદજીના ૮૮મા જન્મદિન નિમિત્તે સંસ્થામાં તા. ૦૧-૧૨-૨૦૧૯ થી તા. ૦૩-૧૨-૨૦૧૯ ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના અનેક મુમુક્ષુ ભાઈ-ભહેનોએ શિબિરનો લાભ લીધો હતો. શિબિરનો પ્રારંભ દીપ-પ્રાગટ્યથી થયો.

**સ્વાધ્યાય :** શિબિર દરમિયાન પૂજ્યશ્રી આત્માનંદજીના સ્વાધ્યાય વીડિયો કેસેટના આધારે યોજાયા હતા. પૂજ્યશ્રીએ આશીર્વચન આપતા જણાવ્યું કે આપણે હોંશથી જન્મદિન ઉજ્વીએ છીએ, પણ વિચારણું કે દુર્લભ મનુષ્યભવ મળ્યો છતાં જોઈએ તેવું આત્મકલ્યાણ કર્યું કે નહિ? હવે બાકી જેટલા વર્ષો રહ્યા છે તેમાં ધર્મપંથે ચાલવાનો પૂર્ણ પ્રયત્ન કરવો. અંતરથી પરમાત્માનું શરણ લઈએ અને તેઓની આજ્ઞાનુસાર ચાલવા પ્રયત્ન કરીએ.

આદ. ડૉ. સુજાતાબેને ‘મોહનાશના ઉપાયો’ વિષય પર સ્વાધ્યાય આપતા જણાવ્યું કે વસ્તુ (પદાર્થ) નો નિર્ણય કરવા માટે સ્વાધ્યાય કરવાનો છે. આત્માનુભવ માટે વસ્તુસ્વભાવનો, તેના સાધનોનો અને જ્ઞેયનો નિર્ણય કરવો. આકુળતામાં દુઃખ અને નિરાકુળતામાં સુખ છે. મિથ્યાત્વ અને કખાય દુઃખના કારણો છે. શ્રી અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણી અરિહંતનો નિર્ણય કરીને સ્વાત્માનો અનુભવ કરવા પ્રયત્ન કરવો. જિનશાસ્ત્રોના અધ્યયન દ્વારા પદાર્થનો નિર્ણય થાય છે. સ્વ-પર બેદવિજ્ઞાનનો પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે. બેદવિજ્ઞાનની સિદ્ધિ માટે સર્વ સાધનો છે.

જ્યાપુર નિવાસી ડૉ. સંજીવકુમાર ગોધાએ જૈનદર્શનમાં M.Phil (ગોલ્ડમેડલ) કર્યું છે. ‘જૈનદાસ્થિતે ગ્રાલોક’ વિષય પર તેઓશ્રીએ Ph.D. કરેલ છે. શ્રી દિગંબર જૈન પંચાયત (તેરાપંથી) બડામંદિર, જ્યાપુરના તેઓ મહામંત્રી છે. તેઓશ્રી લિખિત અને સંપાદિત ૧૩ જેટલા પુસ્તકોનું પ્રકાશન થયું છે અને ૩૦ થી અધિક લેખો પ્રકાશિત થયા છે. સને ૧૯૯૭ થી અત્યાર સુધીમાં તેઓએ ૨૫,૦૦૦ થી વધારે પ્રવચનો આપ્યા છે. તેઓ દેશ-વિદેશમાં જૈનધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેઓશ્રીને અનેક એવોઈ એનાયત કરવામાં આવ્યા છે. શિબિર દરમિયાન તેઓશ્રીએ ‘ગ્રાલ લોકનું સ્વરૂપ’ વિષય અંતર્ગત વિશ્વની રચના, ગ્રાલ વાતવલયો, લોકની લંબાઈ અને ક્ષેત્રફળ, ગ્રસનાડી, વિગ્રહગતિ, મનુષ્યભવની દુર્લભતા, અસંઘ્યાત દીપ અને સમુદ્ર, અકૃત્રિમ ચૈત્યાલય, આવલી અને સમય, સંમૂર્ખીભ જીવો, સુમેરુપર્વત, જંબુદ્ધીપ, લવણ સમુદ્ર, કુભોગભૂમિઓ, ભોગભૂમિના જીવો, પાંડુકશિલા અને તીર્થકરોના અભિષેક, કલ્પકાળ, વિજ્યાર્થ પર્વત, ભરતક્ષેત્ર, વૃષભાયલપર્વત, ૮ પૃથ્વીઓ, નરક પૃથ્વીના નામ, નારકી જીવોના દુઃખો અને લેશ્યા, દેવોના પ્રકાર અને નિવાસ, નરકમાં જવાના કારણો, સ્વર્ગલોક, સ્વર્ગની રચના, વૈમાનિક દેવોના પ્રકારો, ૧૦૦ ઇન્નો, દેવગતિના દુઃખો, સિદ્ધશિલા, સિદ્ધાલય વગેરે બાબતોને પ્રોજેક્ટર દ્વારા ચિત્રો-આકૃતિઓ બતાવીને સુંદર સમજૂતી આપી હતી. તેઓએ આકર્ષક શૈલીમાં સ્વાધ્યાય આપીને સૌના હદ્ય જીતી લીધા.

પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્ભોધનમાં જણાવ્યું કે સંતની ઉપસ્થિતિ જ સ્વયં સ્વાધ્યાય બની જાય છે. પૂજ્ય સાહેબજી પાસેથી મને જે મળ્યું છે તેવું ક્યાંયથી મને મળ્યું નથી. સાહેબજી પાસેથી જે દર્શન મળે છે તે આપણો વારસો છે. પૂજ્યશ્રીએ અધ્યાત્મજગતમાં માનવીની પ્રતિજ્ઞા કરી. પૂજ્યશ્રી

પાસે સંસ્કૃતિકદર્શન છે, વ્યાપકતાનું દર્શન છે, વિરાટ દર્શન છે. તેઓ આપણને વિરાટ આકાશના દર્શન કરાવે છે. તેઓશ્રીની ૮૮ વર્ષથી જીવનયાત્રા આપણો વારસો હોય. પૂજ્યશ્રીએ કદ્દી લોકપ્રિયતાની ખેવના કરી નથી. પારદર્શિકાએ અને પ્રસન્નતા એ પૂજ્યશ્રીના વ્યક્તિત્વના અદ્ભુત પાસાઓ હોય. સંતના સ્પર્શે પારસમણિ બની જવાય. પૂજ્યશ્રીનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય. સંસારમાં આવતા ખાડાઓને ઓળંગી અધ્યાત્મના પંથે ચાલવાનો આપણે પ્રયત્ન કરીએ.

આદ. બા.બ્ર. સુરેશજીએ વચનામૃત પત્રાંક-૧૭૨ ના આધારે ભક્તિમાર્ગ, સત્પુરુષોનું માહાત્મ્ય, જીવની અનાદિકાળની ભાંતિ, દોષોનો સ્વીકાર, પ્રાયશ્ચિત, સદ્ગુરુની આવશ્યકતા, આજ્ઞાપાલનનું મહત્વ વગેરે બાબતો પર પ્રકારા પાડતા જગ્ઝાયું કે અનંતકાળથી જીવને સ્વરૂપ વિશે ભાંતિ રહી ગઈ છે. સ્વદોષદર્શન કરવું. ભૂમિકા વિના સાચું ધ્યાન થઈ શકે નાહિ. સરળ અને પારદર્શી જીવન બનાવવું. ધ્યેય (આત્મજ્ઞાન) ની પ્રાપ્તિ માટે શક્તિ વાપરવી. ઉપયોગને જ્ઞાનાભ્યાસમાં રોકવો. તે જ્ઞાનાભ્યાસ સત્પુરુષની આજ્ઞા અનુસાર કરવો.

**ભક્તિસંગીત :-** તા. ૦૧-૧૨-૨૦૧૯ ના રાત્રે આદ. શ્રી જ્ય અશોકભાઈ શાહે હદ્યના તારને ઝંકૃત કરી દે તેવી ભાવવાહી ભક્તિ દ્વારા સૌના હદ્યને પ્રભુ-ગુરુ પ્રેમથી ખાન્ચિત કરી દીધા હતા. તા. ૦૨-૧૨-૨૦૧૯ ના રાત્રે મુમુક્ષુ ભાઈ-બહેનોએ ભાવવાહી ભક્તિ કરાવી હતી.

**પ્રક્રિયા :-** શિબિર દરમ્યાન પ્રાતઃકાળની ભક્તિ, જિનાભિષેક, જિનપૂજા, સાયંકાલીન દેવવંદન વગેરે કાર્યક્રમો નિયમિતપણે યોજાયા હતા. શિબિર દરમ્યાન નીચેના દાનવીર મહાનુભાવો તરફથી સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું : - (૧) શ્રીમતી શારદાબેન ચીમનલાલ શાહ, મુખ્ય હસ્તે : શ્રીમતી વીજાબેન કમલેશભાઈ ગોસલિયા (૨) જ્યાગૌરી શંકરલાલ ખત્રી, હસ્તે : ડૉ. સોનેજી પરિવાર, અમદાવાદ (૩) શ્રી સુભદ્રાબેન જગજીવનદાસ તુરબિયા, હસ્તે : શ્રી કિરણભાઈ તુરબિયા, ચેમાઈ (૪) શ્રી તરલાબેન દિનેશભાઈ બાવીસી પરિવાર, રાજકોટ. શ્રી રેખાબેન પરમાર્થી, શ્રી રમાબેન દેસાઈ, શ્રી સુશીલાબેન કારાણીએ બોધાત્મક અને કલાત્મક રંગોળી બનાવી હતી. શ્રી સુધાબેન પ્રહુલભાઈ લાખાણી પરિવાર તરફથી પરિવારદીઠ પૂજયશ્રીના સુંદર ચિત્રપટની પ્રભાવના કરવામાં આવી હતી. પૂજયશ્રીના જન્મમંગળદિન નિમિત્તે પેંડા તથા ખજૂરની પ્રભાવના કરવામાં આવી હતી. આદ. શ્રી શરદભાઈ તેલીવાળાના સુપુત્રી રુચિબેને હુબ્ધી મુકામે ૬૦ જેટલા ઘેટા-બકરાંને અભયદાન આપ્યું હતું. તેઓની કરૂણા ભાવનાની કોબા પરિવારે અનુમોદના કરી હતી.

= સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા દાનવીર મહાનુભાવો =

સંસ્થાના વિવિધ વિભાગોમાં આર્થિક સહયોગ આપનારા નીચેના દાનવીર મહાનુભાવોને સંસ્થા સાબર ધન્યવાદ પાઠવે છે :-

સાધારણ ખાતું : (૧) શ્રી પ્રકાશભાઈ હેમેન્ડ્રભાઈ શાહ, અમદાવાદ રૂ. ૫,૦૦,૦૦૦/-  
(સંસ્થાના નવા ગેટ નિર્માણ પેટે)

(२) श्री विमलाबेन टी. सावला, मुंबई रु. २०,०००/-

(3) ਸੀ ਅੰਦੇਲਖੰਦ ਧਾਰਾ ਨਿਮਿਤੇ ਅਰਵੀ :

31. 4,00,000/-

ગરકળ : (૧) શ્રી દક્ષાબેન પી. શાહ, બરોડા ઝાંખેલી, ગુજરાત  
રૂ. ૭૮,૦૦૦/-

(स्वाभिवात्स्य)

ભોજનાલય : (૧) બા મુશ્કે શ્રી અચેતનભાઈ હિંમતલાલ શાહ પરિવાર મંદ્રદ ૩ । ૧ ૫૦

(କାଥମ୍ବି ତିଥି)

	(२) श्री. श्री परिमलभाई किशोरभाई खंधार, अमदावाद रु. २६,०००/- (शानदान, गुरुकुण, मेडिकल, साधारण खातु)
शानदान :	(१) श्री डॉ. सरलाभेन शाह, अमदावाद हस्ते : श्री चंद्रकांतभाई गोसालिया (गुरुकुण, भोजनालय)
	(२) श्री अशोकभाई पी. शाह, मुंबई (मेडिकल, वैयावच्य)
ऑडियो-वीडियो प्रोजेक्ट :	श्रीपालभाई आई. मહेता, (यु.एस.ए.) (हस्ते : श्री प्रवीषभाई वी. महेता) रु. १०,०००/-

**Foreign Contribution દ્વારા દાનરાશિ મોકલનાર દાતાઓ માટે**

**હવેથી નીચે જણાવેલ બેંકમાં દાનરાશિ મોકલવા વિનંતી.**

**BANK DETAILS FOR FOREIGN DONORS**

<b>IN FAVOUR OF</b>	SHREE SATSRUT SEVA SADHANA KENDRA
<b>NAME OF BANK</b>	KOTAK MAHINDRA BANK
<b>BRANCH</b>	CHANDKHEDA BRANCH, AHMEDABAD-382424
<b>A/C NO.</b>	8912898043
<b>IFSC CODE</b>	KKBK0000839
<b>SWIFT CODE</b>	KKBKINBB
<b>PAN NO.</b>	AADTS7538Q
<b>WEB</b>	www.shrimadkoba.org
<b>E-mail</b>	mail@shrimadkoba.org
<b>Tel. No.</b>	(079)-23276219 / 23276483 / 84

INCOME TAX EXEMPTION UNDER SECTION (80G) 5 OF THE INCOME TAX ACT,

1961. VIDE NO. CIT / GNR / 80G / GNR89 / 2008-2009

Income Tax Registration U/s. 12AA. 041910192

**ઇલા ગામમાં સત્સંગનું આયોજન**

મોટા ચિલોડા નજીક આવેલ ઇલા ગામમાં પટેલ સમાજ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિ તરીકે આદ. બા.બ્ર. સુરેશજીએ ‘મનુષ્યભવની દુર્લભના’ અને ‘સમયનું મૂલ્ય’ વિષયો અંતર્ગત સ્વાધ્યાય આપતા જણાવ્યું કે અતિ દુર્લભ મનુષ્યભવને પ્રામ કરીને આપણે આત્મકલ્યાશ અને પરકલ્યાશના કાર્યો કરવાં જોઈએ. વીતી ગયેલો સમયે કદ્દી પાછો આવતો નથી. માટે સમયનો સદુપયોગ કરી લેવો.

**ગુજર જાયેગા યે વક્તા ભી, જરા સફ્ર તો રખ,  
જબ ખુશી હી ન ઠહરી, તો ગમ કી ક્યા ઔકાત હૈ**



## પૂજય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીધરજી મ.સા. સાથે સત્સંગ વેળાએ



## સંસ્થાના સક્રિય કાર્યક્રમાં



સંસ્થાના ટ્રુસ્ટી આદ. શ્રી પ્રકાશભાઈ એચ. શાહના અમૃત મહોત્સવની ઉજવણી વેળાએ



આ. શ્રી સુધાબેન પ્રકુલભાઈ લાખાણીની સાધનાકૃતિરમાં સત્સંગ વેળાએ

Registered under RNI No. : GUJGUJ/2008/25883

Permitted to post at Ahmedabad PSO on 15th of every month under Postal Regd. No. : GAMC - 309/2018-2020  
issued by SSP Ahmedabad valid upto 31-12-2020 - Publication Date 15th of every month

## શ્રી દીપાવલી આરાધના શિબિર વેળાની તસવીરો



પૂજયશ્રીની પાવન નિશા



આદ. ડૉ. જિતેન્દ્રભાઈ શાહ



આદ. બા. બ. સુરેશજી



પ્રભુ મહાવીરને નિર્વાણલાદુ અર્પણ વેળાએ



### આ અંકના વિશિષ્ટ સહયોગી દાતા

૧

‘દિવ્યધનિ’ ડિસેમ્બર-૨૦૧૬ ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/- નો આર્થિક સહયોગ  
સ્વ. શ્રી પ્રકુળભાઈ કારાણીની પુણ્યસ્મૃતિ નિમિત્તે

દસ્તે : કારાણી પરિવાર, મુંબઇ

તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘ફાનદાન’ની અનુમોદના કરે છે.

૨

‘દિવ્યધનિ’ ડિસેમ્બર-૨૦૧૬ ના અંક માટે રૂ. ૨૧,૦૦૦/- નો આર્થિક સહયોગ  
શ્રીમતી હાર્દિકાબેન જગાદીશભાઈ ભીમાણીના સ્મરણાર્થે

દસ્તે : જીવણલાલ એમ. ભીમાણી પરિવાર, રાજકોટ

તરફથી પ્રાપ્ત થયેલ છે. સંસ્થા તેઓશ્રીના આ ‘ફાનદાન’ની અનુમોદના કરે છે.

Printed & Published by Smt. Dr. Sharmisthaben M. Soneji on Behalf of

Shrimad Rajchandra Adhyatmik Sadhana Kendra - Koba - 382 007. Dist. Gandhinagar (Gujarat).

Printed at Bhagwati Offset, 16/C, Bansidhar Estate, Bardolpura, Ahmedabad - 380 004. Editor : Shri Mitesh A. Shah

To,